


ISSN 0976 – 9609 V-Vidyanagar

વર્ષ: ૨૧ || અંક:૭ || જુલાઈ ૨૦૧૯ || સંખ્યા અંક: ૫૭૩

વ-વિદ્યાનગર



CHARUTAR VIDYA MANDAL

(Est: 1945)

Vallabh Vidyanagar-388120

www.vvidyanagar.co.in



ચારુતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સંસ્થાના કોમ્પ્યુટર એન્જિનીયરિંગ વિભાગ દ્વારા યોજાયેલ શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામના ઉદ્ઘાટન પ્રસંગે મંચસ્થ સી.વી.એમ.ના માનદ મંત્રીશ્રી ડૉ. એસ.જી. પટેલ, આઈ.આઈ.ટી રૂરકી ના પ્રોફેસર તથા મુખ્ય મહેમાન ડૉ. આર બાલા સુષ્ટ્રમનીયન, સંસ્થા ના આચાર્ય શ્રી ડૉ. હિમાંશુ સોની, વિભાગીય અધ્યક્ષા ડૉ. મૌલિકા પટેલ તથા એસ.પી.ટી.પી. કો-ઓર્ડિનેટર ગ્રો.પ્રીયાંગ ભૂજ દ્રશ્યમાન થાય છે. અન્ય તસવીરોમાં દીપ પ્રાગટ્ય કરતા મહાનુભાવો તથા મુખ્ય મહેમાનને સમૃતિ ચિન્હ અર્પણ કરતા અને પ્રસંગોચિત ઉદ્ઘોધન કરતા માનદ મંત્રીશ્રી નજરે પડે છે.



ચારુતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત ન્યુ વલલાભ વિદ્યાનગરની એ.ડી.આઈ.ટી. કોલેજના કોમ્પ્યુટર વિભાગના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી હેઠળ યોજાયેલ ગુજરાત હેકથોન સ્પર્ધામાં વિજેતા થવા બદલ રૂપિયા ૫૦,૦૦૦ ના ઈનામનો ચેક તથા પ્રમાણપત્ર અર્પણ કરતા ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુહાસમા, એ.આઈ. સી. ટી.ઈ. ના ચેરમેનશ્રી અનિલ સહસ્ત્રબુદ્ધે તથા ઈન્ફોસીસના કો. ફાઉન્ડર ગોપાલકિંનન સાથે માર્ગદર્શક પ્રાધ્યાપકો ડૉ. ભગીરથ પ્રજાપતિ અને ગ્રો. પ્રિયંકા પવાર દ્રશ્યમાન થાય છે.



તंत्री

ઉર્બિશ છાયા

પરામર્શન

નરેશ વેદ • રાજેન્દ્રસિંહ જાડેજા
જ્યાન્ત ઓઝા • ભગીરથ બ્રહ્મભંડ
આર.પી. પટેલ

સંપાદન-સહાય

અનિતા એ. સાણુંકે, વિજય સુથાર

પ્રકાશક

ડૉ. એસ.જી. પટેલ

માનદ મંત્રી, ચારુતર વિદ્યામંડળ
વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦

•

મુદ્રક

લજા કોમ્પ્યુનિકેશન્સ, વલ્લભ વિદ્યાનગર

વૃત્તિ અને પ્રવૃત્તિએ વિદ્યાનગરની વિભાવનાને મૂર્ત કરતું વિશાળ જ્ઞાનસંકુલ

પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ ગુજરાતી તથા અંગ્રેજ માધ્યમમાં શિક્ષણ સુવિધાઓ • ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંકુલના વિજ્ઞાન, સામાન્ય, ગૃહવિજ્ઞાન પ્રવાહ • ઉચ્ચ શિક્ષણ કેન્દ્રે વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, ઈજનેરી વિજ્ઞાન, ઔષ્ણ વિજ્ઞાન, લાલિત કલાઓ-ચિત્ર, સંગીત, નૃત્ય, શારીરિક શિક્ષણ, આયુર્વિજ્ઞાન, બાયોટેકનોલોજી, હોલેલ મેનેજમેન્ટ, ટુરિઝમ ટ્રેવેલના અભ્યાસક્રમોને આવરી લેતી કોલેજ ઔફ બિઝનેસ એન્ડ એડમિનિસ્ટ્રેશન, અંગ્રેજ ભાષાશિક્ષણ તથા પ્રશિક્ષણ વ્યવસ્થાની કોલેજ • અનુસ્નાતક કક્ષાએ વાણિજ્ય અને વ્યવસ્થાપન, વિજ્ઞાન, ઔષ્ણવિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, ઈજનેરી, દર્શનશાસ્ત્ર, અંગ્રેજ પ્રશિક્ષણના અભ્યાસક્રમો • વિવિધ વિદ્યાશાખાઓમાં વ્યાપક સંશોધનની સુવિધાઓ • કલા, વિજ્ઞાન અને માનવવિદ્યાઓના વિર્ભળની ભૂમિકા રચી આપાં પુસ્તકો-સામયિક પ્રકાશનો • વિદ્યારીય વાતાવરણને ધબકતું રાખતી વિવિધ વ્યાખ્યાનમાળાઓ • સર્જંકો, સારસ્વતો, કર્મચારીઓના સંભાનની ઉજ્જવળ પરેપરા, રમતગમત કેન્દ્રે રાષ્ટ્રીય સ્પર્ધાઓનું યુવકોનુંઘ આયોજન • પ્રાથમિકથી લઈ અનુસ્નાતક કક્ષાનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે છાત્રાલાયો, અધ્યાપક નિવાસો તેમજ આચાર્ય નિવાસોની સુવિધાઓ • સતત વિકાસની પરંપરામાં વલ્લભ વિદ્યાનગર ઉપરાંત ન્યૂ વલ્લભ વિદ્યાનગર ટાઉનશીપમાં વિવિધ અભ્યાસક્રમોવાળી શિક્ષણસંસ્થાઓની સ્થાપના થતી રહી છે • રાજ્યની પ્રથમ મહિલા ઈજનેરી કોલેજ, સરદાર પટેલના જીવન અને કાર્ય માટે દેશની સર્વપ્રથમ સંશોધન સંસ્થા તેમજ સમગ્ર ગુજરાતમાં અંગ્રેજ માધ્યમની સ્નાતક કક્ષાની પત્રકારત્વ અને સમૂહ માધ્યમોની કોલેજ • ગુજરાતની યુવાપેઢીને સનદી સેવાઓમાં પ્રવેશ આપવા માટેની સીવીએમ આઈએએસ એક્ટેડ્રી • કાયદાશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રની અનોખી કોલેજ • ઇન્ટ્રિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરની સ્કૂલ ઉપરાંત ફાઈન આર્ટ્સની ડિપ્રી કોલેજ.

- અંકની છૂટક કિંમત: ₹ ૧૫/- • રવાનગી ખર્ચ: ₹ ૧૦/- • વાર્ષિક લવાજમ: ₹ ૧૫૦/-
- વિદ્યાર્થી લવાજમ: ₹ ૧૦૦/- • આજીવન લવાજમ: ₹ ૧૫૦૦/-

વિ-વિદ્યાનગર
ચારુતર વિદ્યામંડળ પ્રકાશન
જુલાઈ - ૨૦૧૮
વર્ષ: ૨૧ અંક: ૭
સંપાદન અંક: ૫૭૩

ISSN 0976-9609-V Vidyanaagar

ચારુતર વિદ્યામંડળ
વલ્લભ વિદ્યાનગર ૩૮૮ ૧૨૦
સ્થાપના વર્ષ: ૧૯૪૫



અધ્યક્ષ

શ્રી ભીખુભાઈ બી. પટેલ

માનદ મંત્રી

ડૉ. એસ.જી. પટેલ

કુલપતિ

ડૉ. ભાવેશ પટેલ

માનદ સહમંત્રીઓ

શ્રી બી.પી. પટેલ • શ્રી એમ.જે. પટેલ • શ્રી મેહુલ ડી. પટેલ

શ્રી આર.સી. તલાટી • શ્રી વી. એચ. પટેલ • શ્રી કે.એસ. પટેલ

વલ્લભ વિદ્યાનગરના આચાર્યાપકો પૈકી એક ભાઈકાએ ઈ.સ. ૧૮૮૪માં આ વિદ્યાકેન્દ્ર ઉપરથી એક સામયિક પ્રકાશિત થાય જેમાં સાહિત્ય અને શિક્ષણ વિષયક સંસ્કારલક્ષી સામગ્રી રજૂ થાય અને ઉચ્ચ અભ્યાસ અર્થે આવતી કિશોર-યુવાપેઢી એથી લાભાન્વિત થાય, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ એમાં સક્રિય રસ લેતા થાય એવી મનીખા પ્રગટ કરી હતી. ફિલ્સ્વરૂપ ૧૮૮૮નવેમાં રેજન્સ્ટ્રેક્ચર-વલ્લભ વિદ્યાનગર' પાક્ષિકનો આરંભ થયો. પછીથી એ માસિક સ્વરૂપે 'વિદ્યાનગર' નામે પ્રગટ થતું રહ્યું. | વિ | નામે એનો ગ્રીજો અવતાર થયો ત્યારથી પૂર્વ અધ્યક્ષ ડૉ. સી. એલ. પટેલની નિસબત અને ઉદારતાના ફળસ્વરૂપે તે નવપલ્લવિત થયું, અને ઈ.સ. ૧૮૮૮થી નિયમિતપણે 'વિ-વિદ્યાનગર' એ નામથી પ્રકાશિત થતું રહ્યું છે.

વિ-વિદ્યાનગર
'વિ-વિદ્યાનગર' www.vvidyanagar.co.in
 પર મુક્કવામાં આવે છે. દેશ-વિદેશના વાચકોને
 પ્રતિભાવ જણાવવા વિનંતી.

આષાઢસ્ય પ્રથમદિવસે મેઘમાશિલિષ્ટસાનું
 વપ્રક્રીડાપરિણતગજપ્રેક્ષકીય દર્શર્થી।
 તસ્ય સ્થિત્વા કથમપિ પુર:
 કૌતુકાધાનહેતોરન્તર્બાષ્પિક્રવરમનુચ્ચરો
 રાજરાજસ્ય દદ્યા।
 સંદર્ભ કાલિદાસ ગ્રન્થાવલી



પરાગ જો અંતરમાં હશે તો, પાંગરીને કદી પુષ્પ ખીલશે,
 મનોરથો સવન્ન મહી હશે તો, સિદ્ધ રૂપે કાર્ય વિષે જન્મશે.

-ઉમાશંકર જોશી
 (અમીઝરણામાંથી સાભાર)

કુલપતિની કલમે Education in India during British Period– V
» ડૉ. ભાવેશ પેટેલ..... ૦૩
પ્રાથમ્ય કોધને કાબૂમાં રાખવાનો કીમિયો.
» એસ.જી.પેટેલ..... ૦૪
આપણો વૈભવ અને વારસો (પદ વિભાગ)
» અક્કલદાસ, કલ્યાણ, ગૌરીભાઈ, મોરારદાસ૦૭
આપણો વૈભવ અને વારસો (ગદ વિભાગ)
» માનવી ઊંચાણની પારાશીશી..... ૦૮
નવાં કાલ્પના
» ગ્રવીણ દરજી, નરેશ સોલંકી, પરબતકુમાર નાથી, દુરેશ કાનાણી, જગાદીશ ધનેશ્વર ભડુ ૦૯
ચિંતન ભારતીય આદર્શો
» નરેશ વેદ ૧૦
નવલિકા શુક્રન-અપશુક્રન
» મનસુર રવૈયા..... ૧૩
સમીક્ષા 'બા વગરનું ઘર' અધૂરપની મધુરપ
» હૃદેન્દ્ર પંચયા ૧૫
ગ્રાસંગિક આ પણ રાષ્ટ્રોમ છે
» મનસુખ સલ્વા ૨૫
અભ્યાસ આપત્તિ વ્યવસ્થાપન : ઓળખ, આવશ્યકતા અને કાર્યવાહી
» મૃગેશ નાયક ૨૭
અભ્યાસ Cyber Crime: Types and Analysis
» Rajiv Maheshbhai Patel ૩૧
આસ્વાદ કવિશ્રી ભાવેશ ભહુની એક સુંદર ગઝલ...
» અદ્યેશ કળસરિયા ૩૬
રમત-જગત ઓલિમ્પિકની અજાયબી મહિલા એથ્લેટ : વિલ્મા રૂડેલ્ફ
» પી.ડી.શર્મા..... ૩૭
વિદ્યાવૃત્ત
» ૩૮

Education in India during British Period- V

Dr. Bhavesh Patel

This is the fifth article on 'Education in India during British Period'. With the onset of 20th century, the Indian brains (individuals and Institutions), initially voiced by Gopal Krishna Gokhale, started emphasizing on the need for having organized system of free, compulsory and universal education based on cultural inheritance of India. However, initially, these voices were not heard and unfortunately, Hartog Committee (1929) partially brought back Macaulay's filtration plan.

However, the period preceding independence was important in terms of setting a tone for post-independent India for its educational policies. This dawn of independence saw two major policy initiatives, namely "Wardha Scheme of Basic Education-1937" and "Sargent Plan 1944". In this article, we will discuss the Wardha Scheme of Basic Education and the unfortunate feet that it met.

The Government of India Act (1935) passed by the British Parliament came into effect in 1937. This Act paved the way for democratically elected governments at the province level, and kept local governments out of the sphere of education, dividing all educational activities between Central and Provinces. Indian National Congress came in power in seven out of eleven provinces in 1937, and immediately undertook the main agenda of having an education system that suits the Indian culture.

Central Government appointed the Abbot-Wood Committee. Their report (1936-1937) stated that it is not good to separate general education and vocational from each other and that vocational students should have an adequate general education.

Meanwhile, Gandhiji, who was so much conversant with the pathetic state of education in India that in 1937 he started penning down his thoughts on Indian education in "Harijan". His main contentions were,

- Education is an effective instrument of national reconstruction.
- The present system of education is not only wasteful but also positively harmful.
- Students will pick up evil habits.
- English has created a permanent bar between the highly educated few and the uneducated many.
- Knowledge without character is one of the seven sins.
- The primary education must be based on Indian tradition, in vernacular language and it must be compulsory for all.
- We should concentrate on educating the child properly through manual work not as a side activity but as a prime means of intellectual activity.
- Man is neither mere intellect, nor the gross animal body, nor the heart or soul alone. A proper and harmonious combination of all the three is required for the making of the whole man and constitutes the true economics of education.

The series of thoughts expressed by Gandhiji became the basis for organizing All India Education Conference on 22-23 October 1937. This Conference is called a Wardha Educational Conference that was presided by Mahatma Gandhi. Wardha Conference appointed a Committee under the chairmanship of Dr. Zakir Hussain, who later became President of India.

Wardha Scheme of Education made several suggestions, important of them are listed below:

1. Mother tongue shall be the medium of instructions.
2. Children from age 6 to 14 (up to standard eight) shall get free and compulsory education, and that shall be divided in two stages; the junior stage of first 5 years and the senior stage of next 3 years.
3. Education shall be centred around some form of productive work and for that, we shall use the social and physical environment in addition to craft.
4. The craft cannot fully support the financial needs of a school, therefore, the self-supporting concept cannot work and the government shall fund the free and compulsory education.
5. We shall abolish external examinations and give emphasis on the day-to-day work of the student in evaluating their performance.
6. We shall avoid the use of textbooks as far as possible.
7. We shall lay emphasis on cleanliness, health, citizenship, play and recreation because these are of great importance.
8. A school day of five and one-half hour shall be roughly divided as follows:
 - » Physical activities (20 minutes)
 - » Mother tongue knowledge (20 minutes)
 - » Social studies and general science (60 minutes)
 - » Art (40 minutes)
 - » Arithmetic (20 minutes)
 - » Craft, citizenship, health, recreation, etc. (2 and one-half hour)

Some scholars have found some of the proposals of the Wardha scheme unsuitable to the new environment at the time of the study. However, overall, it is largely lauded by several scholars. The Wardha scheme was quite original and Indian in nature, addressing almost all aspects of personal and social life. Unfortunately, the scheme could not be implemented because of the Second World War that started just after that on 3rd September 1939.

Kulpati
Charutar Vidya Mandal

This article has taken some extracts from <http://www.kkhsou.in/main/education/wardha.html> accessed on 15th May 2019.

કોધને કાબૂમાં રાખવાનો કીમિયો.

એસ.જી.પટેલ

સામાન્ય રીતે દરેક માણસ કોઈક સમયે ગુસ્સે થઈ જતો હોય છે. પણ, જો આ ગુસ્સો પ્રયંચ કે પ્રકોપમાં રૂપાંતરિત થઈ જાય તો એ તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ સામેની વ્યક્તિ સાથેના સંબંધોમાં ભારે નુકસાની સરળ શકે છે. અનિયંત્રિત કોધ અને માનસિક વિકૃતિ અથવા તો સમસ્યાઓથી ઘેરાયેલ વ્યક્તિત્વ તરફ અંગુલીનિર્દેશ કરે છે. લાગણી પર કાબૂ મેળવવો અને શાંત સ્વરૂપ ધારણ કરવું એ આપના અને અન્યના ભલા માટે અત્યંત જરૂરી છે. તો ચાલો આપણે કોધને સમજવા કોશિશ કરીએ.

ગુસ્સો એ એક મનોવૈજ્ઞાનિક લાગણી છે, પણ તેને શારીરિક પણ ગણાવી શકીએ, કારણ કે તેનાથી મગજમાં રસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. જ્યારે તમે ગુસ્સે થાવ છો ત્યારે તમારી લાગણીઓને સંભાળ રાખતું કેન્દ્ર દુઃખની લાગણીવાળા સંકેતો હાયપોથેલેમસ ગ્રંથિને આપે છે. આ ગ્રંથિ એપોનેઝીન ઉત્પન્ન કરે છે. એપોનેઝીન શરીરના જ્ઞાનતંત્રાનો થડી સંવેદનશરીર ચેતાતંત્ર મારફતે એન્નીનિલ ગ્રંથિ સુધી પહોંચે છે. એનીનિલમાંથી ઉત્પન્ન થયેલ એન્નીનિલન આખા શરીરમાં પહોંચે છે. એન્નીનિલનના લીધે શરીરમાં પ્રતિકારશક્તિ ઘટી જાય છે. તેથી હૃદયના ધબકારા વધી જાય છે અને જ્ઞાનેન્દ્રિયો સતેજ બની જાય છે. આ પ્રક્રિયા એ જૈવિક જરૂરિયાતો પૂરી પાડે છે, જેમને સામનો કરવો અથવા હડી જરૂરું, પરંતુ જો તમારો ગુસ્સો ધરાવતી પ્રકૃતિ હશે તો આ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા રસાયણોની માત્રા ઘટી જાય છે.

ગુસ્સો કેટલીકવાર બીજી લાગણીઓ ઉપર છવાઈ જાય છે. ગુસ્સો એ ઉદાસીનતા, હતાશા, ભય કે કોઈકની લાગણી દુભાવવી જેવી બાબતો પર આધારિત બની જાય છે. ગુસ્સો કોઈકવાર બચાવ પ્રયુક્તિ બની જાય છે કારણ કે તે ઘણા લોકો માટે અન્ય લાગણીની સરખામણી જલ્દીથી પ્રદર્શિત થઈ જાય છે. એવો વિચાર કરો કે તમો તમારી બધી લાગણીઓના સંવેદનો અનુભૂતિ થાય જ નહીં. જ્યારે તમો ઉપર બતાવેલો નકારાત્મક લાગણીઓ સહન કરી શકતા નથી ત્યારે એકાએક ગુસ્સો પ્રદર્શિત થઈ જતો હોય છે, આવા સંઝોગોમાં મનોચિકિત્સકની સલાહ લેવી હિતાવહ છે.

ગુસ્સો એ ખરાબ લાગણી છે એવું કાયમ માટે દોતું નથી. ગુસ્સો કોઈકવાર કંઈક ખોટું થતું હોય અથવા અઘિત આંક્ષેપો થતા હોય તેની સામે ઢાલ સ્વરૂપ બની તંદુરસ્ત હેતુ માટે ઉપકારક બની જતો હોય છે. જ્યારે કોઈક તમારી લાગણી દુભાવવાના હેતુસર પ્રયત્ન કરે ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક બને છે. તેનાથી સામેની વ્યક્તિ સાથે શાબ્દિક અથડામણ થઈ જતી હોય છે. કેટલાક લોકો ઉપદેશ આપતા હોય છે કે ગુસ્સે થવું કે ગુસ્સો અનુભવવો એ અસંસ્કારી બાબત છે. પણ, ગુસ્સો આવવાની પ્રકૃતિજ્ઞન્ય બાબતને દબાવી રાખવી એ તમારી અન્ય લાગણીઓ પર નકારાત્મક અસર જન્માવે છે, અને બીજા લોકો સાથેના સંબંધો પર માટી અસર જન્માવે છે.

આપણને એવું લાગે છે કે ગુસ્સો ક્યાંક જરૂરી છે, હિતાં ગુસ્સો મોટે ભાગે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ગુસ્સો આવી જાય એવા સંઝોગોમાં જો થોડી સાવયેતી રાખીએ તો મોટા નુકસાનમાંથી આપણી જાતને સાચવી શકીએ હીએ. દા.ત. હાથમાંથી દૂધ ભરેલી તપેલી પરી જાય અથવા કાણનું વાસણું સહેજ ઘકાથી કે અથડામણથી તૂટી જાય એવી ઘટનામાં ગુસ્સે થઈ જવાબદાર (નિમિત્ત) વ્યક્તિ પર ગુસ્સો કરવો જરાપણ વ્યાજબી નથી. તમો જ્યારે ગુસ્સે થાવ છો ત્યારે તમારી વર્તણૂક આક્મક બની જાય છે જેમાં ચીસો પાડવી, મોટેથી બોલવું અથવા હાથ ઉગામવોનો સમાવેશ થઈ જાય છે. આ સમસ્યા વાણી જ ખરાબ છે, કારણ કે આવી પ્રકૃતિવાળા લોકો આવું વારંવાર જાણે-અજાણે કરી બેસતા હોય છે. આવા સ્વભાવના લોકો વ્યસની બની જતા હોય છે. જેઓ નશાકારક દવાઓ કે નશાકારક પીણાના ભોગી બની જાય છે તેઓ વારંવાર ગુસ્સામાં આવી કંઈક ન કરવાનું કે બોલવાનું બડી જતા હોય છે. જેમના માટે ગુસ્સો એ **Chronic** બીમારી બની ગયો હોય એમના માટે કેટલાક સહજ ઉપયોગી ચર્ચા કરીએ.

કસરત નિયમિતપણે કરવાથી આપણા શરીરમાં ઇન્દોરફીનનો સ્વાવ થતો હોય છે કે જે તમને શાંત રાખવામાં મદદ કરે છે અને પ્રયંચ ગુસ્સા તરફ જતાં અટકાવે છે. આમ નિયમિત કસરત કરવાથી હાનીકારક લાગણીઓ પર સરળતાથી નિયંત્રણ લાવી શકાય છે. જ્યારે કસરત કરતા હો ત્યારે તમારી વિચાર કરવાની પ્રક્રિયા અને શરીરના અવયવો પર ધ્યાન ડેન્જિન્ટ કરતા રહેવું. રોંઝિંદી કસરતોમાં ચાલવું, ધીમી દોડ, સાઈલ ચલાવવી, યોગ કરવો, તરવું, નૃત્ય અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. યૌવનકાળમાં આશરે દી થી કલાકની

ઉંઘ જરૂરી હોય છે. પૂરતી ઉંઘના અભાવે આરોગ્યની સમસ્યાઓ શરૂ થાય છે જેનાથી લાગણીઓ પરનું નિયંત્રણ ગુમાવે છે. પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવાથી તમારો મૂડ સારો રહે છે અને ગુસ્સો આવે તેવી ઘટનાઓ ઘટતી જાય છે. જો તમારી ઉંઘ બાબતે અસખ્ય સમસ્યા રહેતી હોય તો તમારા ફીઝીસીયનની સલાહ લો. તેમની સૂચના અનુસાર ખાણીપીણી કે જીવન શૈલીમાં યોગ્ય ફેરફાર કરવાથી ઉંઘની માત્રામાં સંતુલન સાચવી શકશો તમો જરૂરી હબ્લલ કે પૂરક દવાઓથી પણ ઉંઘની માત્રા વધારી શકો.

ઉપર જાણાવ્યા મુજબની સલાહનું પાલન કર્યા પછી પણ ગુસ્સા પરનું નિયંત્રણ કાબૂમાં ન આવે તો, તમારા ગુસ્સાનું કારણ વિશે તમારી ડાયરીમાં લખવાનું ચાલુ કરો. જો તે જવાબદાર વ્યક્તિ કે ઘટના વિશે સાચું નિરપણ કરવામાં કોઈ સંકોચ કે કચાશ ન રાખવી. ઘટનાક્રમમાં પરિસ્થિતિનો દોષ જોવા કરતાં તમારામાં કંધો દોષ જવાબદાર બન્યો તેની છાણાવટ કરો. આપણે પરિસ્થિતિ કે તેમાં સંડોવાયેલ વ્યક્તિને બદલી શકતા નથી, પણ, આપણે જો બદલી શકીએ તો એ આપણી પોતાની જાત ને જ. આવો સંકલ્પ અને તેની નોંધ અવારનવાર કરવાથી આપણે કઈ વાતથી ઉશ્કેરાઈ જઈએ છીએ તે પકડી શકાશો. આપણી ડાયરીમાં થયેલાં લખાણોનો અભ્યાસ કરવાથી ગુસ્સાનાં કારણો અને ઉપાયો પણ મળી રહેશે. એકવાર તમને ગુસ્સો આવવાનાં કારણોની જાણકારી થશે એટલે તેના નિવારણના વિવિધ ઉપાયો સૂચવા લાગશે બધા ઉપાયો કારગત નીવડે એવું બનતું નથી. પણ ઉપાયોના અનેક રસ્તા પૈકી કોઈક માર્ગ આપણને અનુકૂળતા જરૂર કરી આપશો.

ગુસ્સો આવવાનું મૂળ કારણ જાણી લેવાથી અને ઘટનામાં સામેલ બંને પદ્ધકારોના હિતોનું સંમાન કરવાથી, ગુસ્સો શાંત પાડવાનો રસ્તો સૂઝે છે. આ બાબતમાં આપણે સત્યતાના આગ્રહી બની અરસપરસનું માન જાળવી, સ્પષ્ટ વાણી વ્યવહાર કરવાથી લાગણી યોગ્ય રીતે રજૂ કરી શકાશો. દા.ત. તમારા પાડેશીના ઘરમાં વીચા અવાજે સંગીત વાગતું હોય અને તમારા કાર્યમાં વિક્ષેપ પડતો હોય તો ગુસ્સો આવી શક છે. આ સમયે તેની સામે ગુસ્સો કરી જગ્હા કરવાને બદલે એવું કહી શકાય કે- “હું સમજું છું કે તમને કામ કરતાં સંગીત સાંભળવાનું ખૂબ જ ગમે છે,

પણ એ જ સંગીત મને મારા કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. મારી આપને નખ વિનંતી છે કે તમો Headphoneનો ઉપયોગ કરી તમો સંગીત મારી શકો છો અને બીજા બધાને ગમતું શાંત વાતાવરણ આપવામાં આભારી બની શકશો.”

હવે તો કેટલીક વેબસાઈટ પર ગુસ્સો નિવારણ કેન્દ્ર દ્વારા આપવામાં આવતા વિશિષ્ટ કાર્યક્રમો ઉપલબ્ધ છે. વળી તમારા ફીઝીસીયન કે થેરાપીસ્ટ દ્વારા સ્વ-વિકાસના ટૂંક ગાળાના અભ્યાસક્રમો સ્થાનિક સામાજિક સેવા કેન્દ્રો પર મળતા હોય છે. જો તમારી ગુસ્સાની માત્રા એટલી વધી ગઈ હોય કે જેથી રોજિંદા જીવનમાં સમતુલ્ય ગુમાવી બેસો અને સામાજિક સંબંધોમાં બટરાળ વધી જાય તો થેરાપીસ્ટનો સમયસર સંપર્ક કરી લો. થેરાપીસ્ટ તમારી સમયાના મૂળ સુધી જઈ તમારે કેવા પ્રકારની થેરાપી, મેડી ટેશન કે બંનેની જરૂર છે તે નક્કી કરી આપશો. તે આપને ગુસ્સો કરવાના સંજોગોમાં તમારી જાતને કેવી રીતે સંભાળી લેવી એ સમજાવશો. આપને યોગ્ય થેરાપીસ્ટ ન મળે તો નીચેની બાબતો ઉપયોગી થશે.

જ્યારે તમને લાગે કે આ બાબતથી ગુસ્સો થવાનો છે તો તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે અટડી જાવ અને થોડો ઊંડો શાસોશાસ કરી યોગ્ય પ્રતિભાવ આપો. પ્રતિભાવ એટલે યોગ્ય વિચારણાને અંતે બોલાયેલ શબ્દો. થોડીક ક્ષણો માટે એ ઘટના સ્થળેથી દૂર ખસ્તી જાવ. પછી તમો કહી શકો કે આ બાબતે હું વિચારણા કરી પછી તમારી સાથે વાત કરીશ. આમ કરવાથી તમારી જાતને શાંત પાડવામાં સહાયતા મળી રહેશે. જો તમો કામના સ્થળ પર છો અને ગુસ્સો આવી જાય તો ઓફિસની બહાર નીકળી જઈ થોડી મિનિટ લટાર મારી આવો. જો તમો તમારા ઘરમાં છો અને આવી ઘટના બની જાય તો ઘરના સભ્યોથી તમારી જાતને એકલતા આપાવે તેવી જગાએ પહોંચી જાવ અથવા તમને સમજી શકે તેવા સ્નોહીજન પાસે પહોંચી જઈ તમારી લાગણીઓ ખુલ્લાંની કરો.

માનદ મંત્રી,
ચારુતર વિદ્યામંડળ વલલાભ વિદ્યાનગર
(ફેન. ૦૨૬૯૦૨૮૮૪૦૦)

॥ આપણો વૈભવ અને વારસો ॥ (પદ વિભાગ)

અમને ગુરુજી વાલા અંતરમાં જોગણ થઈ લડાવું રે મારા જંતરમાં....

અમને ગુરુજી વાલા અંતરમાં, જોગણ થઈ લડાવું મારા જંતરમાં,
એ વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં....

જળના સૌ જવ, કોઈનું બીજ નથી જૂઝાવું વહાલા!

હે...એનું તાલકું વધી જાય ગુરુના તંતરમાં....

જોગણ થઈ... વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં....૦
આઈની કમાણી સૌને આઈં આડી આવશે વહાલા!

હે...સત્ય વહોરી લેઝો ગુરજીના છતરમાં....

જોગણ થઈ... વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં....૦
નારીએથી નર મોટા અમુલાભ હીરા નીપણે વહાલા!

ઈ પરભોમે પૂજય ગુરુના પતરમાં..

જોગણ થઈ... વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં....૦
સિધ્યા રે અક્કલદાસ ગુરુ ભીમ કેરે શરણે વહાલા !

હે...મારું મનનું મોખેલ નૈ માયાના મંતરમાં..

જોગણ થઈ... વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં....૦

પાડાંતર :

(કહે રે અક્કલદાસી ત્રિકમ ચરણો, વહાલા !

મારું મનનું મોખેલ નૈ માયાના મંતરમાં..)

-અક્કલદાસ

આ પલ જાવે રે, કરી લેને બંદગી..

(લાલદાસના નામે પણ ગવાય છે.)

ગઈ પલ ફેર નહીં આવે રે, કરી લે ને બંદગી;

આ પલ જાવે રે, કરી લેને બંદગી....

કરો મન જ્યાના, ધરી લેને-ધ્યાના;

મૂરખા ! મૃગજળ દેખી કરું લલચાવે રે...

- આ પલ જાવે રે, કરી લેને બંદગી...૦

શિરને માથે છે વેરી, લીધો તું ને ધેરી;

સૂતાં બંધા નીંદરા તું ને કેમ આવે રે...

-આ પલ જાવે રે, કરી લેને બંદગી...૦

એક દિન મરના હૈ, ધોખા નવ ધરના;

મુખમેં રામનામ કેમ ભૂલાવે રે...

-આ પલ જાવે રે, કરી લેને બંદગી...૦

કહે છે કલ્યાણ' સાબ, સતગુરુ શરણો,

આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે...

-આ પલ જાવે રે, કરી લેને બંદગી...૦

-કલ્યાણ

બ્રહ્મનો ભેદ...

બ્રહ્મનો ભેદ જાણ્યો જને અનુભવી, ભેદ જાણ્યા વિના બ્રહ્મન જાવે; બર્મ ભાગ્યા વિના કર્મ કહે કયમ ગળે? કર્મ ગળ્યા વિના મર્મ ન પાવે...

મરમ લક્ષ્યા વિના સંશય નવ ટળે, સંશય ટખ્યા વિના સર્વ કાચું; કથાણી કથે અને અર્થ બહુ અનુભવે, રહેણી વિના કયમ પામે સાચું?

સાચા સિદ્ધાંતનું હિરદ સમજે નહીં, સમજુને અરથ ના કંઈ સરતો; આત્મા-શું આત્મા, બુદ્ધિ થકી જોય તો, તેણે કરી વાસનાલિંગ ન ગળતો...

આણલિંગી તમે અનુભવી જાણજો, તેમજ તત્ત્વદર્શી રહે રે જોઈ; ગલવરી આત્મા-પરમાત્મા એક જ ભયે, દૈત ભાવ નવ ભાસે કોઈ...

-ગૌરીભાઈ

લાવો લાવો કાગળિયો ને દોત..

લાવો લાવો કાગળિયો ને દોત, લખીએ હરિને રે; એવો શિયો રે અમારલો દોષ, નો આવ્યા ફરીને રે...

-લાવો લાવો કાગળિયો ને દોત...૦

વઢાલા! દૂધ ને સાકરડી પાઈ, ઉછેર્યા અમને રે; હવે વખડાં ઘોળો મા, મા'રાજ! ઘટે નહીં તમને રે...

-લાવો લાવો કાગળિયો ને દોત...૦

હે જુ હરજી! હીરને હીંયોળે રાજ, હીંયોળ્યાં અમને રે, હવે તરછિડો મા, મા'રાજ! ઘટે નહીં તમને રે...

-લાવો લાવો કાગળિયો ને દોત...૦

હે જુ હરજી! પ્રેમના પછેડા રાજ! ઓફેલ અમને રે, હવે બેંચી લિયો મા, મા'રાજ! ઘટે નહીં તમને રે...

-લાવો લાવો કાગળિયો ને દોત...૦

હે જુ વઢાલીડા! ડોડા કૂવામાં આજ, ઉતાર્યા અમને રે, હવે વરત વાડો મા, મા'રાજ! ઘટે નહીં તમને રે...

-લાવો લાવો કાગળિયો ને દોત...૦

ગુણલા ગાય છે રવિ-ગૂરુ ભારા, ક્રિકમ બેડી તારો રે, એવી પકડો મોરારની બાય, ભવસાગર ઉતારો રે...

-લાવો લાવો કાગળિયો ને દોત...૦

-મોરારદાસ

॥ આપણો વૈભવ અને વારસો ॥ (ગદ વિભાગ)

માનવી ઊંચાણની પારાશીશી

સ્વામી આનંદ

અજ્ઞાત સૈનિકનાં સ્મારક કરવાની ને તેને અંજલિ આપવાની આજના કાળમાં પેઢેલી પ્રથા બહુ યોગ્ય છે. કારણ, ખરા અર્થમાં મોટખોટા રાજ્યબુરુંધરો કે સેનાપતિઓ કરતાં સામાન્ય સૈનિકનો, કે લડાઈના મજજુનો, ફાળો લડાઈઓની હારજીતમાં કો વાતે ઓછો નથી હોતો. બલ્કે, લડાઈઓના મેદાનમાં રાતાહિવસ ધૂમી તોપ, બોંખ કે ગેસનાં ખાજ બનતો, કે ટ્રેન્ચોનાં ક્રીયાપાણીમાં પગ કોહવતો અનામી સૈનિક જ પ્રત્યક્ષ લડાઈ જીતે છે. એને ભામાવીને પોતાનો કરી લીધા વગર નર્થો ધોયેલ મૂળા જેવો મૂલ્યસ્વી કાબે લૂંટ્યા અર્જુન જેવો નિસ્તેજ ને લાયાર છે. લશ્કરોનો અદ્દનો આણુંયો સૈનિક જ એનું એવાતણ છે. કારણ એ સૈનિક જ હંકરુંભની માયા મેલીને હથેળીમાં માયું લઈ પોતે માનેલા કે તેને મનાવવામાં આવેલા દેશ, ધર્મના દુશ્મનોને વાચ્યા - અને તેમ કરવામાં પોતાના પ્રાણ પાથર્યા.

આમ, એક ભોગો શૂરો અજાણ્યો સૈનિક પણ જો આપણા સ્મારક અને આદરઅંજલિને પાત્ર છે, તો પછી જેણે બૂંગિયા

ઢોલ કે લશકરી બેંડવાળાના કશા આવેશ ઉશ્કેરાટ વગર, ને કોઈનો પણ જુવ લીધા વગર, સમાજને અંધારે ખૂણે રવ્યાંરવ્યાં, પોતીકાંને ખાતર જાત ધસીને ટીપેટીપે પોતાનાં લોડી આટબ્યાં; જેમણે સમાજના કૂણા છીડ ઉછેરાથેરી તેનાં ખમીરકેળગ્યાં ને પ્રજાઓને ટ્વાર રાખી; એવા સંસારનાં સરેરાશ કોટિનાં અગણિત અજ્ઞાત ધરસંસારી માનવીઓને આપણા તરફની એવી આદરઅંજલિને પાત્ર કાં ન ગાંધીએ? જો સંસારના જગઝગાટ વચ્ચે પોતાની અસામાન્ય શક્તિઓ દેશની અને સમાજની સેવામાં અર્પનારા નેતાઓ અને સમાજસેવકો આપણા પૂજારાધ્ય છે, તો વધુ તકને અભાવે ધરને ખૂણે રવ્યાંરવ્યાં વસમાં દુઃખ વેઠીને પણ પોતાનાં ફરજાંદોનાં ધાતર પાછળ છાડ ગાળનારા સામાન્ય શક્તિનાં અનામી માનવીઓ પણ ખચિત આપણી ભાવભક્તિભરી અંજલિને વધુ પાત્ર છે.

કારણ અંતસ્તરવાળે તો સંસારનાં એવાં અસંખ્ય અનામી માનવીઓનું ડાંઢું એ જ દરેક જમાનાની માનવતાની ઊંચાઈ કે ઠીંગાણાઈનું માપ કાઢવાની ખરી પારાશીશી છે....

-‘ધરતીનું લૂણ’ માંથી સાનાર

ત્યારે

પ્રવીણ દરજી

બે જાણ
પોતાને નામ શેષ કરી
એકમેકના
આત્મામાં પ્રવેશી
શ્રાવણી તૃણાનુ
પીળચંદુ પુષ્પ
અની રહે છે
ત્યારે-
તેમની આસપાસ
ઈથરનો પદરવ
સંભળાય છે.
સૂર્ય સાવ ધીમો પડીને
તેમને લાડ કરે છે.
ચંદ તેઓને
ખોળામાં લઈને
થપથપાવતાં
દ્વાલ કરે છે
વરસાદ
જરમરી જરમરી
હાલરું ગાય છે
હાલરડાના શબ્દે શબ્દે
માટી
મહેક મહેક થઈ રહે છે!
બે જાણ
નામ શેષ થાય છે ત્યારે!

કુવારા પાસે, લુણાવાડા
જી. મહીસાગર
(ફોન) ૯૮૨૫૪૫૬૫૫૧

ગઝલ

નરેશ સોલંકી

ગાડું છે હંકાર્યા કર તું
મન-સમજણને ચાર્યા કર તું
કાગળ ઉભો વાંસ લીલો છે
વાત વિગત ફટકાર્યા કર તું
મેના પોપટ મીનીરાણી
કેવળ બચપણ ઘાર્યા કર તું
છેવટ સૌ શિકાર કરે છે
રાતદિવસને માર્યા કર તું
જરમર જોકું જીવ લગોલગ
દ્વાર સળગતું ઠાર્યા કર તું

મવરી પોલીસ ડેડ કવાટર
બ્લોક નં.-૪, કવાટર નં.-૪૦
નાના મવા રોડ, રાજકોટ
મો. ૯૮૦૪૩૬૨૨૩૦

ગઝલ

તરસ કાંઠે રહી

પરબતકુમાર નાયી 'દદ્દ'

નદીને છે વ્યથા એની તરસ કાંઠે રહી કાયમ,
નથી કોઈ દવા એની તરસ કાંઠે રહી કાયમ !

નજરમાં બાગને રાખી વિચારો આગના ફરતા,
ફૂલોને યાતના એની તરસ કાંઠે રહી કાયમ !

ભરમ ભાંગી જતે જો સેણમાં હું તૃપ્ત થૈ જતે,
ખરેખર છે મજા એની તરસ કાંઠે રહી કાયમ !

તમે આ શાસમાં બેઠા પછી પણ છે ઉદાસી લ્યો,
કદાચિત છે કથા એની તરસ કાંઠે રહી કાયમ !

અમારી પાંપણો પાછળ સમંદર 'દદ્દ'નો છલેકે,
મળી છે આ સજા એની તરસ કાંઠે રહી કાયમ !

મુ-બુકણા, તા-વાવ, જિ.- બનાસકાંડા, ઉત્તર

ગુજરાત-૩૮૫૫૭૫

મો.- ૯૮૮૦૨૮૮૧૧૮૩

સાહિત્યકાર પચશી ડૉ. પ્રવીણ દરજીને મ્રામ ગુજરાત ગૌરવરતન એવોઈ અને કવિતા પુરસ્કાર

ગુજરાતી સાહિત્યક્ષેત્રે બહુમુલ્ય પ્રદાન માટે સંખ્યાબંધ સુવાર્ષ ચંદ્રકો-પારિતોષિકી પ્રાપ્ત કરનાર જાણીતા કવિ,
નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક પચશી ડૉ. પ્રવીણ દરજીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અર્પેલ મૂલ્યવાન સેવા
માટે તેસ્તાફુન્દેશન (કનેડા-અમેરિકા) ગુજરાતી સમાજ દ્વારા અમદાવાદ ખાતે, પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવરતન
એવોઈ તાજેતરમાં અર્પેણ કરાયો છે. આ ઉપરાંત, 'જ્યંત પાક સન્માનસમિતિ' દ્વારા તેમના કાવ્યસંગ્રહ 'પૂર્વભાસ'ને
૨૦૧૬-૧૭ વર્ષનો જ્યંતા પાકક કવિતા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. આ સાહિત્યકીય ગૌરવપ્રદ ઉપલબ્ધ માટે
'વિ-વિદ્યાનગર' પરિવાર તેમને હાર્દિક અભિનંદનસાહુ શુભેચ્છા પાઠવે છે.

મૂર્તિ

હરેશ કાનાડી

કૃપારેક
પથરોની બેદક થશે
અને તે કોઈ પણ પૂજા ઘરમાં
બેસવાની ના કહેશે
ને ઊભા થઈ જશે અને તમામ મંત્ર
ભાગી જશે કોઈ અજ્ઞાત પહાડોમાં...
તે દશ્ય જોવા જેવું હશે
તેની ઉપર કોઈ પંડિતની ધાક-ધમકીની
અસર નહીં થાય
તે પોતાની કમિટી પાસેથી માંગ કરશે
કે,
તે દિવસને રાષ્ટ્રીય પર્વ ઘોષિત કરે
અને દુનિયાભરની મૂર્તિઓને પત્ર દ્વારા
આગું કરે...
કે કોઈ અસુરક્ષિત હોયતો
પાછા ફરી જાય
કલાકારોના આદિમ મનમાં....

મેઈન બજાર, ગીર ગઢા-૩૬૨૪૩૦,
જી-ગીર સોમનાથ (ગુજરાત), મો.-૯૯૯૩૮૮૭૮૧૬

॥ ચિંતન ॥

ભારતીય આદર્શો

હરેશ વેદ

પ્રત્યેક રાષ્ટ્રને જેમ એનાં આચારો (ethos) અને મૂલ્યો (values) હોય છે, તેમ આદર્શો (ideals) પણ હોય છે. આવા આદર્શો એટલે રાષ્ટ્રની પ્રજાએ જેને પૂર્ણ, નમૂનારૂપ, અભીષ્ઠ ધ્યેયો માન્યા હોય એનાં કાલ્પનિક રૂપો. આવા આદર્શો વેં પણ રાષ્ટ્રની આળખ સ્પષ્ટ થતી હોય છે. ભારત એક રાષ્ટ્ર છે, તો તેની પ્રજાએ કલેલા નમૂનારૂપ ધ્યેયો ક્યાં છે, જે એની એક રાષ્ટ્ર તરીકે આળખ સ્પષ્ટ કરી આપે છે? એક રાષ્ટ્ર તરીકે ભારતની પ્રજાએ પોતે પસંદ કરેલાં પ્રાપ્ત કરવા યોગ્ય ધ્યેયો કે લક્ષ્યાંકો ક્યાં છે, તેના વિશે આપણે સમજુએ.

અસતો મા સદ્ગમય
તમસો મા જ્યોતર્ગમય
મૃત્યોર્મા અમૃતંગમય

ઉદાસીન ચહેરો

જગાદીશ ધનેશ્વર ભક્ત

સાવ ઉદાસીન ચહેરો
અંખ ખૂલે ત્યાં જોવા મળતો એક અનાદિ પહેરો,
સાવ ઉદાસીન ચહેરો.

હરપળ અમથી વહેતી આવે અકળ મનોગત વાતો,
કોને કહીએ કે ના કહીએ સમય નથી પરખાતો,
એકલ દોકલ લાગાણીઓને લાગ્યો કોનો પહેરો !
સાવ ઉદાસીન ચહેરો.

સાદ કરું ત્યાં પડવા પડતા, પાથરતા ચોપાસે,
હાથ ધરું ને જૂઠા પડતા, અવઠવના સહિવાસ,
ભીતર એકાતે એનો ધાવ હજુ છે ગેહુરો,
સાવ ઉદાસીન ચહેરો.

રોજ-બ-રોજે ચિંતાઓનાં વમળ રહે ધૂમરાતાં,
નામ નથી નકશામાં એવાં દુઃખ બધે પથરતાં,
કોઈ ન સુણે ચિત્કરો ને જગનો કાન છે ભહેરો,
સાવ ઉદાસીન ચહેરો.

૨, દીપુંજ, ગાણેશ ગલી, માણિનગર, અમદાવાદ
કોડ.- ૨૫૪૩૫૪૮૬

હે પરમાત્મા ! તું મને અસત્યમાંથી સત્ય પ્રતિ,
અંધકારમાંથી પ્રકાશ પ્રતિ અને મૃત્યુમાંથી અમૃત પ્રતિ
દોરી જા, કારણ કે આત્મા/પરમાત્મા સત્ત, ચિત્ત અને
આનંદ રૂપ છે.

ઉદ્ધ્વયં તમસ: પરિજ્યોતિ: પશ્યન્ત ઉત્તરમ् ।

દેવં દેવત્રા સૂર્યમગન્મ જ્યોતિરિત્તમમ् ॥

અમે અજ્ઞાન અંધકારથી પર ઉતૃપ્તિતમ પ્રકાશનો
અનુભવ કરતાં કરતાં સર્વત્ર પ્રકાશક પરમતત્વને પામીએ.
કેમકે તે જ દેવોનો દેવ છે. સૂર્ય પણ એને જ આધારે છે.

કૃથિ ન ઊર્ધ્વાર્જ ચરણાય જીવસે ।

ભગવન! જીવનયાત્રામાં અમને સમુન્નત બનાવો.

ભર્ત્ર જીવન્તો જરણામશીમહિ ।

અમને કલ્યાણ માર્ગે ચાલતાં ચાલતાં વૃદ્ધાવસ્થા પ્રાપ્ત
થાઓ.

यत्रानन्दाद्य मोदाच मुदः प्रमुद आसत् ।

कामस्त्रयात्रासाक्ष कामा तव माममृतं क्रथि ॥

प्रभो! अमने सदा आनंदं भोद अने प्रभोद साथे प्रसन्न राखो. ग्राम-डाम करो अने अमृत बनावो.

आ नो भद्राः क्रतवो यन्तुः विश्वतो दध्वासो अपरीतास उद्ग्रिदः।
देवो नो यथा सदमिदवृथे असत्रप्रायुगो रक्षितारो दिवे दिवे ॥

अमारा ज्ञवनमां चारे बाजु थी कल्याणकारी
शद्विद्यारेत्रुपी यज्ञोनुं शुभा-गमन थाओ. ऐमां क्रोहि
विध्न न आवे. ए नष्ट न थाय. अमारा सत्संकल्पो
शत्रुओने परास्त करो. ने सक्षण रहो. रोजरोज अमारी
रक्षा करो. बधा देवो अमारां संपोषण अने संवर्धनमां
संलग्न भनो.

स्वस्ति पन्थामनुचरेम सूर्यचन्द्रमसाविव ।

पुनर्ददता अन्धता जानता सं गमे महि ॥

जेभ सूर्य अने चंद्र विशाण आकाशमां पोताना नियत
मार्गे संचरता रही. प्रकाश, प्रेरणा अने आङ्गलाढनुं दान
करता रहे छे, तेम अमे पाण विश्वव्यवहारमां असंगपाणे
प्रवृत्त रहीए. अमे वारंवार उदारदाता, रागद्वेष्टहित,
अहिंसक सत्पुरुषोने तथा खरा ज्ञानी विद्वानोने मणता
रहीए.

नृक्षसो अनिमिषन्तो अर्हणा बृहददेवासो अमृतत्वमानशः।
ज्योतिरथा अहिमाया अनागसो दिवो वर्षाणि वसते स्वस्तये॥

जे कर्मपरायण मनुष्योनी देखभाण राखे छे, जे
निमेषनोये विश्राम करता नथी अने जे लोकसेवामां
निरंतर लाङ्या रहे छे. ते हित्य पुरुषोये अमृतत्व प्राम
क्ष्यु छे. अमनो रथ ज्योतिर्भव होय छे. अमनी प्रज्ञानो
नाश क्रोहि नथी करी. शक्तुं, तेओ निष्पाप छे. ऐवा ज
पृथ्वीपुत्रो घुलोकना उश्त नाभिस्थान उपर लोककल्याण
अर्थे निवास करे छे.

तत् सवितुवरेण्यं भर्गो देवस्य धीमहि ।

धियो यो नः प्रचोदयात् ॥

अमे बधा भगवान सविताना (ऐटले के सर्वसर्जक
परमेश्वरना) ते वराणीय तेजोमय स्वरूपनुं ध्यान करीए
छीए, जे अमारी बुद्धिने सत्यप्रति प्रेरित करे छे.

ईशावास्यमिदं सर्वं यत्किंचित जगत्यां जगत् ।

तेन त्यक्तेन भुजीथा मा गृथः कस्यचिद्द नम् ॥

समग्र विश्वमां अंतर्यामी परमात्मा व्याप छे, सर्वकर्म
द्वारा जे कांઈ प्राम थाय तेने परमात्माने समर्पित करीने
भोगव. गीधवृत्ति न राख. धन कोनुं छे?

ब्रतेन दीक्षामाज्जोति दीक्षायाङ्गोति दक्षिणाम् ।

दक्षिणा शद्वामाज्जोति शद्वया सत्यमाप्यते ॥

ब्रतना आयरण्थीज माणसने दीक्षा ऐटले के उश्त
ज्ञवननी योग्यता प्राम थाय छे. दीक्षाथी दक्षिणा ऐटले
के प्रयत्ननी सझणता लागे छे. दक्षिणाथी स्वीकारेला
आदर्शोंमां शद्वा अने शद्वाथी सत्यनी प्राप्ति थाय छे.

आयुर्ज्ञेनकलपतां प्राणो अपानो व्यानो चक्षुर् श्रोतं वाग् मनो
आत्मा यज्ञेन कल्पतां स्वाहा।

भौतिक जगतना ज्ञवन अर्थे काम करी रहेली अजिन
वायु वगेरे दैवी शक्ति साथे समरस ज्ञवन व्यतीत करतां
करतां हुं पूर्ण आयुष्य प्राम करुं. मारी प्राण अपान वगेरे
शक्तिओ अने आंभ वगेरे ईन्द्रियो, पोतपोतानुं काम सारी
पेठे करे. आ रीते मारा व्यक्तित्वनो पूर्ण विकास थाओ,
अे ज मारी हार्दिक अभिलाषा अने प्रार्थना छे.

मित्रस्य मा चक्षुसा सर्वाणि भूतानि समीक्षन्ताम् ।

मित्रस्याहं चक्षुसा सर्णाणि भूतानि समीक्षे,

मित्रस्य चक्षुसा समीक्षामहे ।

मनुष्यो ज नहि पाण सकण प्राणीसृष्टि भने
मित्रताभरी दृष्टिथी जुओ अने हुं पाण समस्त प्राणीओने
मित्रटटिथी जोउं. अमे सौ एकेमेकने मित्रटटिथी ज जोता
रहीए.

कुर्वन्नेवेह कर्मणि जिजीविषेत् शतं समाः ।

एवं त्वयि नान्यथेतोऽस्मि न कर्म लिप्यते नरे ॥

मनुष्ये कर्तव्यकर्मो करतां करतां ज सो वर्ष ज्ञवनानी
महेच्छा रामवी जोधीए. अनुं अमां ज कल्याण छे;
कर्तव्यकर्मो छोटी भागवामां नहीं. आ उपायथी ज
कर्मबंधनथी बची शकाय छे.

सेतूस्तरं दुस्तरान, दानेन अदानम्, अक्रोधेन क्रोधम् । शद्वया
अश्रद्धाम् । सत्येन अनृतम् । एषा गतिः एमादमृतम् ।

हे मनुष्य! दुस्तर चार अवरोधोने तुं पार कर. (१)
दानथी दृपाणातने (२) अकोधथी कोधने (३) शद्वाथी
नास्तिकताने अने (४) सत्यथी असत्यने.

जीवेम शरदः शतम् । बुद्धेम शरदः शतम् ।

शरदः शतम् । युषेम शरदः शतम् ।

भवेम शरदः शतम् । भूषेम शरदः शतम् ।

भूयसी शरदः शतं ।

अमे सो के तेथीये अधिक वर्षो ज्ञवित रहीए, अमारा
ज्ञानेन वधारता रहीए, उत्तरोत्तर उत्तृष्ठ उश्ति पामीए,

પુષ્ટિ અને દૃઢતાનો મેળવતા રહીએ, આનંદમય જીવન વ્યતીત કરીએ તથા સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સદ્ગુણોથી ખુદને ભૂષિત કરીએ.

સહદ્યં સામનસ્યમવિદ્રોષં કૃણોમિવ: ।

અન્યોડન્યમિહર્યત વત્તં જાતમિવાધ્યા ॥

અમારા કૌદુર્યિક જીવનમાં પરસ્પર ઐક્ય, સૌલ્લાઈ અને સદ્ભાવના પ્રવર્તો. દ્વેષની ગંધ પણ ન હો.

સુખં વા યદિ વા દુઃખં પ્રિયં વા યદિ વાડપ્રિયમ् ।

પ્રાતસ્મ પ્રાત્સમુપાર્સીતં હુદ્યેન પરાજિતઃ ॥

ચાહે સુખ હોય યાદુઃખ, પ્રિય હોય યા અપ્રિય, જે મળે તેને શાન સાથે, હુદ્યથી બિલકુલ હાર્યા વિના, સોલ્લાસ ગ્રહણ કરો, હાર માનો નહિ.

તન્મે મન: શિવસંકલ્પમસ્તુ ।

અમારા મનને કૃપા કરી શુભ સંકલ્પોથી યુક્ત કરો.

કલિ: શયાનો ભવતિ સન્ધિહાનસ્તુ દ્વાપર: ।

ઉત્તિષ્ઠંજોતા ભવતિ કૃતં સંપદ્યતે ચરન ॥ ચરૈવેતિ

ચરન વૈ મધુ વિન્દતિ ચરન સ્વાદુમુદુભરમ् ।

સૂર્યસ્ય પશ્ય શ્રમાણં યો ન તન્દ્રેયતે ચરન ॥ ચરૈવેતિ

જે સૂર્યો રહે છે તે કણિયુગ છે. નિદ્રા ત્યજુ બેઠો થનાર દ્વાપર છે. ઊઠીને ઊભો થનાર નેતાયુગ છે અને જે પરિશ્રમ કરતો રહે છે તે સત્યુગ છે. માટે અવિરત શ્રમ કરતા રહો. ચાલતા રહો. શ્રમપરાયાણ માણસ જ જીવનનું માધ્યર્થ પામે છે.

તે જ સ્વાદિષ્ટ ફળનો આનંદ લૂટે છે. સૂર્યના શ્રમને જુઓ, એ સદાય ચાલતો રહે છે, કદી આણસ કરતો નથી. માટે ચાલતા રહો. ચાલતો નર ભદ્રા (કલ્યાણ ફળ) પામે.

સર્વે સુખીના સન્તુ । સર્વે સન્તુ નિરામયા: । સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્તયાત ।

બધા લોકો સુખી થાઓ. બધા લોકો નિરામય (આરોગ્યવાન) થાઓ. સૌનું કલ્યાણ થાઓ. કોઈને કયારેય દુઃખ પ્રાપ્ત ન થાઓ.

ત્યજેત સ્વાર્થ કુલસ્યાર્થ ગ્રામસ્યાર્થ કુલ ત્યજેત ।

ગ્રામ જનપદસ્યાર્થ આત્માર્થ પૃથિવી ત્યજેત ॥

કુળને માટે સ્વાર્થ ત્યજવો, ગામને માટે કુળ ત્યજવું, જનપદને માટે ગામ ત્યજવું અને આત્માને માટે પૃથિવી ત્યજવી શ્રેષ્ઠકર છે.

ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ।

ઉઠો, જાગો અને તત્ત્વવેતા ઉત્તમ પુરુષોને મેળવી આત્મસ્વરૂપને ઓળખી લો.

વિક્ષનારં વિશ્વતી ભૂમિરાનિમિન્દ્રક્રષ્ણભા દ્વિવિનો નો દધાતુ ॥

સર્વનું પોખાણ કરનારી, અનેક જાતની સંપદા ધારાણ કરનારી, સર્વની પ્રતિષ્ઠારૂપ, સોનેરી છાતીવાળી, જગતના સર્વજીવોને આશ્રય આપનારી, વૈશ્વાનરનું ભરણપોખાણ કરનારી આ ભૂમિ અમારા માટે અશ્રદ્ધેવ અને ઈન્દ્રદેવને પ્રામ કરાવનારી બનો અને અમને અનેક પ્રકારનાં ધન આપનારી બનો.

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુદેવો મહેશ્વર: ।

ગુ: સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગરુવે નમ: ॥

ગુરુ જ બ્રહ્મમા, વિષ્ણુ અને મહેશ્વર છે. આ ગુરુ સાક્ષાત પરબ્રહ્મમરૂપ છે. તેવા આ ગુરુને નમન છે.

ॐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમદુદ્દ્યતે ।

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશીષ્યતે ॥

તે સચ્ચિદાનંદ પરમાત્મા પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થાય છે. પૂર્ણમાંથી પૂર્ણ લેવામાં આવે તો પણ પૂર્ણ જ બાકી રહે છે.

ॐ સહનાવવતુ સહ નો ભુનકતુ સહવીર્ય કરવાવહૈ ।

તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ॥

તે પરબ્રહ્મ પરમાત્મા ગુરુ-શિષ્ય એવા અમારી બંનેની રક્ષા કરે. અમારું બંનેનું પાલન કરે. અમે સાથોસાથ શક્તિ પ્રામ કરીએ. અમારી બંનેની ભાગેલી વિદ્યા તેજસ્વી બનો. અમે બંને પરસ્પર કયારેય દ્વેષ ન કરીએ.

સં ગચ્છધ્યં સ વદ્ધં સં વો મનાંસિ જાનતામ ।

તમે સૌ એક સાથે ચાલો, એકમત બોલો, તમારું મન એકમત થાલ.

સમાનોમન્ત્ર: સમિતિ: સમાની સમાનં મન: સહ ચિત્તમેષામ ।

તમારો મંત્ર એક સરખો રહો, તમારી સભા એક રહો, તમારું મન એક રહો.

સમાની વ આકૃતિ: સમાના હૃદયાની વ: ।

સમાનમસ્તુ વો મનો યથા વ: સુસહાસતિ ॥

તમારો સંકલ્પ એક બનો, તમારું હૃદય એક બનો, જેનાથી તમારું સહ-અસ્તિત્વ બની રહે, માટે તમારું મન એક બનો.

એકો ધર્મ: પરં શ્રેય: ક્ષમા એકા શાન્તિરૂત્તમા ।

વિધૈકા પરમા દૃષ્ટિ: અહિંસા એકા સુખાવહા ॥

માત્ર ધર્મ જ પરમ કલ્યાણકારી છે, ક્ષમા જ સર્વોત્તમ શાંતિ આપી શકે. એક માત્ર વિદ્યા જ સાચી દિની છે અને જીવનમાં અહિંસા જ સુખ આપી શકે.

ન સા સભા યત્ર ન સન્તિ વૃદ્ધા:
ન તે વૃદ્ધા યે ન વદન્તિ ધર્મમ् ।
નાસો ધર્મો યત્ર ન ચાસ્તિ સત્યમ्
ન તત્ત્વયં યચ્છલેનાનુ વિદ્રૂમ् ॥

તે સભા સભા નથી, જ્યાં વૃદ્ધો ન હોય. તે વૃદ્ધો વૃદ્ધો નથી, જે ધર્મ કહી શકતા ન હોય. જ્યાં સત્ય ન હોય તે ધર્મ ધર્મ ન કહેવાય. જ્યાં તર્કછલ હોય, કપટ હોય તે સત્ય સત્ય જ નથી.

ભારતીય પ્રજાએ પોતાની સમક્ષ આવા ઉચ્ચ આદર્શો રાખેલા છે. આ બધાના સારદૃપ ટૂકમાં જો કહેવું હોય તો

આટલું કદી શકાયઃ-

પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય,
ભૂખ્યા કોઈ સ્વુદે નહિ, સાધુ સંત સમાય.

અતિથિ બોંઠો ન પે આશ્રિત ન દુભાય,
જે આવે અમ આંગણે આશિષ દેતો જાય.

સ્વભાવ એવો આપજો, સૌ ઈચ્છે અમ હિત,
શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે ગ્રીત.

વિચાર વાણી કર્તાણૂક થકી સૌને ઈચ્છણું ગ્રેમ,
સગાં સ્નેહી કે શત્રુનું હું ઈચ્છણું કુશળ ક્ષેમ.

‘કદમ્બ’ બંગલો, ઉપ, પ્રોડેર્સર્સ સોસાયટી, મોટા બજાર,
વધ્વભ વિદ્યાનગર, ફેન નં : ૦૨૬૬૨-૨૭૩૭૫૦
સેલ નં : ૦૮૭૭૨૭૩૩૦૦૦

॥ નવલિકા ॥

શુકન-અપશુકન

મનહર રવૈયા



વહેલી સવારના પાંચ વાર્ષે એલાર્મના રણકારે બિરેન જાગી ગયો. સૌપ્રથમ એણે બ્રા કરી, નસાવાનું કાર્ય પતાવ્યું, પછી ગાણપતિદાહની મૂર્તિ સામે અગરભાતી અને દીવો કર્યો અને એ સ્વગત બોલ્યો; “હે...મારા દાદા! આજ માંનું ગોડવાય જાય તેવી કૃપા કરજો, તમને કામ થયે મોઢકનો થાળ ધરાવીશ” કપાળમાં ચંદનનું તિલક કરી કપડા બદલી એ તૈયાર થયો. સાઈકલ બહાર કાઢી, જોયું તો પાઇલા વ્હીલમાં હવા ન હતી આથી એ સાઈકલને દોરતો હવેલી ચોક તરફ વળ્યો, ત્યાં સ્સ્તામાં ગાર્ડનનાં દરવાજા પાસે રાત્રે ઊભેલા પાંદુભાજુ, પાણીપુરી અને ભેળવાળાઓએ એડા કાગળનાં દુચા ઉકરડામાં જે નાખેલા હતા એ દુચા ચાવતી એક ગાય ઉભી હતી. ગાયને જોતા જ બિરેને સાયકલની ઘોડી ચાડાવીને ગાય પાસે જઈ ગાયના માથે હાથથી સ્પર્શ કરી હાથ આંખે અડાડચા. બસ એને શુકન થઈ ગયા. મનોમન એ રાજુ થઈ રહ્યો.

બસ પછી હવેલી ચોકમાં સુપ્રિમ સાઈકલ સ્ટોરમાંથી કમ્પેશરથી હવા ભરીને પાળિયાદ રોડ પર સાઈકલ મારી મૂકી. હવે માણસોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. બિરેનને યોગીનગર જવું હતું. ત્યાં કરિયાણાની દુકાન ચલાવતા વાસુદેવ લાભશંકરની પુત્રી અંજલિને જોવા માટે નીકળ્યો હતો. ઓફિસમાં આજે એણે રજા લીધી હતી.

એ પોતે અતિશાય ભાવુક અને લાગણીશરીલ સ્વભાવનો હતો. રસ્તા પર જ્યાં જ્યાં દેવ મંદિર આવે ત્યાં એ માથું નમાવી સાઈકલની બેલ વગાડી લેતો હતો.

બિરેનના મા-બાપ તો જજ હોનારતમાં તાણાઈ ગયા હતાં. તેથી એ બાજુના ગામ્ભે રહેતા એના ભીખામામાને ત્યાં ઉછર્યો હતો. આ તેની સગાઈની વાત એના ભીખામામાને જ ચલાવી હતી. એતો આગલા દિવસેજ વાસુદેવનાં ઘરે આવી ગયા હતાં. ભીખામામા અને વાસુદેવ ચારથામ યાત્રામાં સાથે હતાં તેથી બંને મિત્રો બની ગયા હતાં. બિરેન માટે એના મામાએ છોકરી શોધવામાં બહું મહેનત કરી હતી જ્યાં વાત કરે ત્યાં છોકરીવાળા સામે છોકરી માંગતા હતાં પણ બિરેનને બેરોંગ બનાવતી બિજ બેરોંગ કંપનીમાં સારી સેલેરોવાળી જોબ મળી જતા, વાસુદેવ અને એમના પણી બને બિરેનને પોતાની છોકરી અંજલિ આપવા તૈયાર હતાં. બસ એકવાર બિરેન અને અંજલિ એકબીજાને મળી લે એટલે સગાઈ નક્કી હતી. આથી બિરેન ખૂબજ ખુશ હતો. એનો ઉત્સાહ ઓર હતો. બસ આજ કાર્ય હેમેપેમ પૂર્ણ થાય એટલે બસ. આથી જ એ ખાસ ઈરાદથી વહેલો નીકળ્યો હતો. કારણ કે એ જ્યારે બહાર જતો હોય, ત્યારે નાદી કાડે આવેલ મફતિયાપરાની ઝુંપદપ્રીમાં રહેતો એક આંદે એને અવાર-નવાર સામો મળતો હતો. સર્કેદ મેલખાયા લેંઘા જલ્ભામાં સક્રે એ આંદે બિરેન માટે મનહુસ, બુંધિયાળ અને અપશુકનિયાળ હતો. એ જ્યારે પણ બિરેનને સામો મળતો ત્યારે બિરેનનો

દિવસ બગડતો હતો. જેવું કે ઓફિસમાં કોઈ ભૂલ થાય અને બોસ ગુરુસે થાય તો ક્યારેક નહીં જેવી વાતમાં જગડો થતો કે આર્થિક નુકસાન થતું. એક વખત ઓફિસમાંથી એનો મોબાઇલ ચોરાઈ ગેયલો પછી એક દિવસ બિરેનને ઓફિસે પહોંચયામાં મોંટું થતું હોવાથી સાઈકલ ઉતાવળે ચલાવી રહ્યો હતો ત્યાં એની સાઈકલ આગળ એક સફેદ કાર હતી. કારે અચાનક જ બ્રેક મારી, બિરેન સાઈકલની બ્રેક મારે એ પહેલા સાઈકલ ધાડ કરતી એ કાર સાથે અથડાઈ ગઈ. કારની સાઈક લાઈટ તૂટી ગઈ. જગડો થયો. ભૂલ કરવાળાની હતી છતાં માથાભારે કરવાળાએ ખર્ચના પૈસા લીધેલા.

આવી ઘટનાઓ પાછળ પેલો અપશુકનિયાળ આવેડ જ કારાણભૂત હોવાની વાત બિરેનના મગજમાં રહ્ય ઘર કરી ગઈ હતી. આથી આજ એ આવેડ સામો ન મળે તો સાંચું એ ચિંતાનો ભય બિરેનને મૂંગવી રહ્યો હતો. અને હા માણસ જેનું સતત ચિંતન કરે તેવું બેને જ અને બિરેનને જે ભય મનમાં હતો એજ બન્યું. કોલેજ સર્કલના વળાંકમાં આવેડ સામો મળ્યો વળી એણે બિરેન સામે નજર પણ કરી, બસ બિરેનનો મૂડ માર્યો ગયો અને થયું ખલાસ હવે સગાઈ થઈ રહી.

અને ખરેખર એવું જ થયું. અંજલિના મા-બાપ તો બિરેનને પસંદ કરતા હતાં હવે તો ફક્ત બિરેન અને અંજલિ એકબીજાને મળી લે એટલું જ બાડી હતું. મુલાકાતમાં અંજલિએ કહ્યું કે એને પોતાને એક બોયેફેન્ડ છે. તેની સાથે ગાઢ પ્રેમ છે. અમારે લગ્ન કરવા છે. મમ્મી-પાપા માનતા નથી એટલે અમે આવતી પૂનમે ઘરેથી ભાગી જઈને લગ્ન કરી લેવાના હીએ. આ વાત કરવા હું તમારી ઓફિસે ગઈકાલે આવી હતી, પણ તમે ઓફિસ ડામે અમદાવાદ ગયા હતાં. બીજું આ વાત મારા ઘરનાને ન કહેતા. સોરી તમને તકલીફ આપી.

બિરેનના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું. એ એના મામાને મળીને ભાંગેલ પગે નીકળી ગયો. બીજે દિવસે બિરેનના દોસ્ત અને સહકર્મયારી પાર્થ મહેતાએ બિરેનને કહ્યું; કેમ દોસ્ત કેવી રહી અંજલિ સાથેની મુલાકાત ? “અરે યાર જવા દેને એ...” હતાશ બિરેન બોલ્યો. પાર્થને ખર્ચ હતી, બિરેન અંજલિને જોવા જવાનો હતો. એ પહેલા અંજલી ગઈકાલે ઓફિસે આવી હતી. એ પુનઃ બોલ્યો “શું જવા ઢે, અંજલી પહેલી નજરે ગમી જાય તેવી છે. તારે પેંડાથી નહીં ચાલે પાર્ટી આપવી પડશે.” “અટ્યા

અંજલી તો ગમે તેવી છે, પણ એને બીજું કોઈ ગમે છે એનું શું ? મારું જ્યાં જામ્યું નહીં ત્યાં પાર્ટી કેમ આપું...?” વાત કરીને પછી રડમસ અવાજે વાત પુનઃ શરૂ કરી. “પાર્થ જો એ આવેડનાં સવારે અપશુકન ન થયા હોતને તો મારી સગાઈ થઈ જાત” “હોરો બિરેન...! અંજલિ સાથે તારા લેખ નહીં લખાયા હોય એમાં બિયારો આવેડ શું કરે?” “અરે ભાઈ તને શું ખર્ચ હોય, એ જ્યારે જ્યારે મને સામો મળે છે ત્યારે મારો દિવસ બગડે છે.” “અરે એવું હોય નહીં. મારે તારી કરતા સારુ છે. મનેય એક આવેડ સામો મળે છે. પણ એના વિરો કયારેય વિચારતો નથી. નહીંતર એ આવેડ જ્યારે જ્યારે મને સામો મળે છે ત્યારે મને શુકન થાય છે. સારા સમાચાર મળે છે.” “અમે...?” હાસ્તો! જો હજ ગયા મહિનાની વાત છે, અમારે ગઠડા રોડ પર શ્રીજનગરમાં મકાન લેવાનું હતું, મારી મમ્મીને મકાન બબું ગમતું હતું, પણ મકાનની કિંમતમાં વાત અટકી હતી. મકાન માલિક બાર લાખ કહેતા હતા અને અમારી ગાણતરી અગિયારની હતી, પણ મકાન માલિક માનતા ન હતાં. એમાં બીજા દિવસે એક આવેડ સામો મળ્યો. મેં કશું જ મનમાં વિચાર્યું નહીં. હવે હું ઓફિસે આવ્યો અને મકાન માલિકનો ફોન આવ્યો, એ અગિયારમાં સહમત હતો એ પણ બે હપ્તામાં.

બીજું એકવાર તારી ભાબી સ્વાતીને ડિલીવરીનો સમય હતો. દુઃખાવો ઉપડતા પ્રસુતિગૃહમાં દાખલ કરી હતી. બાળકનો જન્મ થતો ન હતો. સ્વાતી પીડાતી હતી. સિઝેરોયાની વાત ચાલતી હતી. હું જરૂર પડે તો પૈસા માટે ઘર તરફ આવતો હતો ત્યાં આવેડ સામો મળ્યો પછી હું પૈસા લઈને પ્રસુતિગૃહ આવ્યો તો સ્વાતીને નોરમલ ડિલીવરી થઈ ગઈ હતી. બાબો આવ્યો હતો.

“એમ શું વાત કરે છે ? અરે પાર્થ મારે એ શુકનિયાળ આવેડને જોવો છે. મને બતાવીશ... હવે તો મારેય એના શુકન લેવા છે.” “જો ભાઈ એમાં એવું છે કે એ કયારે સામો મળે એ નક્કી નહીં, તેથી એને જોવા તારે ઓફિસે જવાના સમયે તારે મારા ઘરે આવવું પડે પછી આપણે બસે સાથે નીકળીએ” “સાંચું” બીજા દિવસથી બિરેને સવારે પાર્થના ઘરે જવાનું શરૂ કર્યું. બે દિવસ ખાલી ગયા. આવેડ સામો મળ્યો નહીં, પણ બીજા દિવસે લીમાગવાળા ચોકમાં સામેથી ચાલ્યો. આવેડને જોતા જ બિરેન બોલ્યો; “જો પાર્થ તારો શુકનિયાળ આવેડ તો ન મળ્યો પણ મારો અપશુકનિયાળ આવેડ આવી રહ્યો છે. એજ મેલો જબ્બો અને લેંધો.”

“દા જોયો હવે તને સાચું કહું તારો અને મારો આવેડ જુદા નથી એકજ છે. તને મળતો આધેડ અપશુકનિયાળ નથી અને મારો શુકનિયાળ નથી. ખરેખર તો શુકન-અપશુકન જેવું કશું જ નથી. માત્ર મનના વિચારો છે. એક મન્જે રાજુ રાખવાની વાત છે. બાકી તો સારું કે નહારું જે જનવાનું હોય છે એ બનેજ. એ કુદરતી કમમાં કોઈ ફેરફાર ન થાય. આધેડ તારા માટે અપશુકનિયાળ છે એવો તારો

વહેમ કાઢી નાખ અને દ્રઢ મનોભળથી સારા વિચારો કર તને ચારો તરફ શુકન-શુકન જ થશે. આ વાત સમજાવવા મારે તારી સામે મારે મારા આવેડની વાત ઉપજાવવી પડી.” સાંભળી બિરેન હિંમતમાં આવી ગયો.

૭-એ, શારદા સોસાયટી, ન્યૂ રેલ્વે કોલોનીપાછળ,
સ્ટેશન એરિયા, બોટાદ-ઉદ્દેશ્ય
મો. ૯૦૩૭૧૦૨૦૦૫

॥ સમીક્ષા ॥

‘બા વગરનું ઘર’ અધૂરપની મધુરપ

શીરેન્દ્ર પંદ્યા

‘બા વગરનું ઘર’એ ભગીરથ બ્રહ્મભહુનો બીજો વાતસંગ્રહ છે. ઈ.સ.૨૦૦૨માં તેમણે ‘મીઠા વગરનો રોટલો’ વાતસંગ્રહ આપ્યો હતો. ત્યારબાદ ઈ.સ.૨૦૧૮માં એટલે કે ૧૬ વર્ષના લાંબા અંતરાલ બાદ તેઓ ‘બા વગરનું ઘર’ આપે છે. આ સંગ્રહમાં કુલ ૨૮ વાતાઓ છે. સંગ્રહની વાતાઓ ‘નવનીત-સમર્પણા’, ‘જલારામદીપ’, ‘પરબ’, ‘વિ’, ‘કુમાર’ જેવાં સામયિકોમાં પ્રગત થયેલી છે. ‘ડુમો’ અને ‘ક્ષણગ્રહણ’-આ બે વાતાઓ ‘મીઠા વગરનો રોટલો’માં પણ પ્રકાશિત થયેલી છે. ‘ક્ષણગ્રહણ’ વાતાં ‘વીજળીનો ચમકારો’ નામથી એ સંગ્રહમાં પ્રકાશિત થઈ હતી. અલભાત, ‘ક્ષણગ્રહણ’નો અંત ‘વીજળીનો ચમકારો’ કરતાં જુદી છે. એટલે આ સંગ્રહમાં કુલ ૨૭ વાતાઓ વાતકાર પાસેથી મળે છે. આ સંગ્રહની ઘણીખરી વાતાઓ વ્યક્તિગત સંવેદનને રજૂ કરનારી છે. જ્યારે ‘મીઠા વગરનો રોટલો’ વાતસંગ્રહની ભૌંય ગ્રામસમાજ હતો. અહીં વાતકાર પાત્રના સંવેદન વિશ્વને આકારવાની મથામણ કરતાં જણાય છે. તેઓ પોતે પ્રસ્તાવનામાં લાખે છે,

‘અનુભૂતિની સચ્ચાઈ એના કેન્દ્રમાં છે, એ અનુભૂતિકણે કંડારવાનો અહીં પ્રયત્ન છે. કેટલીક વાતાઓમાં પ્રાણયના ભાવો સંયમિત આકારિત થતાં રોમેન્ટિક વાતાઓ બને છે તો કેટલીક વાતાઓ જીવનના વાસ્તવરૂપને જીવનના કેન્દ્રમાં રાખી કંડારાઈ છે.’ (પૃ-૬)

વાતસંગ્રહમાંથી પસાર થતાં એ વાતનો જ્યાલ આવી જાય કે લેખકે ભીતર તોકિયું વિશેષરૂપે કર્યું છે. માનવચિતમાં ક્ષણેક્ષણે ઊકતાં અને શમ્ભી જતાં સંચારી ભાવોને આલોખવાનો લેખકે આ સંગ્રહમાં પ્રયાસ કર્યો છે. જ્યારે પહેલા વાતસંગ્રહમાં આ આંતરજગતની સાથે

બાધજગત પર પણ લેખકની દસ્તિ હતી. બંને વાતસંગ્રહના મુખપૃષ્ઠ પરના ચિત્ર પણ લેખકની આ બદલાયેલી ધરીને દર્શાવી દે છે. પહેલા વાતસંગ્રહના મુખપૃષ્ઠ પર ઘરની અંદરથી બહારની તરફ જોતો નાયક ઊભો છે. જ્યારે બીજા વાતસંગ્રહના મુખપૃષ્ઠ પર નાયક ખાલી ઘરમાં પ્રવેશાતો જોવા મળે છે. વળી, બંને વાતસંગ્રહના શીર્ષક પણ ધ્યાનથી વાંચીએ તો ‘વગરનું’ શબ્દ ધ્યાન મેચે છે. આ ‘વગરનું’ એ બીજા વાતસંગ્રહમાં વધારે ઘૂંટાઈને રજૂ થયેલો ભાવ છે. ‘બા વગરનું ઘર’ શીર્ષક સૂચયે છે તેમ બા વિનાની નાયકની દશા વર્ણવતી વાર્તા છે. તો ‘બાપાનો વારસો’માં પણ પિતા મૃત્યુ પામેલા છે. ‘ફંટો’માં નાયિકા સુરબિ મૃત્યુ પામે છે. તો એક વાતાનું શીર્ષક જ ‘અધૂરપ’ છે. આ સંગ્રહનો વિશેખ આ ‘અધૂરપ’ના આલોખનમાં રહેલો છે. અહીં અધૂરપનો ભાવ કડવાશથી રજૂ થયો નથી. ભગીરથ બ્રહ્મભહુ ગીત કવિ છે. વળી, ગીતસ્વરૂપના ઊડા અભ્યાસી પણ છે. પહેલા વાતસંગ્રહમાં રહેલો અધૂરપનો ભાવ આ બીજા વાતસંગ્રહમાં કોઈક ગીતની ધ્રુવપંક્તિની જેમ પુનરાવર્તન પામતો, ઘૂંટાઈને આવતો જોવા મળે છે. અહીં અધૂરપની પણ મધુરતા જુદી જુદી રીતે પ્રગાટી છે.

‘બા વગરનું ઘર’, ‘પરિકમા’ અને ‘બાપાનો વારસો’-આ ગ્રાણેય વાતામાં કથનકેન્દ્ર નાયકનું છે. ગ્રાણેયમાં ગામના ઘરનો ઉલ્લેખ છે. પ્રથમ બે વાતામાં બા અને ત્રીજામાં બાપાની વાત છે. આટલી બાધ સમાનતાને લીધે આ વાતાઓ પહેલી નજરે એક સરખી લાગે. પરંતુ એમ નથી. ભગીરથ બ્રહ્મભહુ નાજુક સંવેદનોને વાતામાં મૂર્તરૂપે ઊતારવામાં કુશળ છે. પ્રથમ વાર્તા બા વિનાના ઘરમાં પ્રવેશાતી નાયકની મનોદશાને રજૂ કરે છે. જ્યારે બીજી વાર્તા નાયકના ગામના ઘર પ્રત્યેના લગાવને રજૂ કરે છે. અને ત્રીજી વાતામાં બાપાનું અનોખું વ્યક્તિત્વ રજૂ થયું છે. અધૂરપની અનુભૂતિ કરાવતી વાતાઓમાં ‘અધૂરપ’, ‘સોનાની વીઠી?’, ‘નવો જન્મ’, ‘અમાસી દસ્તિયો’, ‘ખરી

મજા તો ગોટલીમાં’, ‘શારડો’, ‘ક્ષાણપ્રાણ’ અને ‘આભમાં વાઢળવેરી શુંન્યતા’ મૂકી શકાય. જે વાર્તાઓમાં સામાજિક સંરચના પાર્શ્વભૂતુપે મહત્વનો ભાગ ભજવે છે, તેવી વાર્તાઓમાં ‘ધક્કો’, ‘પ્રેમમાં પડેલી ગ્રામીણ મામીનો પ્રેમપત્ર’, ‘ફાંટો’, ‘નવો જન્મ’, ‘ટેકનિક’, ‘સોનાની વીટી?’, ‘બંધ પડેલું ઘડિયાળ’ ને ગાણી શકાય. ‘મીડા વગરનો રોટલો’ વાર્તાસંગ્રહમાં પ્રથમ પ્રેમના સંસ્મરણો મહદુંશે નાયિકાના કથનકેન્દ્રથી રજૂ થયા છે. જ્યારે આ વાર્તાસંગ્રહમાં નાયિકાના કથનકેન્દ્ર ધરાવતી વાર્તાઓની સંખ્યા વધી છે. જેમ કે, ‘અમાસી દરિયો’, ‘બીજે કયાંક’, ‘સોળ વરસની હોકરીને કેરા ફરતાં’, ‘પ્રેમમાં પડેલી ગ્રામીણ મામીનો પ્રેમપત્ર’, ‘ખરી મજા તો ગોટલીમાં’ ને ગાણાવી શકાય. કથનકેન્દ્ર નાયિકાનું ન હોય પણ સંવેદન નાયિકાનું વ્યક્ત થતું હોય એવી વાર્તાઓમાં ‘વ્યક્તિ એક-પદ્ધતાયા બે’, ‘ફાંટો’, ‘જાણજુણાઈ’, ‘શારડો’ ને ગાણાવી શકાય. વર્તમાન સમયમાં ટૂંકીવાર્તામાં બોલીની બોલબાલા છે. આ વાર્તાકાર બોલી પ્ર્યોજવામાં માહેર પણ છે. એની સાભિતી તો પ્રથમ વાર્તાસંગ્રહમાં જ મળી ગઈ હતી. અને છતાંય આ બીજા વાર્તાસંગ્રહમાં માત્ર એક જ વાર્તા પૂરેપૂરી બોલીમાં રચાયેલી છે. અને એ છે ‘પ્રેમમાં પડેલી ગ્રામીણ મામીનો પ્રેમપત્ર’. ભાષા અને ટેકનિક એ ભગીરથ બ્રહ્મભણી વાર્તાઓમાં સહજ રીતે ગુંધાઈને આવે છે. ‘સુરભિ જ સુરભિ’, ‘પ્રમેય કથા’, ‘ટેકનિક’, ‘અધૂરપ’, ‘બંધ પડેલું ઘડિયાળ’, ‘સોનાની વીટી?’ આના નમૂનારૂપે જોઈ શકાય. માનવજીવન અનેકવિધ સંભાવનાઓથી ભરેલું છે. પણ મજૂબ્ય એક વિકલ્પ પર પસંદગી ઉતારે એટલે બીજી સંભાવનાઓ આપોઆપ ભૂસાતી જાય છે. માનવમન અવળંચું છે. તે વારંવાર પેલી ભૂસાઈ ગયેલી સંભાવનાઓ પર પહોંચી જતું હોય છે. અને મનોમન તેને છીવી લે છે. આ વાર્તાસંગ્રહમાં ભગીરથ બ્રહ્મભણે માનવમનની આ અવળંચાઈને પણ અનેક વાર્તાઓમાં રજૂ કરી છે. ‘પ્રમેય કથા’, ‘?’, ‘અ-બ’, ‘બીજે કયાંક’ વગેરે આ પ્રકારની વાર્તાઓ છે. એટલે અહીં ભૂતકાળ એ ભારતુપે નહીં પણ અચાનક ખૂલ્લી જતાં જૂની ડાયરીના પૃષ્ઠ જેવો જાણાય છે. આ દસ્તિએ જોઈએ તો અધૂરપ, સંસ્મરણોની લીલા અને તે દ્વારા ભૂતકાળમાં ધરબાઈ ગયેલી સંભાવનાઓ; નાયિકાનું આંતરજગત અને પ્રાણ્યનું કંઈક જુદું કહી શકાય તે પ્રકારનું આલોખન-એ આ વાર્તાસંગ્રહના વિશેખો છે. અહીં પ્રાણ્ય અધૂરપની રીતે, સંભાવનાઓની રીતે અને સુગંધરૂપે અવતર્યો છે. હવે, આ

વિશેખોને આધારે વાર્તાઓને વિગતે તપાસીએ.

‘બા વગરનું ધર’ વાર્તામાં નાયક વીસ વર્ષ પછી પોતાના ધરમાં પ્રવેશો છે તે ક્ષાણને લેખે પસંદ કરી છે. વાતાનો આરંભ જ ધરણો સૂચક છે.

‘ધરનું સ્થળ એનું એ. ધરનું માપ એનું એ. ધર પણ સાઈ સાલ પહેલાનું જેવું હતું, જ્યાં હતું ત્યાંનું ત્યાં એટલે એનું એ. ઓસરીની જગ્યાએ ઓસરી છે. ઓરતીની જગ્યાએ ઓરતી છે. આંગણાની જગ્યાએ આંગણું છે.’ (પૃ-૧)

અહીં ‘એનું એ’ ના પુનરાવર્તન દ્વારા ખાલીપો-‘એનું એ’ નથી એવો ખાલીપો અનુભવાય છે. નાયકના ધરમાં જેડૂત ઉદાજી તેની પત્ની સાથે રહે છે. ઉદાજી નાયકને પ્રેમથી આવકારે છે. પણ ધર, ઓરતો, ઓસરી, સાંબેલું વગેરે નાયકને એક જ સવાલ પૂછે છે, ‘કેમ ભૂલી ગયો મને?’ અહીં વાર્તા બે સ્તરે ચાલે છે. એક તરફ વર્તમાનમાં નાયક ધરમાં પ્રવેશો તો બીજી તરફ તેના ચિત્તમાં આખો ભૂતકાળ જીવંત થાય છે. એ ભૂતકાળમાં બાપા અને બા પણ જીવતા થાય છે. વિશેખ કરીને તો બા જીવતી થાય છે. વંટી ફેરવતી, લીપણ કરતી, બાપાને ચા આપતી, નાયકને આવકારતી, મોટી બેનને વળાવીને ઓરડે બેસી રડતી-એમ અનેકરૂપે બા જીવતી થાય છે. અહીં સ્થૂળ રીતે તો કશું બનતું જ નથી. જે કંઈ બને છે તે નાયકના ચિત્તમાં બને છે. નાયકને ધરનો ઉબરો બાના ચાંદલા વગર વિધુર દેખાય છે. બા વગરનું ધર પ્રાણ વિનાના ખોળિયા જેવું લાગે છે. નાયકનો ગુહપ્રવેશ તેને બા નહીં હોવાની વાત તાજી કરાવી દે છે. આ સંવેદન જ વાર્તાનું કેન્દ્ર છે. નાયકનું અંગત એવું સંવેદન ભગીરથ બ્રહ્મભણે જે ભાષામાં વ્યક્ત કર્યું છે તે ભાષા પણ અંગત નિબંધ જેવી છે. ધર અહીં સ્થૂળ મિલકત નહીં પણ જીવંત વ્યક્તિ બની જાય છે. આવી જ અનુભૂતિ ‘પરિકમા’ વાતાનો નાયક અનુભવે છે. તેથી જ તે દીકરા અને કહુઓની વાતે સંમત ન થતાં ગામનું ધર વેચવાને બદલે એ જ ધરે પાછો રહેવા માટે પહોંચી જાય છે. ‘પરિકમા’ સંસ્મરણો અને પેઢીની એમ બે પ્રકારની છે. વાતાનો આરંભ ધર બંધ કરીને બા સાથે શહેર જવા નીકળેલો નાયક બાના કહેવાથી તુલસીપાન અને ચાપટી ધૂળ લેવા પાછો જાય છે એ પ્રસંગથી થાય છે. વર્ષો પછી એ ધર નાયકના બંને ભાઈઓ વેચી નાંખવાની વાત કરે છે ત્યારે બાની લાગણીને સમજતો નાયક પોતે ધર ખરીદી લે છે. નાયક પણ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છે.

અને વળી પાછો પેલો જ પ્રક્રિયા તીબ્બો થયો છે કે ગામડાના ધરનું કરવું શું? નાયકના બંને દીકરાઓ જુદ્ધો મત ધરાવે છે. મોટો વેવી નાંખવાની વાત કરે છે તો નાનો સમારકામ કરાવવાની.

‘મારે ભાઈ નથી વેચવું કે નથી સમુંધ કરાવવું.’ મેં કહું થઈને કહ્યું.

ત્યાં મોટાની વહુ બોલી: ‘તો ત્યાં જ જઈને રહેને!’

મોટો બોલ્યો, ‘સાચી વાત છે’. (પૃ-૭)

આ નાનકડા સંવાદ પણી નાયકનું ચિત્ત ભૂતકાળની સમૃતિઓમાં જઈ પહોંચે છે. અહીં પરિસ્થિતિનું જે સત્ત્વિકરણ વાતાકારે કર્યું છે તે અગત્યનું છે. નાયકના બંને ભાઈઓએ પણ વર્ષો પહેલાં આ જ રીતે એ ઘર વિષે વાત શરૂ કરી હતી. વળી, ભગીરથ બ્રહ્મભટ્ટ એક પ્રયુક્તિ એ પણ કરી છે કે ભૂતકાળના પ્રસંગની સાથે જ ઘર પોતે પણ સજીવ બનીને નાયકને પોતાની જીર્ણ અવસ્થાની વાત કરે. માનવમનની આ ખાસિયત છે કે તે વર્તમાન બનાવની સાથે ભૂતકાળને જોડતું રહે છે. અહીં નાયકના ચિત્તમાં પણ એ પ્રસંગ જીવંત થતાં નાયક એ નિરૂપિય પર પહોંચે છે કે દીકરા અને વહુનો સંગાથ છોડીને ગામડાના ધરે જવું. નાયકનો આ નિરૂપિય એકાએક આવેશશી લેવાયેલો નથી. તેની પાછળ નાયકની આંતરિક મથામણ છે. આ મથામણ સંસ્મરણારૂપે અને સ્વખનારૂપે લેખકે દ્રશ્વી છે. સંસ્મરણોમાં નાયક પોતાના શૈશવ સુધી પહોંચે જાય છે. અહીં નોંધવા જેવું એ છે કે લેખકે માત્ર નવી પેઢીને જ મિલકતભૂખી દ્રશ્વી નથી. બાકી ધ્યાનભરે અંશે આવી વાતારો જૂની પેઢીને રામ અને નવી પેઢીને રાવણ તરીકી ચીતરે છે. પેઢી દ્વારા પેઢી લોભ અને લાલચની જેમ જ બા-બાપુજુનો વારસો પણ આગળ વધતો હોય છે. અને નાયક બાનો એ વારસો જ સાચવવા પાછો ગામડે જાય છે. ત્યાં ‘પરિકમા’ શબ્દનો નવો અર્થ ઉદેખે છે. ગામના ધરેથી શહેર પહોંચેલો નાયક વળી પાછો ગામના ધરે પહોંચે છે. કોઈ સરખામાણીના આશય વિના અહીં શિરીષ પંચાલની ‘હવેલી’ વાર્તા યાદ આવી જાય. ટૂંકીવાર્તામાં ક્ષારની પસંદગી અને સમયનું નિરૂપણ ખૂબ નાજુક બાબત છે. તેમાંય પાત્રના આંતરજગતને રજૂ કરતી વખતે તો સમય નિરૂપણ ખૂબ અગત્યનું તત્ત્વ બની રહે છે. સમય નિરૂપણની વાત કરતાં તે. સુરેશ જોખી લખે છે,

‘મોટા સ્થાપત્યના ભારને ટકવાને માટે કમાનની યોજના કરવામાં આવે છે. ટૂંકીવાર્તામાં સમયનો આ કમાનની જેમ ઉપયોગ કરવામાં આવે છે. દેખીતી રીતે

નહીંવત લાગતી છતાં અર્ધપૂર્ણતાનું ભારે ગુરુત્વ ધરાવનારી ઘટનાને સમયની નાની કમાન પર કેવી રીતે વહેંચી નાંખવી તેને સૂક્ષ્મ કલાસૂઝની અપેક્ષા રહે છે. જે બિંદુ ઉપર તીબ્બા રહીને ભૂત અને ભવિષ્યના પ્રદેશોમાં પૂરી આસાનીથી ઓલાં ખાઈ શકાય, ને એ રીતે ઘટનાના પરિમાશમાં બૃહત સક્રિત પ્રગટ કરી શકાય તે બિંદુની શોધ નવલિકાના સજ્જકી કરવાની રહે છે.’

ભગીરથ બ્રહ્મભટ્ટની વાતાંઓ સમયનિરૂપણની ટાણિએ ધ્યાન ખેંચે છે. પહેલી બે વાર્તા જ જુઓ. ‘બા વગરનું ઘર’માં ૨૦ વર્ષના લાંબા અંતરાલ બાદ નાયક ૬૦ વર્ષ જૂના ઘરમાં પ્રવર્શે છે. અને ઘરમાં પ્રવેશતા જ ભૂતકાળ જીવંત થાય છે. બીજી વાર્તામાં ગામડાના ઘરની વાતે દીકરાઓ સાથે બોલાયાલી થતાં નાયક સૂઈ જાય છે અને સ્વખનારૂપે ભૂતકાળ જીવંત થાય છે. અહીં ભૂતકાળ પણ ભારતરૂપે નહીં પરંતુ નાયકના પ્રશ્ના જવાબરૂપે આવે છે. જ્યારે ત્રીજી વાર્તા ‘બાપાનો વારસો’માં ગામમાં લગ્નપ્રસંગે ૨૫ વર્ષ નાયક પહોંચ્યો છે. નાયકના ચિત્તમાં બાપા જીવંત થાય છે કૃદ્ધ છોટાકાડા સાથેની વાતચીતથી. છોટાકાડા સિવાયના બાપાને ઓળખનારા અન્ય વૃક્ષો મૃત્યુ પામ્યા છે. અહીં બાપાનું પાત્ર બે રીતે જીવંતું થાય છે: એક, નાયકની સ્મૃતિરૂપે અને બીજું છોટાકાડાની સ્મૃતિરૂપે. નાયકની સ્મૃતિમાં બાપાના સંઘર્ષો સયવાયેલા છે. જ્યારે છોટાકાડાની સ્મૃતિમાં બાપાએ ગામલોકોના પ્રસંગો જે રીતે પાર પાડ્યા હતાં એ જળવાયેલા છે. ભગીરથ બ્રહ્મભટ્ટ બાપાના ભીતરી સંઘર્ષ અને તેમના બાધ્ય વ્યક્તિત્વને-આ બે પાત્રોની સ્મૃતિઓ વડે જોડ્યું છે. અહીં સ્મૃતિઓનું સત્ત્વિકરણ જોવા જેવું છે. એથી આગળ વધીને જોઈએ તો, તૂટેલા ઘરનું વાર્ષન એ બાપાની અને નાયકના ઘરની કથળેલી આર્થિક પરિસ્થિતિ બતાવે છે. એની જ વિરોધે મામને પરાણાવતો, બીજાના લગ્નપ્રસંગોએ જાતને ઘસી નાંખતો કે પાંચસો-પાંચસો માણસોને એકસાથે સાચવી લેતો રૂઘનાથ જોવા મળે છે. તૂટેલું ઘર અને રૂઘનાથનું વિરાટ વ્યક્તિત્વ એકબીજાની પડખે મૂકાય છે. નાયકને બાપનો આ વારસો મળેલો છે. નાયકને રૂઘનાથના દીકરા તરીકી ઓળખને છોટાકાડા કહે છે,

‘તારા બાપા જેવો કોઈ ભલો આદ્ભુતી આ ગામમાં બીજો કોઈ મી જોયો નથી. એટલો ભલો કે સૌનું કામ કરે, કોઈને ત્યાં પ્રસંગ હોય એટલે તારા બાપને સોંપી દેવાનું.’ (પૃ-૧૧)

અહીં રૂઘનાથ મર્યાદા આટલા વર્ષો બાદ પણ જીવંત

હોવાની અનુભૂતિ થાય છે. એમાંથી લગ્નપ્રસંગે ગામમાં જમણવારને બદલે હોલમાં બૂકેપ્રથા આવી ગઈ છે. તેના ઉત્તરમાં છોટાકાકા કહે છે તેમ હવે ગામમાં રૂઘનાથ નથી. અહીં સહજપણે અલ પચિનોની ફિલ્મ ‘સ્ટેન અપ ગાઈઝ’નો આ સંવાદ યાદ આવી જાય.

You know, they say we die twice, Once when the breath leaves our body and once when the last person we know says our name’

રૂઘનાથ જેવા બીજા માટે જાત ઘસી નાખનારા માણસો ઘટા જાય એટલે સામાજિક સંરચના પણ તૂટતી જાય. આવો આછો સંકેત છોટાકાકાના કથનમાંથી મળી રહે છે. આ સંકેતોના કારણે જ વાર્તા માત્ર એક રૂઘનાથની ન રહેતાં નાના-મોટા આવાં અનેક રૂઘનાથની બની રહે છે. ભાવકને પણ આ વાર્તા વાંચતાં પોતાની આસપાસના આવાં જીવંત કે મૃત વ્યક્તિઓ યાદ આવી જાય. **‘Who packes your parachute’** નામનું કેમેઇન ચાલ્સ પ્લામ્બ નામના યુ.એસ. નેવીના ફાઈટર પાઈલોટે ચલાવ્યું. અહીં વાત રૂઘનાથ જેવી બેકસ્ટેજમાં રહેલી વ્યક્તિઓને યાદ કરવાની છે કે જેના કારણે આપણું જીવન સલામત અને સરળ બનતું હોય છે. આ વાતમાં રૂઘનાથનું પાત્ર વાંચતાં પુ.લ.દેશપાટેના રેખાચિત્રસંગ્રહ, ‘ભાત ભાત કે લોગ’માં આલોખાયેલ ‘નારાયણ’ યાદ આવી જાય. આ અને આવાં અનેક સંદર્ભોને લીધે ‘બાપાનો વારસો’ વાર્તા નાયકનું પોતીકું સંવેદન ન રહેતાં વ્યાપક અનુભૂતિની વાર્તા બની રહે છે. વિજય શાસ્ત્રી ટૂંકીવાર્તા વિશે વાત કરતાં કહે છે,

‘Prose-એટલે માનવસંદર્ભયુક્ત ગદ્ય અને Tale-એટલે તે માનવસંદર્ભની માત્રાનું ન્યૂનિકરણ કરીને થયેલું પુનઃ વિધાન.’

ભગીરથ બ્રહ્મભણું વાર્તાકાર તરીકે આ બાબત ‘બાપાનો વારસો’ જેવી વાર્તામાં સિદ્ધ કરી શક્યા છે.

આગળ નોંધ્યું તેમ અધૂરપણો ભાવ અને સંભાવનાઓનું જગત આ વાતસંગ્રહનો વિશેખ છે. સ્ત્રી-પુરુષ સંબંધમાં તો આ ભાવ બદ્દ મહત્વનો ભાગ ભજવે છે. આપણી સામાજિક સંરચના પણ એ પ્રકારની છે કે લગ્ન પછી જીવનસાથી સાથે પણ પોતાના ભૂતકાળ વિશે ખુલ્લીને વાત ન કરી શકાય. પુરુષપ્રધાન સમાજ હોવાને કારણે સ્ત્રી તો પતિ સામે પોતાના લગ્ન પૂર્વના કોઈ પુરુષનો-

ચાહે તે પ્રેમી હોય કે ન પણ હોય-ઉલ્લેખ ન જ કરી શકે. સામાપક્ષે પુરુષ પણ પત્ની સામે આવી કોઈ કબૂલાત કરતાં અચ્યકાય છે. ભગીરથ બ્રહ્મભણું આ નાજુક સંબંધમાં આવા સંવેદનોની પહી અસરોને અહીં કલાત્મક રીતે આલોખી છે. વ્યક્તિનું જીવન અનેકવિધ શક્યતાઓથી ભરેલું હોય છે. સંભાવનાઓના અનેક રસ્તાઓ નજર સામે હોય છે. એમાંથી કોઈ એકની જ પસંદગી થઈ શકે છે. વ્યક્તિ એક પસંદગીના રસ્તે આગળ વધે કે તરત અન્ય સંભાવનાઓ આપોઆપ ભૂસાતી જાય. પણ આગળ નોંધ્યું તેમ માનવીનું અવગણ્યું મન પસંદગીના રસ્તે આગળ વધા પછી પણ પાછું પેલી છોડી ધીયેલી સંભાવનાઓ વિશે વિચારતું રહે છે. તો ક્યારેક કોઈ ક્ષાણ જ એવી રવાય છે કે અચ્યાનક એ જુદી સંભાવના વર્તમાનની ક્ષાણને સ્પર્શી જાય. અને એ દ્વારા મનુષ્યના ચિત્તમાં સંસ્મરણોની ડાયરીના કેટલાંક પૃષ્ઠો ક્ષાણવાર પૂરતા ખૂલ્લી જાય. વાર્તાકારે ‘વ્યક્તિ એક-પડછાયા બે’, ‘બીજે ક્યાંક’, ‘ધક્કો’, ‘ટેકનિક’, ‘સૌનાની વીંટી?’ ‘અમારી દરિયો’, ‘નમારી વેલના પ્રભર પુષ્પો’, ‘આભમાં વાદળથેરી શૂન્યતા’ અને ‘અધૂરૂપ’-આ વાર્તાઓમાં માનવમનની આ સંભાવનાઓને, તેના વિધવિધ રૂપોને આલોખ્યા છે.

ટૂંકીવાર્તા વિશે વાત કરતાં રા.વિ.પાઠક લખે છે કે,

જડસૃષ્ટિના નિયમોમાં ગમે તેટલી છૂટ લઈ શકાય, પણ માણસના સાચા સ્વભાવની બાબતમાં લેશ પણ છૂટ ન લઈ શકાય.’

કોઈ વાર્તાકાર ભલે પાત્રના ચૈતસિક સંવેદનોને જ આલોખતો હોય છતાં તેણે મનુષ્ય સ્વભાવ અને સામાજિક સંરચનાની અદશ્ય જગ-આ બે બાબતોને તો આલોખવી જ પે. વાર્તાકાર તરીકે ભગીરથ બ્રહ્મભણું પાત્રના અંગત સંવેદનો પર વધુ ભાર મૂકતા જાણાય છે. પહેલી નજરે અહીં સામાજિક તાણાવાણા ન હોય એમ લાગે. પરંતુ જ્યારે વાર્તાઓને ધ્યાનપૂર્વક વાંચીએ છીએ ત્યારે પાત્રોના મનોભાવો પર આ સામાજિકતાનો ધબ અનુભવાય છે. એ વિના ‘વ્યક્તિ એક-પડછાયા બે’ની નાયિકા પ્રેમાળ પતિ સામે જૂદું ન બોલે કે ના ‘ટેકનિક’ વાર્તાના પતિ-પત્ની એકબીજાને ગોળગોળ જવાબ આપે. આ કારણોસર જ ભગીરથ બ્રહ્મભણુના પાત્રો હવાઈ બન્યાં નથી.

‘બીજે ક્યાંક’ નાયિકાના કથનકેન્ત્રથી કહેવાયેલી વાર્તા છે. ૪૫ વર્ષની નાયિકાના લગ્નજીવનને રંગ વર્ષ પૂરા થયાં છે. દીકરો ૧૬ વર્ષનો છે. અને છતાંથી નાયિકા તો એવી,

જે સમરણોમાં ખોવાઈ જાય ત્યારે પોતાની સાચુકલી વય સાવ જ ભૂલી જાય. વર્ષોથી ઉનાળાના હિંસોમાં સંચે પતિ સાથે એક જ રસ્તે ચાલવા નીકળે. અને સરધર બાળના એક ચોક્કસ બાંકે દ્સ મિનિટ બેસે. ૨ ઉ વર્ષ અચાનક પતિ આ કમ તોડે. અને વખણાતા આઈસકીમ પાર્લરમાં લઈ જાય.

‘ગાણેશનો આઈસકીમ શહેરમાં વખણાય...તેવીસ વરસે આજે નવરો પડીને ખાસ આગ્રહપૂર્વક મને મારો પતિ ‘ત્યાં લઈ જતો હતો.’ (પૃ-૮૦)

સાંજનું સુંદર વાતાવરણ હોય. નાયિકા પણ આનંદમાં હોય. અને ત્યાં જ અચાનક ચિરંતન-નાયિકાની સાથે શાળામાં ભણાનારો, નાયિકાનો પ્રથમ પ્રેમી આવી પહોંચે. પતિ સાથે આઈસકીમ ખાતી બેઠેલી નાયિકાના મનમાં જુના સંસ્મરણો તાજા થાય. નાયિકાના જ શબ્દોમાં કહીએ તો, ‘તેની આંખોમાં દરિયા ઉછો.’ ચિરંતન તો બેધયાનપણે બે-ચાર ક્ષાળ પૂરતો બેસીને ત્યાંથી ચાલ્યો જાય. બીલ ચૂકુવતી વખતે પણ પાર્લરના શેડિયા સાથે કોઈક વ્યક્તિ ચિરંતન વિશે વાત કરી હોય. નાયિકા કાન દઈ સાંભળે. પતિ પૂછે કે આઈસકીમ કેવો હતો? જવાબમાં નાયિકા કહે, ‘ગરમ. સરસ.’ અહીં વાતાકારની ખૂબી એ છે કે તેમણે યોગ્ય ક્ષાળ પસંદ કરી છે અને નાનાનાના સેકેતો સુંદર રીતે મૂકી આપ્યાં છે. જેમ કે, આરંભે જ નાયિકાનો તેના પતિ સાથે ચાલવા જવાના કમનો ઉદ્દેશ જવનમાં આવી ગયેલી એકવિધતાથી નાયિકા કંટાળેલી છે એનો જ્યાલ સુશ્રી ભાવકને આવી જાય. બીજો સેકેત નાયિકા પોતે જ કહે કે ‘સમરણોમાં ખોવાઈ જાઉ છું ત્યારે લાગે છે કે હું તો એવી ને એવી જાણો!’ (પૃ-૮૮) ગ્રીજો સેકેત બરોબર તેવીસ વર્ષ પછી આગ્રહ કરીને પતિ આઈસકીમ ખાવા માટે લઈ જઈ રહ્યો છે. અને એ ઉકેખોમાં ‘નવરો પડીને’ તથા ‘ખાસ આગ્રહપૂર્વક’ આ બંને શબ્દો નાયિકાના હંદ્યના કોઈક ખૂણે રહેલી ફરિયાને, અસંતોષને દ્શાવિ છે. એટલે ખરી વાતાની ક્ષાળ તો ત્યાં જ શરૂ થઈ જાય છે. તેમાંથી તેવીસ વર્ષ પતિ સાથે ‘ત્યાં’ જઈને બેસે અને એ ક્ષાળ હજુ પાછાર બને અને એ પેલી ફરિયાદ કંઈક આઠી થાય એ પહેલાં તો ત્યાં ચિરંતન આવે. વાતાકારની ખરી કમાલ આ વાતમાં જ રહેલી છે. લગલગાટ આટલા વર્ષોથી યાંત્રિક રીતે વીતતા જતાં વૈવાહિક જીવનમાં ભીતરથી નાયિકા જે ખાલીપો અનુભવે છે તે અહીં તીવ્રતાથી ઉપસી આવે છે. આટલાં વર્ષ અચાનક જ ચિરંતનને જુએ પણ તેની સાથે

વાત ન કરી શકવાથી નાયિકા વસવસો અનુભવે.

‘મારે એને પૂછુવું જોઈતું હતું-ઓળખાણ તાજુ કરાવી હોતું તો શું વાંધો આવત ! અમને તો ખાસ કંઈ વાંધો ન પડત. અરે! હું ઊભી કેમ ન થઈ !’ (પૃ-૮૮)

નાયિકાને ભલે આ સવાલ મૂંજવતો પણ સામાજિક સંરચનાની જળ જ એવી છે કે તે ઊભી ન થઈ શકે. વાતાનું શીર્ષક ‘બીજે ક્યાંક’ નો ધ્વનિ આ મુલાકાત પછી સાવ બદલ્યા જાય છે. વળી, બીજું એ નોંધવા જેવું છે કે લેખક નાયિકાને વીસીમાં વિહરતી બતાવી નથી. પ્રૌઢ વધની નાયિકાનું આ તરલ સંવેદન કરવાશથી ભરેલું નથી. નારીવાદી વાતાવરણોની નાયિકાની જેમ ફરિયાનો સૂર તીવ્ર બનતો નથી. પરંતુ નાયિકામાં રહેલી બીજી નાયિકા વાતાકારની આંખ જોઈ શકે છે. અહીં અનાયાસપણે **Netflix** પર આવેલી ‘**Lust Stories**’ યાદ આવી જાય. તેમાં સર્જકોએ જુદી જુદી વધની અને જુદો જુદો પરિવેશ ધરાવતી ભારતીય સ્ત્રીઓ શ્રી રીતે જાતીય સંવેદન અનુભવે છે તેની રજૂઆત નાનીનાની વાતાવરણો દ્વારા કરી છે. રૂઢીયુસ્ત ભારતીય સમાજમાં સ્ત્રીને મુક્તપણે આવી વાત રજૂ કરવાનો હક જ ક્યાંથી મળે? અહીં એ યાદ કરવાનું કારણ એટલું જ કે વાતાકાર આ વાતાસંગ્રહમાં જુદી જુદી વધની સ્ત્રીઓના સ્નેહના સંવેદનોને સુંદર રીતે રજૂ કરે છે.

‘વ્યક્તિ એક-પદછાયા બે’ની નાયિકા સ્નેહા. ‘બીજે ક્યાંક’ની નાયિકા કરતાં વધમાં વધણી નાની છે. સમીર અને સ્નેહાના લશજીવનની ત્રીજી વર્ષગાંદ છે. બંનેના સંબંધમાં ક્યાંથી ઊણપ, અધૂરપ કે ફરિયાદ નથી. છતાંય મેગેઝીનના પાનાં ફરવતાં સ્વાન્જિલના મૃત્યુના સમાચાર વાંચ્યેને સ્નેહા અતીતમાં ખોવાઈ જાય. વધેલા ગાંગડા ભૂલમાં ચાળેલા લોટ ભેગા નાંખી દે. ત્યારે સવાલ થાય કે આવું શા માટે? સમીરના પ્રેમમાં કોઈ ખોટ નથી. સ્નેહા પણ તેને ચાહે છે. શું માત્ર સ્વાન્જિલ સાથેનો પ્રથમ પ્રેમ છે એટલે જ ? અને આવી મુખ્ય પોચ્યત પ્રેમલા-પ્રેમલીની આ વાતા છે ખરી? જવાબ છે સ્પષ્ટ ‘ના’. ભગીરથ બ્રહ્મભટે એક અત્યંત નાજુક એવું સંવેદન અહીં ગૂંઘું છે. નાયિકા સાહિત્યની શોખીન છે. સમીર કોમર્સ ભાણેલો છે, સાહિત્યમાં રૂચિ પણ ધરાવે છે. પરંતુ સ્વાન્જિલની કવિતાઓ, વાતાવરણોની પ્રેરણામૂર્તિ સ્નેહા છે એવો ભાવ સ્નેહા અનુભવે છે. તેનો આ ભાવ સાચો પણ છે. એક સામાન્ય ગૃહિણી એવી સ્નેહા કોઈક સાહિત્યકારની પ્રેરણામૂર્તિ છે. એ વાતે તે સ્વાન્જિલ સાથે જોડાયેલી છે. રાજા રવિવર્મા અને સુગંધાનો

સંબંધ જાણતા હોઈએ તો સ્નેહાનું આ સંવેદન સમજ શકાય. આથી જ સ્નેહ મનોમન સ્વાભિનિલે ‘ગુમાવેલા ભરથાર’ તરીકે જુએ છે, વિચારે છે અને જીવે છે. પોતાની લઘૃતિથિના દિવસે જ આવા ભરથારના મૃત્યુના સમાચાર મળે. જારોકે સ્નેહાનું પ્રેરણામૂર્તિ તરીકે કાયમી મૃત્યુ. અહીં મુંઘ પ્રેમ કે જાતીય આકર્ષણની વાત નથી. પણ પોતે એક પૂરુષની દસ્તિ અસામાન્ય ક્રી છે એ સંવેદન અગત્યનું છે. ‘બીજે કયાંક’ ની નાયિકામાં હજુ પેલો રોમાંય જીવંત છે. તેને અચાનક જ ભૂતકાળ બેટી જાય છે. તો સ્નેહાને મેગેજીનના પાણાં ફેરવતાં પેલી સંભાવનાઓના દરવાજા કાયમી ધોરણે પૂરૈપૂરા બીજાઈ જતાં લાગે. બંને નાયિકાઓ આ વિશે પોતાના જીવનસાથીને કંઈ કહી શકી નથી.

‘ધક્કો’ વાર્તાનો નાયક ઓચિતા જ એક લગ્નપ્રસંગે એક વૃદ્ધને મળી જતાં પોતે જે સંભાવનાઓને ભૂંસી નાંખી હતી એ સંભાવના પર પહોંચી જાય છે, પણ ધક્કા સાથે. નાયક ભાર્ગવ ભૂંસી લશમાં જે વૃદ્ધ સાથે મુલાકાત થાય છે તે વૃદ્ધ રૂપ વર્ષ પહેલાં ભાર્ગવ સમક્ષ પોતાની દીકરી અર્થના માટે આવેલા. એમ.એ. ફાઈનલામાં ભાણતો ભાર્ગવ તેની સાથે ભાણતી અર્થનાને ઓળખે છે. અર્થનાના પિતા લશની વાત કરીને જાય છે પછી બીજા દિવસે અર્થના ન મળતાં નાયકને નવાઈ લાગે છે. સાથે જ પેલો શહેરની છોકરીઓ માટેનો એક પૂર્વગ્રહ. તેનું આ વિધાન જુઓ.

‘અર્થના સમયસર આવે ને, સમયસર નીકળી જાય. ન કોઈની સાથે વાત કે ચીત. પછી વહેમ પણ ન પેડે કે ક્યાં જતી હશે! પણ મનમાં ઊડ ઊડ વહેમ પડ્યો કે શહેરની છોકરીઓ વિરો કાંઈ ન કહેવાય...’ (પૃ-૩૩)

પૂર્વગ્રહથી પીડિત ભાર્ગવ અર્થનાના ઘરે પહોંચી જઈને કંઈ જાણ્યા-કર્યા વિના કહી દે છે કે અર્થના તો કોલેજ આવતી જ નથી. અને જીવારે અર્થના સાથે મુલાકાત થાય ત્યારે અર્થના લાઈબ્રેરીમાં વાંચતી બેઠી હોય. તે રડતી આંખે નાયકને ફરિયાદ પણ કરે કે, ‘જાણકારી મેળવ્યા વિના આવી ફરિયાદ કરવાનું કારણ શું?’ દીછ્યવા છતાં નાયક અર્થનાની માફી ન માંગી શકે. ત્યાર બાદ ભાર્ગવને કોલેજમાં અધ્યાપક તરીકે નોકરી મળી જાય. વળી પેલા પ્રૌઢ ત્યાં તેને મળવા આવી પહોંચે. એ ટૂંકી વાતચીત ખૂબ અગત્યની છે.

‘ત્યાં જ એમણે પૂરુષું-એમ.એ.માં કેટલા ટકા આવ્યા? મેં કહ્યું-પંચાવન.’
‘અમારે અર્થનાને ફસ્ટ કલાસ આવેલો.’

‘ના હોય! અભિનંદન આપણે મારા તરફ થી’ મેં કહ્યું. પછી હળવેથી તેમણે જ પૂરુષું-પછી તમે શું વિચાર્યું!’ મેં ઘડ દઈને કહી દીધું-‘મને શહેરની છોકરીઓ ગમતી નથી.’ (પૃ-૩૪)

આ નાનકડો સંવાદ નાયકનો પુરુષપણે અહુમ ઘવાતા તે કેવી પ્રતિક્રિયા આપે છે તે દ્વારિ છે. અર્થનાના તેનાથી વધુ માર્ક છે તે જાણીને નાયકના અહુમને ધક્કો લાગે છે. પોતાના અહુમના બચાવ માટે તે જે જવાબ આપે છે તેનાથી પેલા વડીલને એનાથી વધુ કારમો ધક્કો લાગે છે. અને જીવારે નાયકનો આ જવાબ પેલી સીધીસાદી અર્થના જાણે ત્યારે તેને કેટલો મોટો ધક્કો લાગ્યો હશે એની તો કલ્પના જ કરવી રહી. રણજિતરામ મહેતા ટૂંકીવાતની વ્યાખ્યા આપતાં કહે છે,

‘એક જ પાત્ર, એક જ બનાવ, એક જ મનોવેગ કે એક જ પ્રસંગાને લીધે ઉપજતી આવેશ પરંપરા જે કથામાં આલેખાયા હોય તેને ‘નાની વાર્તા’ કહી શકાય.’

ભગીરથ બ્રહ્મભંડે આ વાર્તામાં અર્થનાની પ્રતિક્રિયા વાચ્યકની કલ્પના પર છોડી દીધી છે જે યોગ્ય જ છે. નાયકને પોતાની ભૂલ પણ સમજાય છે. તે અર્થનાને અભિનંદન આપતો પત્ર લાખે છે. પણ આ અપમાન અર્થનાના પિતા ભૂલી શકતા નથી. અને ફરીવાર પત્રવ્યવહાર ન કરવા ભાર્ગવને જાણુવે છે. આ વડીલ સાથે ઓચિતી જ મુલાકાત થતાં નાયકના અચેતનમાં રહેલો પેલો અપરાધભાવ ધક્કા સાથે બાહાર આવે છે. નાયક સંવેદનશીલ છે અને તેનો આ અપરાધભાવ લેખકે આરોપેલો નથી તેની સાભિતી વાતના આરંભે આવતાં આ બે ઉદ્ઘેખો પરથી મળી રહે છે.

‘કોઈ માણસ કુણી લઈ એ આંભાના ઝડ પર ચઢ્યોને, એ હાલતી ડાળને એણે કાપી નાખી. હું જોતો જ રહી ગયો.’ (પૃ-૩૦)

બસ સ્ટેને રિક્ષા થોભી હતી ત્યાં એના આગળના પૈડા આગળ એક સંતરું પૈડા નીચે આવી ગયું.’ (પૃ-૩૦)

આવો સંવેદનશીલ સ્વભાવ હોવાને કારણે ભાર્ગવ રૂપ વર્ષ પણ પેલા વૃદ્ધ સાથે આંખ મિલાવી શકતો નથી. તેમને જોતાં જ ‘કરંત’ અનુભવે છે. અહીં નાયક તીવ્ર અપરાધભાવ અનુભવે છે. વળી, વાતનું શીર્ષક ‘ધક્કો’ પણ સૂચક છે. એક ધક્કો નાયકના જવાબથી રૂપ વર્ષ પહેલાં અર્થના અને તેના પિતાએ અનુભવ્યો હતો. તો બીજો ધક્કો નાયક આ મુલાકાત વખતે અનુભવે છે. અહીં અર્થના વિશે જાણવાની પ્રબળ જિજાસા હોવા છતાં નાયક

ત્યાંથી દૂર સરી જાય છે. એટલે પેલી સંભાવનાઓ પર નાયક જાતે જ પૂર્વવિરામ મૂકી દે છે. પણ આ મુલાકાત તેના અપરાધભાવને તાજો કરી દે છે.

‘સોનાની વીંટી?’ વાર્તામાં કથનકેન્દ્ર નાયકનું છે. ભૂતકાળમાં પ્રેમિકાએ યાદગીરીરૂપે આપેલી વીંટી નાયક સાચવી રાખી છે. નાયક એ વીંટી સોનાની છે એમ કહીને તિજોરીમાં મૂકી રાખે છે. અને ઘનતેરસે પૂજા કરતી વખતે એ બહાર ઢાડે છે. ક્યારેક નાયક તે વીંટી પહેરી પણ લે છે. પત્ની અને દીકરાઓને આ જૂની રીતાઈની વીંટી ગમતી નથી. નાયકની પત્ની એક દિવસ એ વીંટી વેચી મારે છે. ત્યારે નાયક કહે છે,

‘પડી રહેતી’ તી તો એ મારી તિજોરીમાં અને એક બાજુ પડી રહેતી’ તી. એમાં વળી એનો તને શું ભાર લાગ્યો? પડી રહેવા દીધી હોત તો?’ (પૃ-૬૨)

વેચે છે ત્યારે ખબર પેડ છે કે વીંટી તો એટલી કી મતી નહોતી. પણ અહીં વીંટી તો ઉદ્દીપન છે. જેના સ્પર્શો નાયક જૂના સંસ્મરણો તાજા કરી શકે છે. વીંટી સોનાની હોય કે ન હોય, સંસ્મરણો તો સોનેરી છે. એટલે જ સ્વખનમાં પણ વીછણ આવે ખરી પણ નાયકને ડંબે નહીં. એ સર્કેટ મહુત્વનો છે. આ નાયક પણ એ છૂટી ગયેલી સંભાવનાઓને વારંવાર જીવવા મથે છે. પત્નીથી ચોરીછૂપે વીંટીને સ્પર્શની એ સંસ્મરણોને તાજા કરી લે છે. વીંટી જાણે કે તેનો જાહીર ચિરાગ છે. નાયક પોતે જ પોતાના વિશે વાત કરતાં કહે છે,

‘હું અકારણ મને પ્રશ્નો પૂછતો રહું છું, અકારણ મને મૂઝવતો હું અકારણ મને મનાવતો રહ્યો છું.’ (પૃ-૫૮)

આ અકારણ નથી પણ સકારણ છે. ગમતાં સંસ્મરણો યાદ કરવાની મજાબુદ્ધ માત્રને ટેવ હોય છે. અને એમાંથી આ તો પ્રેમિકાએ યાદગીરીરૂપે આપેલી વીંટી. નાયક અનેકવાર કહ્યા છતાં પણ પાછી નહોતી લીધી એવી વીંટી. જો વીંટી જોઈને દુધ્યંત દુર્વાસાના શાપમાંથી મુક્ત થઈને શકુંતલાને ઓળખી શકતો હોય તો આપણો આ નાયક વીંટી જોઈને, વર્તમાનમાંથી છટકીને જૂના સંસ્મરણો તાજા કરી લે એમાં તે શી નવાઈ! આથી જ પત્ની વીંટી વેચી નાંબે છે તેનો નાયકને વધુ આઘાત લાગે છે. પ્રશ્ન વીંટીનો નથી. પણ તેની સાથે જોડાયેલી યાદો અને એ યાદો દ્વારા વારંવાર પેલા ભૂતકાળના સમરણામાં જીવવાનો છે. કહો કે, નાયકનું ચિત્ત વીંટીના સહારે ટાઈમ ટ્રાવેલ કરીને અતીતમાં પહોંચી જાય છે. પેલી મનગમતી સંભાવના એ વીંટીના સહારે જ

જીવાય છે. અને નાયક એ હદે સ્મૃતિઓને સંતારીને બેઠો છે કે વીંટી આપનારીના નામનો પણ ઉલ્લેખ કરતો નથી. પત્ની એ વીંટી વેચી નાખીને જાણે કે એ સંભાવનાને જ બંધ કરી દે છે.

‘ટેકનિક’ વાર્તાનો નાયક ‘સોનાની વીંટી?’ વાર્તાના નાયક કરતાં વધારે ચુતુર છે. સાહિત્યકાર છે એટલે અધૂરી રહી ગયેલી કે છોડી દેવી પેલી સંભાવનાઓને પોતાની વાતાસુષ્ઠિઓને નવેસરથી રચીને જીવી લે છે. આ જ તેની ટેકનિક છે સંભાવનાઓને, સ્મૃતિઓને જીવવાની. પણ સાથે ભય અનુભવે છે કે જો પત્ની જાણી જશે તો? કારણ કે પોતે સર્જક છે તેથી જાણે છે કે સાચી અનુભૂતિ કે સાચું સંવેદન ગમે તેટલી પ્રયુક્તિઓ વાપરવા છતાં છૂપાઈ શકે નહીં. પણ એક વાર્તામાં નાયિકા તરીકે નયના શાહેનું નામ આવી જાય છે. તરત નાયકને બીક લાગે છે કે જો પત્ની પૂછુશે કે આ નયના કોણ છે તો? વાર્તા વાંચ્યા બાદ પત્ની આશધાર્યો સવાલ પૂછે છે કે, ‘તમે નયનાની જગ્યાએ મારું નામ મૂક્યું હોત તો?’ (પૃ-૧૦૦) આવો અનપેક્ષિત પ્રશ્ન સાંભળીને નાયક મૂંજાઈ જાય છે. ‘પણ આ તો ટેકનિક’, નામ મૂકવાની ટેકનિક’ એમ કહીને વાત વાળી લે છે. નાયકનું સદ્ભાગ્ય ગણો કે કમભાગ્ય, તેની પત્ની પણ વાતાઓ લખતી થઈ જાય છે. તેમાંથી એક વાર્તા તો એટલી સુંદર લખે છે કે નાયક પોતે એ વાતે ગૌરવ અનુભવે છે. સાથે જ એ વાર્તામાં આવતું એક પાત્ર રાજુ-તેનું વર્ણન વાંચીને નાયકને વહેમ જાય છે કે આ રાજુ કોણા? પત્નીએ પોતાને આ નયના કોણ? એવો સવાલ નહોતો પૂછ્યો. આથી પત્નીને પૂછ્યાં શી રીતે? અને પોતે લોખ હોવાથી જાણે છે કે અનુભૂતિની સચ્ચાઈ વિના આવું સચોટ આલેખન સંભવે નહીં. એટલે છેવટે પત્નીને હસતાં હસતાં પૂછી બેસે છે, ‘આ રાજુ કોણ છે?’ જવાબમાં પત્ની કહે છે,

‘રાજુની જગ્યાએ તમારું નામ પણ મૂકી શકાય. પણ આ તો તમે કહેતા હતા તેમ ટેકનિક. તમારા જેવી ટેકનિક-નામ મૂકવાની ટેકનિક.’ (પૃ-૧૦૧)

ભગીરથ બ્રહ્મભણી સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને નર્મર્મર્મવાળી ભાષા-એ બંનેનો આ વાર્તામાં અદભુત સંયોગ થયો છે. સાવ નાનકડી એવી આ વાર્તા બહારથી ચુંખી દેખાતા દંપત્તિઓનું સચોટ એવું વિશ્વેષાગું છે. આપણા સમાજમાં લગ્નની રજતજ્યંતીઓ ઊજવાય છે પણ પત્તિ-પત્ની બંનેના મનજા કોઈક ખૂણે નયના અને રાજુ

ઇંગ્રિયલા હોય છે. એકબીજાની સામે પોતાનો ભૂતકાળ કહેતાં પણ અચકાઈએ અને છતાંથી ટેકનિકથી વર્ષો સાથે જીવી લઈએ. સ્વી-પુરુષ સંબંધની દિલ્લિએ વિચારીએ તો આ ટેકનિક સંબંધ માટે તો અયોગ્ય જ ગણાય. વ્યક્તિ જીવનસાથી સાથે પણ એક પર્સોના રાખીને જીવન વીતાવે એનાથી મોટી કરુણા શી હોઈ શકે? મનોવિશ્લેષણાત્મક રીતે જોઈએ તો સ્વી-પુરુષ સંબંધમાં આવી ટેકનિક્સ ન હોવી જોઈએ. પણ અહીં વાર્તાકાર કલાત્મક રીતે પોતાની આસપાસના સમાજનું જે સચોટ વિશ્લેષણ કરે છે તે અગત્યનું છે. અને આ પણ એક રીત છે ટેકનિક વાપરીને પેલી સંભાવનાઓમાં સરી જવાની. કહોકે, વર્તમાનમાંથી ભાગી ધૂટવાની.

વ્યક્તિ મનમાં ને મનમાં ભૂતકાળમાં રહી ગયેલી સંભાવનાઓને કે અધૂરપને નવેસરથી જીવી લે. પણ ક્યારેક વ્યક્તિ વાસ્તવિક જીવનમાં પણ એ સંભાવનાઓના દ્વાર પર જઈને તેને ખોલવાનો પ્રયાસ કરે તો શું પરિણામ આવે? વાર્તાકાર તરીકી ભગીરથ બ્રહ્મભંડ આનો ઉત્તર ‘અમાસી દ્રિયો’ અને ‘નમણી વેલનાં પ્રભર પુષ્પો’ એ બે વાર્તાઓ દ્વારા આપે છે. વાર્તાકાર બે જુદી જ સંભાવનાઓ બાતાવે છે. ‘અમાસી દ્રિયો’ની દીપા ભાણવામાં તેજસ્વી હોવા છતાં લગ્નજીવનની પરીક્ષામાં નાપાસ થાય છે. વર્ષો પછી પ્રો. ભંડનો નંબર મેળવીને ફોન કરે છે. તેનો અવાજ સાંભળીને સામેથી ઉઘમાભર્યો જવાબ મળે છે ‘દીપા, પેલા માનવતાવાગાં?’ એ સંભાળતાવેંત દીપાના હૃદયમાં સ્નેહની ભરતી આવે છે. અહીં દીપા માટે એ ભૂતકાળની સ્મૃતિઓ માત્ર સ્મૃતિઓ ન રહેતાં સુખદ વર્તમાનની સંભાવના સૂચવનારી બની રહે છે. ‘નમણી વેલનાં પ્રભર પુષ્પો’નો નાયક વર્ષો પછી આવી જ રીતે ભૂતકાળની સુખદ સ્મૃતિમાં સચ્ચવાયેલી રેખાને મળવા પહોંચ્યો જાય છે. પણ રેખા નાયકને ઢંડી રીતે આવકારીને નાયકની સુખદ સંવેદનાઓ પર, સ્મૃતિઓ પર પાણી ફેરવી હેઠળ. ભગીરથ બ્રહ્મભંડ આ વાર્તામાં જરા હટકે કહી શકાય એવું સ્વી પાત્ર આલેખ્યું છે. તેમના બંને વાર્તાસંગ્રહોમાં રેખાનું પાત્ર જુદું તરી આવે છે. નાયકના કથનકેન્દ્રથી આ વાર્તા કહેવાઈ છે. નવોસવો અધ્યાપક તરીકી જોડાયેલો નાયક વિદ્યાર્થીની રેખાના સંપર્કમાં આવે છે. રેખા સામે ચાલીને નાયક સાથે સંબંધ વધારે છે. પોતાના ધરે પેંગાળેસ્ટ તરીકી રાખે છે. નાયક ના પાઢે છતાં નાયકની બધી સગવડો સાચવી લે છે. મોટી રાતે કવિતા લઈને નાયક પાસે આવે અને ક્યાંય સુધી બેસી રહે. સામે

ચાલીને નાયક સાથે ફિલ્મ પણ જોવા જાય. આ બધાં જ સંસ્મરણો નાયકના ચિત્તમાં જગ્નવાયેલાં છે. નાયક રેખાનું સરનામું ખોળીને તેને મળવા માટે પહોંચ્યો જાય છે. પણ રેખા હવે ‘શ્રીમતિ રેખા’ બની ચૂકી છે. તે નાયકને જે રીતે ઢંડો આવકાર આપે છે તે જુઓ.

રેખાએ પૂછ્યું: ‘કંઈ કામ છે?’

મેં કહ્યું: ‘ના. અમસ્થયું આ તો મળવું જ હતું.’

રેખા: ‘પણ મારે થોડું કામ છે. ફરી ક્યારેક. આજે બિંગનેસ મિટીંગમાં હું જઈ રહી છું. હા, પણ મારા મિસ્ટરને તમે ઓળખો!’

‘બહુ ઇન્ટેલિજન્ટ છે હોં! (પૃ-૧૦૫)

ભાણી વખતે રેખાએ પોતાનો કોલેજકાળ સાચવી લેવા નાયકની સગવડો સાચવી હતી. તેનું નાયક સાથેનું હુળવું-ભલવું કે ફિલ્મ જોવા જવું એ બધું જ એક પ્રકારનું છણ હતું. નહોતું એમાં કોઈ મુખ્યાનું આકર્ષણ કે નહોતું કોઈ સ્નેહનું બંધન. હતી તો માત્ર ગણતરી. રેખાનું આ અસલી રૂપ નાયકના ચિત્તમાં જગ્નવાયેલી પેલી સુખદ સ્મૃતિઓને પણ ભૂસી નાખે છે. ટંકીવાર્તા એ લાઘવની કળા છે. વાર્તાકાર એ વાત સારી રીતે જાણે છે. રેખાના વ્યક્તિત્વનું આ પાસું તેઓ માત્ર એક જ શબ્દ ‘શ્રીમતિ’ વેચ્યું હેઠળ. શ્રીમતી નહીં પણ શ્રીમતિ રેખા. અહીં સંભાવનાના વિશ્વમાં પ્રવેશવા જતો નાયક પછિડાટ અનુભવે છે. તેને દીપાની જેમ આવકાર મળતો નથી. આ બધી જ વાર્તાઓના નાયક-નાયિકને જાણે અધૂરૂપ અને સંભાવનાઓને શી રીતે જીવી શકાય તે સૂચવતો હોય તેવો ‘અધૂરૂપ’ વાર્તાનો નાયક છે.

‘અધૂરૂપ’ વાર્તાનો નાયક અડધી રાતે અતીતમાં પોતાની ભૂતથી ગુમાવેલી નાયિકને પત્ર લખવા બેસે છે. આ વાર્તા ભાષાની દિલ્લિએ પણ ઊર્મિ કાયની યાદ અપાવે તેવી છે. નાયક નાયિકને યાદ કરતાં કહે છે,

‘સ્મૃતિ પણ ભોગસામથી નથી, યજ્ઞ છે. સનાતન યજ્ઞ નાણિ તો એની જવાળાઓ વરસો સુધી આટલી તીવ્રતાથી પ્રજવલિત રહે ખરી?’ (પૃ-૬૮)

સંસ્મરણોને યજ્ઞની વેદીથી એક પવિત્રતાના બંધનમાં બાંધીને નાયક સંસ્મરણોને સાચવવાની રીત શીખવે છે. નાયકને પણ આ માર્ગ કપરો લાગે છે ખરો. તે પોતે અપરાધભાવ પણ અનુભવે છે. તો ક્યાંક વળી નાયિકના જીવનમાં કોઈક બીજી વ્યક્તિ છે એ વાતે આકોશ પણ

અનુભવે છે. અને આ દીર્ઘ એવી મથામણ પણી નાયક કરે છે, ‘હું અધૂરપનું ચિત્ર દોરવા ધારું છું.’ અડવી રાતે સૂઈ ન શકતો નાયક જે રીતે પત્ર લાખવા બેસે છે એ ચેષ્ટામાં જ તેનું ચિત્ર પેલી અધૂરપમાં અટવાયેલું જોઈ શકાય છે. અને ઊડા મનોમંથન પછી નાયક એ અધૂરપ સાથે જ જીવવાનો નિધરિ કરી લેતો હોય તેમ પત્ર પણ અધૂરો રાખે છે. અને તેને ‘સ્મૃતિમંદિરના ગર્ભગૃહમાં નહિ સળગેલા દીવાનું તેજ વધારવા અર્પણ કરે છે.’

આ વાર્તાનું આસ્વાદ તત્ત્વ તેની ભાષા છે. નાયકના મનોમંથનને, તેના સૂક્ષ્મ સંવેદનને ભગીરથ બ્રહ્મબહુ અહીં સુંદર રીતે આલેખ્યા છે. નાયકનું અડવી રાતે જાગવું, તેનો આકેશ, તેની પીડા, જીવનની સૌથી ઉજ્જ્વલ સંભાવનાઓને ગુમાવ્યાની વેદના અને આ સંબંધની નજીકત તથા પવિત્રતા યજ્ઞવેદી, સાધના. તાપ, પૂજારી, મૂર્તિ, સ્મૃતિમંદિર વગેરે શાંદ્રો દ્વારા સચોટ રીતે વ્યક્ત થઈ છે. નાયક મથામણ પછી એ સત્ય સ્વીકારે છે કે જીવન આવી અધૂરપો સાથે પણ જીવું પે છે. અને એ અધૂરપોને, દુઃખ સ્મૃતિઓ તરીકે જીવીને પોતાના જ ઘાને ખોતરવા કે પછી તેને યજ્ઞવેદીરૂપે જીવવી એ મનુષ્યના પોતાના હાથમાં છે. આ અનુભૂતિ નાયકની પોતાની છે. અને જો અધૂરપ આવી રીતે જીવી શકાય તો તેને જીરવી શકાય. આ વાર્તાની ભાષા સુરેશ જોખીની વાતાઓની યાદ અપાવે એ પ્રકારની છે. આનાથી તફન સામા છેડાની ભાષા ભગીરથ બ્રહ્મબહુ ‘પ્રેમમાં પેલી ગ્રામીણ માભીનો પ્રેમપત્ર’માં પ્રયોજી છે. આ વાર્તામાં અધૂરા પત્રરૂપે નાયકનું સંવેદન રજૂ થયું છે. તો ‘પ્રેમમાં પેલી...’માં પ્રેમપત્રરૂપે માભીનો ભાવ તળપદી ભાષામાં રજૂ થયો છે. આ બંને વાર્તાઓ એક સરખી જ આકર્ષક બની છે. સાવડી માભી ભાણિયા તરફ આકર્ષય છે. ગામમાં થોડી વાતો ઉં છે. એટલે બીકનો માર્યો ભાણણો વહેલી સવારે શહેર ચાલ્યો જાય છે. અને એ વાતે દુઃખ અનુભવતી માભી ચંચીભૂનની ગીતા પાસે કાગળ અને શીશાપેન મંગાવીને ભાગાને પત્ર લાખે છે. ભાગાના ગયા પછી પોતાની શું દ્વા થઈ તે માભી જે ભાષામાં વારુવિ છે તે જુઓ.

‘અટ્યા ઓ લખમણ ભોગા... હાયું કો? જે દ્વાર્થી તું ઓયથી જતો રિયો એ દ્વારેથી મને તો લગીરે ગમતું નથ્ય. હું કરું?... બહયું શરમ આવ છા. પણ જે દ્વાર્થી તું ઓયથી જ્યો તે દ્વાર્થી મારી બતી બંધ... અંધારું ધપ થૈ જયું જોણે!... મને તો તું જ્યો ઈ દારાથી પૂરી ઉંઘય આઈ નથી-ભલે મું તારી હગી મોમી ના થાઉં પણ તું તો

મારો હગો વોય એવું ચ્યબ લાગ સ...? ઘરમાં પગ મેલું તો પગ ઘરમાં દેજ નાઈ, અને બીજું કરું રાત પે એટલે તરત તું મન તો હાંભર સ.’ (પૃ-૩૬, ૩૭)

માભીની આ ભાષા ભાવકને રમ્જુ પ્રેરે તેવી છે. પણ માભીનું સંવેદન બોલીમાં જે બળકટ રીતે પ્રગટ થયું છે તે શિષ્ટ ભાષામાં ન થઈ શકત. વિષય અને સંવેદનને અનુરૂપ ભાષાની શોધ એ દ્વારા વાતાકારને મુઝુવતો પ્રશ્ન છે. અને ભગીરથ બ્રહ્મબહુ વાતાકાર તરીકે આ વાતે સભાન છે. તેથી જ તેઓ વિષય બદ્ધલાતાં ભાષા પણ બદ્ધલી શકે છે. તેના દાયંત તરીકે ‘અધૂરપ’ અને ‘પ્રેમમાં પેલી...’-આ બે વાતાઓમાં જોઈ શકાય. ‘પ્રેમમાં પેલી...’ વાર્તા તો એકપાત્રીય અભિનય ભજવી શકાય તેવી નાટ્યાત્મક પણ છે.

કથાસાહિત્યમાં પાત્રને જીવંત કરવા માટે, પાત્રના સંવેદનને મૂર્ત કરવા માટે તેની ચેષ્ટાઓ વર્ણવવી પે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કલે છે કે, ભાવની રસનિષ્પત્તિ માત્ર શાબ્દિક કથનથી થઈ શકે નહીં. તે માટે વિભાવાદિનું આલેખન જરૂરી છે. આ વાતાસંશ્લાણની બીજી એક વિશેષતા તે લોખે કરેલું પાત્રોના અનુભાવોનું વર્ણન છે. ‘બંધ પેદલું ઘડિયાળ’, ‘અધૂરપ’, ‘વ્યક્તિ એક-પદધાયા બે’, ‘બીજે કયાંક’-આ વાર્તાઓ જયારે સંસ્કૃત આચાર્યોએ કરેલી વિભાવાદિની ચર્ચાને આધારે તપાસીએ છીએ ત્યારે તેનું નવું જ સૌદર્ય ઉધેરે છે. ‘બંધ પેદલું ઘડિયાળ’ નાયકના એકપદ્ધીય પ્રેમના વિશિષ્ટ સંવેદન અને મંથનને વર્ણવતી વાર્તા છે. આ વાર્તા પહેલી નજરે સુરભી નાયકના સંવેદનને સમજતી નથી એમ માનવા પ્રેરે. પણ જયારે વાર્તાને રસપ્રક્રિયાને આધારે તપાસીએ છીએ ત્યારે એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સુરભીના ચિત્તમાં નાયક માટે કોઈ પ્રકારની રતિ નથી. આ વાર્તામાં બીજું અગત્યનું તત્ત્વ સમયનું નિરૂપણ છે. વાર્તાકારે માત્ર બે કલાકની જ વાત અહીં રજૂ કરી છે. ઘટના તો માત્ર એટલી જ છે કે સુરભીએ પોતાનું ઘડિયાળ નાયકને રિપેર કરાવવા માટે આપ્યું હતું. નાયક તે રિપેર કરાવીને કોલેજમાં પહુંચે છે. અને જુઓ છે કે સુરભી રજા ઉપર છે. સુરભી વિના એ જે એકલતા અનુભવે છે તેનું જ લોખે આલેખન કર્યું છે. પહેલી વાર જયારે આ વાર્તા વાંચીએ ત્યારે નાયકની ચેષ્ટાઓ જોઈને વાર્તા વિરલ શુંગારની લાગે. પણ વાર્તાનો આણધાર્યો છાતાં સાચો અંત જયારે વાંચીએ છીએ ત્યારે સુખદ આશ્રમ સાથે એ વાતનો ઘ્યાલ આવે કે વાર્તા રતિની નહીં પણ રતિના આભાસની છે. વળી, વાર્તાનો આ આણધાર્યો અંત

ઓહેત્રીની વાર્તાઓની યાદ અપાવે તેવો છે.

વાર્તાકારે આ વાર્તામાં ભાવનિષ્પત્તિ નાયકના અનુભાવોના આલેખનથી કરાવી છે. નાયકના પ્રેમનું આલંબન સુરભી છે. વાર્તાકારે નાયકના જે અનુભાવો વર્ણવ્યાં છે તે જોઈએ. સૌ પ્રથમ તો, નાયકનું કોલેજમાં ચકળવકળ અંધે પ્રવેશાંબું એચેષ્ટ જ નાયકની નજર કોઈક ને શોદી રહી છે તેનો ઘ્યાલ આપે છે. મસ્ટરમાં સુરભીના ખાનામાં સી.એલ. લખેલી જોતાં નાયકના પગ ઢીલા પડી જાય છે. તેના હાથમાંથી ગ્લાસનું પડી જવું, પાણી ન પી શકવું, સુરભીની ખુરશી પર સુરભીની જેમ જ બેસનું, ઢંગી પડી જતાં સુધી ચા ન પીવી અને પીધા વિના જ છોડી દેવી-આ બધાં જ અનુભાવો નાયકની સુરભીપ્રતિને સૂચવે છે. અને તેમાં વાર્તાકારે નાયકની એક ચેષ્ટા તો બહુ સુંદર પકડી છે. નાયક દ્વારા કોઈ જોઈ ન જાય એ રીતે વારંવાર સુરભીની ઘડિયાળે થતો સ્પર્શ. નાયકની આ ચેષ્ટા ખૂબ જ સૂચક છે. આ અનુભાવોની સાથે લેખકે નાયકના ચિત્તના સંચારી ભાવોને પણ ઝીણવટપૂર્વક આલેખ્યાં છે. આ સંચારીભાવોની માત્ર યાદી જુઓ. ‘સાઈન કરું?’ (દ્વિધા) ‘આજે આવવામાં મોહું થયું છે ને?’ (શંકા) ‘હું કયાં વારંવાર મોડો પડું છું?’ (વિતક્) ‘લાવને સહી કરી જ દઉં.’ (નિશ્ચય) ‘કેટલાક ચ્યામ્યાઓનો ઘ્યાલ આય્યો.’ (ભય) ‘ભલેને. જવાબ આપવાનો વખત આવશે ત્યારે થઈ પડશે.’ (ધૃતિ) ‘સુરભી સી.એલ. પર?’ (ઔત્સુક્ય) ‘ન હોય, ન હોય. ફરી જોયું.’ (શંકા) ‘સુરભી વગર હું કોલેજનો આખો ડિવસ પૂરો કેમ કરીશ?’ (ફેન્ય) ‘મને સુરભીએ ગઈ કાલે વાતેય નથી કરી.’ (ચિંતા) ‘મારા પગ ઢીલા પડી ગયાં. પગ નીચેથી ધરતી ખસવા લાગી.’ (વિષાદ, ગ્લાસનિ) ‘ભૂસાઈ ગયેલી સવાર, ભુલાઈ ગયેલા પીરિયડ, યાદ ન આવતું લેક્યયર.’ (વિસ્મૃતિ) ‘બિસ્સામાં હાથ નાંખ્યો. ઘડિયાળ. સુરભીએ જ મને ઘડિયાળ રિપેર કરવા આપ્યું હતું.’ (રોમાંચ અને સ્મૃતિ) ‘નકામું કોઈ જોઈ જશે તો અભર પડી જશે.’ (ભીતિ)

નાયકના ચિત્તમાં માત્ર બે કલાકના સમયગાળામાં જ જે સંચારીભાવોની ભરતી-ઓટ ચાલી છે તેનો આ તો એક માત્ર નમૂનો છે. નાયકની સ્વભાવોકિતાઓ દ્વારા વાર્તાકારે વિવિધ વ્યભિચારી ભાવોને વર્ણવ્યાં છે. આ ભાવોને પોષક બને તે રીતે નાયકના અનુભાવો વર્ણવ્યાં છે. આટલું ઓછું હોય તેમ વાર્તાકાર વાર્તાનો આરંભ પણ નાયકના રતિના ભાવને પોષક એવા ભાવ પ્રકૃતિના વર્ણનથી કરે છે. એ વર્ણન નાયક માટે ઉદ્દીપક બને છે. જુઓ.

‘બહુર હેમંતની હવા વહી રહી હતી. પાનભરની વાસ વાતાવરણમાં તોકાતી હતી, વસંત વધાવવા પ્રકૃતિએ પૂર્વ તૈયારી પ્રારંભી હોય એમ પણ લાગતું હતું.’ (પૃ-૭૨)

આ પ્રકારનો આરંભ વાંચીએ એટલે આપણું ચિત્ત પણ આ વાતાને વિપ્રલંબ શૃંગારની વાર્તા જ માની લે. નાયકનું સુરભીની ગેરહાજરીમાં તેની જેમ જ બેસનું એ સૂચક છે.

‘સુરભીની ખુરશીમાં હું બેસી ગયો હતો. તેણીની જેમ હાથ પર ચહેરો ટેકવી જોયો. ત્રિભંગ ગોઈવી જોઈ પણ કંઈ રસ ન પડ્યો અને ચેન પણ ન પડ્યું.’ (પૃ-૭૪)

મનોવિશ્લેષણાત્મક અભિગમથી જોઈએ તો, નાયકની આ ચેષ્ટા તેના સુરભી પ્રત્યેના પ્રભાળ ગુપ્ત આકર્ષણે દ્શાવિ છે. એ જ રીતે વારંવાર ઘડિયાળને થતો સ્પર્શ અને કોઈ જોઈ જશે એવી ભીતિ તેના એકપક્ષીય પ્રેમને સૂચવે છે. સુરભી વિના માંડ બે કલાક પણ નાયક કોલેજમાં રહી શકતો નથી. તેની અકળામણ અને ઉચાટને ટૂંકા ટૂંકા વાક્યો વે લેખક વણવિ છે. વાર્તાના અંતે બીજા દિવસની સવારે સુરભી નાયક પાસેથી ઘડિયાળ લે છે અને નાયકના પ્રશ્નોના કોઈ ઉત્તર પણ આપતી નથી. ઘડિયાળ સામું જોઈ કરે છે, ‘કેમ મારું ઘડિયાળ પાઇળ જાય છે?’ નાયક કોઈ ઉત્તર આપે તે પહેલાં જ તે પીરિયડ લેવા સ્ટાફ રૂમની બહાર નીકળી જાય છે. આ અંત વાંચીએ કે તરત ચિત્તમાં સંસ્કૃત આચાર્યોની ભાવાભાસ-રસાભાસની ચર્ચા યાદ આવી જાય. લેખક વાર્તાના આરંભથી અંત સુધી સુરભીના કોઈ પ્રત્યાઘાતો વર્ણવ્યાં નથી, એ તરફ ધ્યાન અંત વાંચ્યા પછી જાય. એટલે અહીં આરંભે ઉદ્દીપક તરીકે આવતું પ્રકૃતિનું વર્ણન, નાયકની બેચેની અને ઉચાટ રજૂ કરતાં અનુભાવો-એ બધાનું આલંબન સુરભી હતી. પણ સુરભી માટે તો નાયક આલંબન નથી. તેથી આ બધાં જ ઉદ્દીપકો અને અનુભાવો નાયકના રતિના આભાસને રજૂ કરનારા બની રહે છે. એકપક્ષીય પ્રેમનું આ વિશિષ્ટ રીતિએ-સંચારીભાવોની રમજાટ, ઉદ્દીપક એવું પ્રકૃતિનું વર્ણન અને અનુભાવોની શૃંખલા-આ ત્રાણેયનું મિશ્રણ, આ વાતાને આસ્વાદ બનાવે છે.

વાર્તાકાર તરીકે ભગીરથ બ્રહ્મભહુ પાત્રોના સંચારીભાવો કુશળતાથી વણવિ છે. એટલું જ નહીં પાત્રના ચિત્તમાં ચાલતા સૂક્ષ્મ સંઘર્ષને પાત્રની યોગ્ય ચેષ્ટાઓ દ્વારા તેઓ જીવંત કરી શકે છે. ‘વ્યક્તિ એક-પદછાયા બે’ની નાયિકા સ્નેહા સ્વપ્નિલના મૃત્યુના સમાચાર વાંચ્યા પછી જે દુઃખ અનુભવે છે, તે તેની ચેષ્ટાઓ-ગાંગડાનું લોટમાં ભજી

જવું, સપીના છોપથી મોં લુંછતાં ચાંદલો ખસી જવો વગેરે દ્વારા સૂચવાય છે. તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘મીઠા વગરનો રોટલો’માં પણ આ બાબત જોવા મળે છે. ‘મીઠા વગરનો રોટલો’ની ઉજમબાની વેણા તેમના હાથમાંથી પછડાતી પવાલી, ઘણ-ચોખાનું જમીન પર ઢોળાવું, રોટલામાં મીહું નાંખવાનું ભૂલી જવું વગેરે દ્વારા સચોટ રીતે ઉપસી આવે છે. આ ચોષાઓના, અનુભાવોના સચોટ આદેખનને કરાશે જ ભગીરથ બ્રહ્મભઙ્ગના પાત્રો હવાઈ બની જતાં નથી. હા, તેમના પાત્રો પ્રમાણમાં સંવેદનશીલ વધુ છે, પણ હવાઈ નથી.

આ વાર્તાસંગ્રહમાં સૂત્રાત્મક વિધાનો પણ ધ્યાન ખેંચે તેવા છે. કેટલાંક દાખાંતો જુઓ.

‘કવિતાનું કામ જીવાડવાનું જ છે. મારવાનું નહીં.’ (પૃ-૪૭)

‘સમાજને સારી રીતે ઓળખવો હોય તો વૃદ્ધાશ્રમોની મુલાકાત લેવી જોઈએ.’ (પૃ-૫૦)

‘શબ્દ એ ભોગ સામગ્રી નથી, સાધના છે. તપ છે.’ (પૃ-૬૮)

‘સમયની ખીણમાંથી માણસ સમજ કેળવીને બહાર આવે છે.’ (પૃ-૬૯)

‘એક માણસને ચાહવામાં આટલો આનંદ આવે, તો મારે માનવ સમુદ્ધયને કેમ ન ચાહવો?’ (પૃ-૬૮)

વાર્તાસંગ્રહના વિશેષોને નોંધ્યા પછી લેખકને એક ફરિયાદ કરવાનું મન થાય કે શા માટે અમુક વાર્તાઓમાં સંવેદન પૂરેપૂરા ઘૂંઠચા નથી. ‘શારડો’, ‘અમાસી દરિયો’,

॥ ગ્રાસંગિક ॥ આ પણ રાષ્ટ્રપ્રેમ છે

મનસુખ સંખા

કોઈ પણ રાષ્ટ્ર માટે યુદ્ધ ગ્રાસંગિક અને અનિવાર્ય પરિસ્થિતિમાં જ હોય છે. યુદ્ધ વખતે આખું રાષ્ટ્ર જાણે એક પ્રાણ થઈ જાય છે. રાષ્ટ્રપ્રેમનો ઉદ્દેશ ચોતરફ અનુભવાય છે. પરંતુ યુદ્ધની સ્થિતિ કાયમ આવકાર્ય નથી હોતી. એ નાધૂટકાની પસંદગી હોય છે. છેલ્લું પગલું હોય છે.

હુકીકતે રાષ્ટ્રપ્રેમ રોજબરોજના જીવનમાં પ્રગટ થયો જોઈએ. યુદ્ધ વખતે આખું રાષ્ટ્ર એક, અખંડ, સંવાદી બની રહે અને સામાન્ય દિવસોમાં એથી ઊલટી રીતે વર્તે તો એવું

‘નવો જન્મ’, ‘સોળ વરસની છોકરીને ફેરાં ફરતાં’, ‘રિવેટ’, ‘ફાંટો’ અને ‘ખરી મજા તો ગોટલીમાં’ જેવી વાતાઓમાં સંવેદન તો લેખકે બરાબર પકડયું છે પણ તેની યોગ્ય માવજત કરી નથી. ‘અમાસી દરિયો’ની દીપાની એકલતા અનુભવાતી નથી. એવી જ પરિસ્થિતિ ‘સોળ વરસની...’ વાતામાં પણ થઈ છે. ક્યાંક પાત્રની રેખાઓ ઝાંખી રહી જવા પામી છે. અધૂરેપણું સંવેદન સુંદર રીતે ઘૂંઠનાર સર્જક ભગીરથ બ્રહ્મભઙ્ગ આ વાતાઓને ઘૂંઠવામાં અધૂરૂપ શા માટે રાખી? એવી આશા રાખીએ કે ભગીરથ બ્રહ્મભઙ્ગ આગામી વાતાસંગ્રહમાં આવી અધૂરૂપને ટાળશે.

‘બા વગરનું ઘર’ વાર્તાસંગ્રહ માનવજીવનની અધૂરતાની મધુરતાની અનુભૂતિ કરવનારો બની રહે છે.

સંદર્ભ:

- ‘બા વગરનું ઘર’, ભગીરથ બ્રહ્મભઙ્ગ, રસાદે પ્રકાશન, પ્ર.આ.જૂન-૨૦૧૮
- ‘મીઠા વગરનો રોટલો’, ભગીરથ બ્રહ્મભઙ્ગ, આર.આર.શેઠની કંપની, પ્ર.આ.મે-૨૦૦૨
- ‘દ્વિરેફ ની વાતો: મનોવિશ્લેષણાત્મક અભિગમ’, આશકા પંડ્યા, પાર્શ્વ પ્રકાશન, પ્ર.આ.૨૦૧૮
- ‘કથોપક્થન’, સુરેશ જોખી, આર.આર.શેઠની કંપની, પ્ર.આ.જૂન-૧૯૯૮
- ‘ટૂંકી વાર્તા’, વિજય શાસ્ત્રી, ચંદ્રમૌલી પ્રકાશન, પ્ર.આ.૧૯૯૪

(અધ્યાપક, ગુજરાતી વિભાગ, વ.ના.સ.બેંક, લી.આર્ટ્સ એન્ડ કોર્પરેશન, વડનગર. મો.૮૪૬૦૩૭૫૩૮૬)

રાષ્ટ્ર સુરક્ષિત ન રહી શકે, વિકસી ન શકે, ગૌરવશાળી બની ન શકે. એટલે કે નાની નાની ઘટનાઓમાં, રોજબરોજની ઘટનાઓમાં રાષ્ટ્રપ્રેમ પ્રગટ થયો જોઈએ. ઈ. એન. રેન્ડ નામના વિચારકે કહ્યું છે કે ‘મનુષ્યે પોતાનું કામ ઉત્તમ રીતે કરવું જોઈએ, એ જ નૈતિકતા છે.’ રોજબરોજનાં કાર્યોમાં, પોતાની ફરજમાં આવતું હોય એ ઉત્તમ રીતે કરવું એ મનુષ્ય તરીકનો ખરો વિકાસ છે. જે રાષ્ટ્રમાં આવા નાગરિકો વધારે મનુષ્ય તે રાષ્ટ્ર સૌથી વધુ સમૃદ્ધ અને વિકસિત ગણાય.

આપણો એક ભ્રમ એવો છે કે દેશનેતા હોવું, મહત્વના પદ પર હોવું, તેંબું આર્થિક વળતર મળતું હોય એવું કાર્ય

કરવું એ જ રાષ્ટ્ર માટે મહત્વનું પ્રદાન છે. પરંતુ એવું નથી હોતું. રાષ્ટ્ર એટલે જ હજારો સેવાઓ (Services) બજાવનારા લાખો સાધારણ માણસો, અમેનાં નામ કે ફોટા અખભારમાં નથી આવતાં- પરંતુ રાષ્ટ્રનો ખરો આધાર તેઓ જ હોય છે.

એક ડ્રાઇવર સુરક્ષિત રીતે, નિયમિતતાથી, મુસાફરોની કાળજી રાખીને બસ ચલાવે તો એ તો એ રાષ્ટ્રપ્રેમ જ છે. એક સફાઈ કામદાર કાળજીથી, જીણવટથી, ક્યાંક કશુંથ્ય ગંઢું ન રહે એમ સફાઈ કરે તો એ રાષ્ટ્રપ્રેમ જ છે. એક કલાર્ક પોતાની પાસે આવતા કાગળોનો સમયસર, પક્ષપાત વિના, યોગ્ય અભિપ્રાય કે નિયમ મુજબના નિર્ણય સાથે નિકાલ કરે તો એ રાષ્ટ્રપ્રેમ છે. એક શિક્ષક પોતાનું કામ જરાય પ્રમાણ વિના, વિદ્યાર્થીઓ માટેના પ્રેમથી અને દક્ષતાથી કરતો હોય તો એ રાષ્ટ્રપ્રેમ જ છે. એક ખેડૂત જે કાઈ ઉત્પાદન કરતો હોય તેમાં રાસાયણિક જંતુનાશકો છાંટચા વગર, જૈવિક ખાતર નાખીને, મનુષ્ય-આરોગ્યને પોષક એવી રીતે તૈયાર કરતો હોય, ઉત્પાદનમાં કશી ભેળસેળ ન કરતો હોય તો એ દેશપ્રેમ છે. એક પોલીસ નિયમાનુસાર, વહુલાંદ્વલાં કર્યા વિના, પોતાનું કર્તવ્ય બજાવતો હોય તો એ દેશપ્રેમ છે. એક ન્યાયાધીશ પક્ષપાતરહિત કાયદાના ઉચિત અર્થઘટન સાથે, કોઈની શેહેરમાં આવ્યા વિના, વાજબી સમયમાં ચુકાડાઓ આપે તો એ રાષ્ટ્રપ્રેમ જ છે. એક ઉદ્યોગપતિ જે કોઈ ઉત્પાદન કરતો હોય તે ટકાઉ, પર્યાવરણને સંવાદી, લોકોપયોગી અને નફાનું યોગ્ય પ્રમાણ જાળવીને વેચે તો એ રાષ્ટ્રપ્રેમ જ છે. એક ડેક્ટર દર્દીને સમયસર, યોગ્ય, પૂરી દક્ષતાથી અને વાજબી ફી લઈને સારવાર આપે તો એ રાષ્ટ્રપ્રેમ છે. સચિવ, કલેક્ટર, ડી.ડી.ઓ., ડી.એસ.પી. જેવા નિર્ણયકો પોતાના નિર્ણયો, નિયમોના વાજબી અર્થઘટનથી, માનવીય સરેરહના જાળવીને, ન્યાયી રીતે અને પક્ષપાતરહિત રીતે તથા કોઈની શેહેરમાં આવ્યા વિના કરતા હોય તો એ રાષ્ટ્રપ્રેમ જ વ્યક્ત કરે છે.

આમાંના કોઈએ સરહદ ઉપર બંદૂક લઈને જવાની જરૂર નથી. તેઓ જયાં બેઠા છે, જે કોઈ કામ કરે છે તે તે રાષ્ટ્રને મજબૂત બનવામાં, ઘડતર કરવામાં, ન્યાયી અને સમાનતાલક્ષી બનવાવામાં યોગદાન આપે છે. સરહદ સાચવવાનું કામ સૈનિકો કરે જ છે, પરંતુ દેશને અંદરથી સાચવવાનું કામ આવી હજારો સેવાઓ પૂરી પાડનારા નાગરિકો કરે છે.

ધર્મસંસ્થાની ભારતીય સમાજ ઉપર વિશિષ્ટ અને ગાઢ

અસર હોય છે. ધર્મસંસ્થાનોએ આ સંદર્ભમાં પોતાની કામગીરી નવેસરથી વિચારવી, હરાવવી પડશે. લોકો ધર્મસંસ્થાને શ્રદ્ધાથી જોતા હોય છે. એટલે તેમનામાં દંબ, ભ્રષ્ટાચાર, વૈભવીજીવનનો મોહે કે અયોગ્ય સંબંધો જુઓ છે ત્યારે લોકોની શ્રદ્ધાને આવતા પણોંચે છે. જો ધર્મસંસ્થાનો ધર્મના સાચા, વ્યાપક, સર્વજનહિતને પોષક એવા વ્યવહારો કરે તો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરે છે એમ ગણાય.

ભારતમાં જે વ્યાપક પ્રમાણમાં ભાષ્યાચાર, કામગોરી, કરજમાં બેદરકારી, સ્વાર્થધીતા અને ઉત્તરાધિત્વનો અભાવ જોવા મળે છે તે રાષ્ટ્રપ્રેમની ઊણપણે કારણે છે. આ સંઘળાની અસર હવે કેવળ રાષ્ટ્ર સુધી મર્યાદિત નથી રહેતી, કારણ કે નવી ટેક્નોલોજી અને ઉપકરણોને કારણે જગત નજીક આવી ગયું છે. એક દેશમાં ભરતાં કોઈ પણ અનિષ્ટ, અયોગ્ય નિર્ણયનું કે સ્વાર્થપ્રેરિત પગલું બીજા અનેક દેશોને અસર કરે છે. આજ સુધી એમ મનાતું હતું કે આપણા દેશનાં હવા, પાણી, પ્રકાશ, ધરતી, વનો જાળવીએ તો પૂર્તાં છે, પરંતુ હવે વિશે એટલું નજીક આવ્યું છે કે આ સંઘળાની અસર સમગ્ર વિશ્વ ઉપર, તેના પર્યાવરણ અને જનજીવન ઉપર થાય છે. (આ સંદર્ભે વધતી ગરમી, અસ્વાભાવિક ઋતુપલટા, વિનાશકારી વાવાજોડાં, આરોગ્ય બગડવાની જરૂર, લોકોનું વધતું માનસિક ભારણ, સંબંધોમાં પેદા થતી તાર વગેરેને નવેસર તપાસવાં જરૂરી બને છે.)

એટલે આપણે સમજવું પડશે કે હવા, પાણી, પ્રકાશ, ધરતી, વનોને છેલ્ણાં સાડા ત્રણસો વર્ષમાં જે રીતે બગાડ્યાં, નાશ કર્યો કે આપણી અનુકૂળતા મુજબ મચ્યાં છે તેની ધારી મોટી કિંમત સમગ્ર માનવજીતે ચૂકવવી પડશે. કાં સમજુને વ્યવહાર કરીએ, સંવાદી જીવનશીલી અપનાવીએ, નહિં તો ધારી કઠોર અને ભયાવહ કિંમત ચૂકવીએ એ બે જ વિકલ્પ છે-કેવળ ભારત સામે નહિં, સમગ્ર વિશ્વ સામે.

રાષ્ટ્રપ્રેમ એટલે નાગરિકધર્મનું પાલન. આપણે સૌ વ્યક્તિ તરીકે ભલે નાના એકમરૂપે છીએ, પરંતુ એવાં લાખો નાના એકમો મળીને રાષ્ટ્ર બને છે. તેમાં દરેકનું મહત્વ છે, પ્રદાન છે, ફાળો છે. વિશાળ યંત્રમાં એક નાનો બોલ્ટ બરાબર ન હોય કે બરાબર બેઠેલો. ન હોય તો એની અસર કે પરિણામ આખા યંત્રને થાય છે, અટકી પડે છે. એમ જ વ્યક્તિ ભલેને અતિ નાનું ગણાતું કામ કરતી હોય તો પણ એની અસર આખા દેશના ચારિત્ર ઉપર થતી હોય છે. રાષ્ટ્રનું ચારિત્ર એટલે એના નાનામાં નાના નાગરિકનું ચારિત્ર.

વળી ચારિત્રની ઓળખ કેવળ જી-પુરૂપ સંબંધ સુધી મર્યાદિત નથી. એક માણસ લજનબાધ સંબંધ ન રાખે, ટીલાં-ટપકાં-પૂજા કરતો હોય, પરંતુ તે નભણો માલ પેઢા કરતો હોય, અસ્વાભાવિક નજી લેતો હોય, લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતો હોય, ફરજમાં બેદરકરી બાતાવતો હોય, કોઈ જોનાર ન હોય ત્યારે નિરાંતરજીવનિયમભંગ કરતો હોય તો એ ભક્તિ ચારિત્રભ્રષ્ટ જ છે. એવી ભ્રષ્ટ વ્યક્તિત્વો પોતાને, પોતાના સમાજને, રાષ્ટ્રને અને સમગ્ર સમાજને આધાત પહોંચાડે છે, ક્ષીણ કરે છે, વ્યવસ્થા અને ધોરણોને તોડે છે.

જેમ સરહદ ઉપર સૈનિકો પ્રત્યેક કાણો રાષ્ટ્રપ્રેમથી નિરૂપિય કરે છે, વર્તન કરે છે, જગત રહે છે, તેમ જ રાષ્ટ્રની અંદર પ્રત્યેક વ્યક્તિએ આ ભાવથી નિરૂપિયો કરવા જોઈએ, વ્યવહારો કરવા જોઈએ, કર્તવ્યપાલન કરવું જોઈએ, જગત રહેવું જોઈએ. એમાં બીજા સામે આંગણી ચીંઘવાનો અર્થ નથી. દરેક જાત સામે જ આંગણી ચીંઘવી જોઈએ.

યુદ્ધ વખતે થોડા હિવસ રાષ્ટ્રપ્રેમ બાતાવીએ અને પછી કાયમ રાષ્ટ્રને આધાત પહોંચાડનારાં પગલાં ભરતાં રહીએ તો આપણે રાષ્ટ્રને ચાહીએ છીએ એવો દાવો નહિં કરી શકીએ.

એટલે નાગરિકધર્મનું પાલન કરનારા નાગરિકો પેઢા થાય એ સાચો જવાબ છે. એ માટે સૌથી અસરકારક એવાં

બે પરિબળો છે : (૧) પરિવાર અને (૨) વિદ્યાલય. પરિવારોએ બાળઉછેર અને ઘડતર માટે નવી નજર કેળવવી પડશે. સંબંધભાત બદલવી પડશે.

આજની થોડાક લાખને નોકરી અપાવનારી શિક્ષણરચના આમાં કામયાબ નહિં થાય. તમામ મનુષ્યોનું ચારિત્રઘડતર થાય એવી કેળવાણી અનિવાર્ય છે. નાદાર નાગરિકો દ્વારા મહાન રાષ્ટ્રનું નિર્માણ ન થઈ શકે. અને આજનો યુગસંદર્ભ જોતાં કેવળ પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ હોય એ પૂરતું નહિં થાય, એથી આગળ વધીને સમાજના કાળજી, જાળવણી અને પ્રેમ અનિવાર્ય બનશે.

આ નજર હશે, આ ભાવના હશે, આવી જાગૃતિ હશે તો આપણે મનુષ્ય તરીકે અને રાષ્ટ્ર તરીકે ગૌરવ લઈ શકીશું.

સી-૪૦૩, સુરેલ એપાર્ટમેન્ટ, દેવાશિખ સ્કૂલ સામે, જીજસ
બંગ્લોડ વિસ્તાર, અમદાવાદ-૩૦૦૧૫,
મો. : ૯૮૨૪૦૪૨૪૫૩

(અંદર આનંદ, એપ્રિલ ૨૦૧૮ માંથી સાભાર)

॥ અભ્યાસ ॥

આપત્તિ વ્યવસ્થાપન : ઓળખ, આવશ્યકતા અને કાર્યવાહી

મૃગેશ નાયક

આપણા વૈશ્વિક પર્યાવરણનો ઇતિહાસ (History of our Global Environment)

આશરે દસ હજાર વર્ષ પૂર્વે માનવજાતિ નિર્જન જંગલો અને ઘાસના મેદાનોમાં શિકારીઓનાં જૂથમાં રહેતી હતી, પછી તે ખેડૂતો અને પશુપાલકોમાં પરિવર્તન પામી. ત્યારે આપણે આપણી આવશ્યકતાઓને અનુરૂપ પર્યાવરણને બદલવાનું શરૂ કર્યું. જ્યારે આપણી અનાજ ઉત્પાદન કરવાની અને પાલતુ પ્રાણીઓનો ઉપયોગ કરવાની ક્ષમતા વધી ત્યારે આ ‘પ્રાકૃતિક’ નિર્વસનતંત્રો કૃષિવિસ્તારોમાં પરિવર્તન પામ્યા. અધિકાંશ પરંપરાગત ખેડૂતો પાણી માટે વર્ષા, ઝરણાંઓ, નદીઓ જેવા

પ્રાકૃતિક જળથોતો ઉપર જ પૂરેપૂરો આધાર રાખતા. પછી તે ભૂગર્ભ જળનો કૂવામાંથી, નળવાટે ઉપયોગ કરી તથા બંધો બાંધી અવરૂદ્ધ જળાશયો બનાવી તે જમીનમાં સિંચાઈ કરવા લાગ્યા. હાલમાં જમીનમાં કોઈ વિશેષ ક્ષેત્રજીમાંથી પ્રાપ્ત થતી ઉપજને હજી વધારવા માટે આપણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. પરંતુ, હવે આપણાને સમજાવા લાગ્યું છે કે આ બધાંને કારણો આપણા પર્યાવરણમાં અનેક અનિશ્ચિત વિસંગતિઓ પેઢા થઈ છે.

માનવજાતિ પ્રાકૃતિક સાધનોનો અતિ-ઉપયોગ કરીને તેનો વિનાશ કરી રહી છે. અધિકાંશ વ્યક્તિત્વોની વધતી જરૂરિયાતોને પહોંચી વગવા માટે, વધુ જેતપેદાશો લઈ જમીનોના સઘન ઉપયોગ કરીને નિર્વસનતંત્રોની ક્ષમતાને ઘટાડી રહ્યા છે, અને આ બધાંને માટે સંસાધનોનો વધુ ઘનિષ્ઠ ઉપયોગ કરવો પડે છે. ઔદ્યોગિક

વિકાસ, શહેરીકરણ, વસતિ વધારો અને બેહદ પ્રમાણામાં વપરાશી ચીજ-વસ્તુઓનો ઉપભોગ, આ બધાંને પરિણામે મોટાપ્રમાણામાં ઘન કર્યા પેદા થાય છે. તેથી આગળ જતાં તેનું પર્યાવરણ પર હજુ વધારે દબાણ આવશે. હવા, પાણી અને માટીના પ્રદૂષણોને કારણે માનવ આરોગ્યની ઉપર ગંભીર અસરો શરૂ થઈ ગઈ છે.¹

► પર્યાવરણાનીતિ (Disaster policy):

અત્યારે પર્યાવરણને લગતી જે કેટલીક નીતિઓ છે તે આ પ્રમાણે છે :

1. ૧૯૮૮ રાષ્ટ્રીય વન નીતિ
2. ૧૯૯૨ નેશનલ કન્ગરેશન સ્ટ્રેટેજી એન્ડ પોલીસી સ્ટેમેન્ટ ઓન એન્વાયરન્મેન્ટ એન્ડ ડેવલોપમેન્ટ
3. ૧૯૯૨ પોલીસી સ્ટેમેન્ટ ઓન એબેટમેન્ટ ઓફ પોલ્યુશન

આ નીતિવિષયક દસ્તાવેજો હોવા છતાં એક સર્વગ્રહી નીતિવિષયક દસ્તાવેજની જરૂર જણાઈ હતી. આપણા વિકાસ સામેના પડકારો વધતા ગયા છે અને પર્યાવરણાલક્ષ નિસબતાનું કેન્દ્રસ્થાન વધુ રૂપેણ થતું ગયું હોવાથી અગાઉના ઉદ્દેશો, નીતિવિષયક દસ્તાવેજો અને કાર્યપદ્ધતિની સમીક્ષા કરવાની પણ જરૂર અનુભવાઈ છે.

માનવકલ્યાણામાં વધારો કરતા જવો એ અર્થમાં ટકાઉ વિકાસને ભારતની વિકાસ સંબંધી ફિલસ્ફૂનીમાં અવારનવાર ઊભરી આવતા મુદ્દા તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેવો વિકાસ શક્ય બને તે માટે દેશની આર્થિક, સામાજિક અને પર્યાવરણીય જરૂરિયાતો વચ્ચે સંતુલન અને સંવાદિતા સ્થાપવી આવશ્યક છે. તે ઉપરાંત ભારતે પર્યાવરણીય સંબંધિત સંખ્યાબંધ અંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં અગત્યની ભૂમિકા બજાવી છે. ભારત મુખ્ય બહુપક્ષી કરારોમાં પક્ષકાર બન્યું છે. તે વિવિધ પર્યાવરણીય સમસ્યાઓના પરસ્પરાવલંબન અને રાજ્યોની સરહદોથી ઉપરવટ જવાના તેમના લક્ષણને કબૂલ રાખે છે.²

► આપત્તિ વ્યવસ્થાપનની આવશ્યકતા :

માનવે આર્થિક વિકાસની ભૂમં અને તેની દોડમાં અડેધ માનવવસવાટને કારણે પણ કુદરતી આપત્તિઓ

અને તેનાથી થતી અસરોનો ભય વધારે હોવાની સંભાવના રહે છે. જે અસરને આપત્તિ વ્યવસ્થાપનની આવશ્યકતાને ધ્યાનમાં લઈને ઘટાડી શકાય.


1. આપત્તિના પરિણામે થતા જાનમાલના નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે, નુકસાનના આંકને શક્ય તેટલો ઘટાડવા.
2. આપત્તિ વેળાએ ભયાવ અને રાહતની કામગીરી અસરકારક અને વીજળીક ગતિથી હાથ ધરી શકાય તે માટે.
3. પૂર્વવટ્ટ પરિસ્થિતિની પુનઃ સ્થાપના માટે ટૂંકા તથા લાંબા ગાળાના પગલાં યોજનાબધ રીતે પ્રયોજી શકાય.
4. આવનાર આપત્તિઓને ઓળખી શકાય, તેની વ્યાપકતા અને અસરોને અંદ્રા શકાય અને આપત્તિઓનો સામનો કરવા માટે યોગ્ય પૂર્વ તૈયારી કરી શકાય.
5. આર્થિક વિકાસની ગતિને અવરોધતી અટકાવવા માટે.
6. સામાજિક વિકાસની ગતિને અવરોધતી અટકાવવા માટે.
7. ભૌગોલિક પરિસ્થિતિમાં થતા ફેરફારોનો વિકાસાત્મક અને વિધેયાત્મક ઉપયોગ કરી શકાય.
8. નવી આફત, અધિત, અંધાધૂંબી કે અભ્યવસ્થા અટકાવી શકાય.
9. અસરગ્રસ્તો જેવા કે વૃદ્ધ્યો, નાના બાળકો, વિદ્યાર્થી ઓ કે સ્ત્રીઓ વગેરેને માનસિક કે શારીરિક સાંત્વન આપી શકાય.
10. યોગ્ય માહિતી સંચારની વ્યવસ્થાથી અફવાઓને કાબૂમાં રાખી શકાય છે તથા જનજીવનને સામાન્ય બનાવવાના પ્રયત્નો કરી શકાય છે.

► આપત્તિ વ્યવસ્થાપનનો અભિગમ અને કાર્યવાહી :

આપત્તિ વ્યવસ્થાપન માટે વિશાળ ફલક પરની નીતિનું ઘડતર, આયોજન, સંસ્થાગત પદ્ધતિઓ વિકાસવાનો અભિગમ જ ઉપકારક નીવડી શકે. આપત્તિ

વ्यवस्थापन नीतिओना ઘડતરમાં તાંત્રિક અને આર્થિક પ્રશ્નોને યોગ્ય સ્થાન આપવાનું રહે છે.

આપત્તિ પહેલાં, આપત્તિ વેળાએ અને આપત્તિ પછીથી લેવાના પગલાં સ્પષ્ટપણે સમયગાળાને દર્શાવતા



આઇતિમાં જોતા આપણને સમજાય છે કે આપત્તિ વ્યવસ્થાપનમાં પગલાં એક પછી એક લેવાય છે, જ્યારે આપત્તિ આવી નથી ત્યારે, આપત્તિ હોય તે સમય દરમિયાન અને આપત્તિ બાદ, આપત્તિ વ્યવસ્થાપનના પગલાંનું કયા સમયગાળામાં કેટલું મહત્વ છે તેનીકેટલી અગ્રતા હોવી જોઈએ તે જોઈ શકીએ છીએ. આપત્તિ વ્યવસ્થાપનનું કોઈ એક પગલું સતત વધતા-ઓછા અંશે ચાલુ રહે છે. તે ઉપરાંત સમયાંતરે આપત્તિની એક પછી એક ઘટનાઓ બને ત્યારે કોઈ એક આપત્તિ માટે પૂર્વવત્ત પરિસ્થિતિની સ્થાપનાની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે જ બીજી કોઈ આપત્તિ પૂર્વની તૈયારીઓ માટેની પ્રવૃત્તિ ચાલતી હોય અને તે જ સમયે અન્ય કોઈ આપત્તિ માટે ભચાવ અને રાહતની કામગીરી પણ ચાલુ હોઈ શકે. એટલે કે આપત્તિ વ્યવસ્થાપનના બધા તબક્કાઓની પ્રવૃત્તિ એક ચોક્કસ સમયગાળામાં અમલી હોઈ શકે છે. આમ, આપત્તિ વ્યવસ્થાપનની વર્તુળ (સાઈકલ) ને બદલે પ્રવૃત્તિની હારમાળા (સિરીઝ) પણ હોઈ શકે.

► આપત્તિ વ્યવસ્થાપનની યોજના :

જ્યારે યોજના તૈયાર કરવામાં આવે ત્યારે યોજનામાં

વિભાગવાર અલગ દર્શાવવા જોઈએ.

યોજનાના અમલની ચોકસાઈ માટે નિયમિતપણે યોજનાનો અભ્યાસ (રીલ) પ્રયોજવાનું આવશ્યક બનશે. આ માટે યોજનામાં વિશેષ ભાર મૂકવો જોઈએ. અભ્યાસ (રીલ) વેળાએ ધ્યાનમાં આવતી તૃતીઓ/ક્ષતિઓને સુધારીને યોજનામાં તેનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી પૂર્વ તૈયારી/ સક્ષમાની ક્ષમતામાં વધારો થશે.

આમ, આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરતી વખતે ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે અને યોજના તૈયાર થાય તો આપત્તિ દરમિયાન ૮૦ થી ૮૦ ટકા નુકસાનીમાંથી બચી જઈ શકાય. ઓછામાં ઓછા નુકસાની સાથે આપત્તિનો સામનો કરવા સક્ષ થઈ શકીએ. જો કે દરેક આપત્તિમાં ૮૦ થી ૮૦ ટકા બચી શકાતું નથી. કેટલીક આપત્તિમાં ભયંકર નુકસાન થાય છે.³

► પર્યાવરણ કેન્દ્રી વિવેચન વિચાર :

મકરંદ દવેના ‘જંગલની મંજરી’ ગીતમાં આ વાત ધારદાર રીતે વ્યક્ત થઈ છે.

મુંબઈ નગરીમાં કોઈ આંબો મહેરે તો
 એની મંજરીને રામ રામ કે'જો !
 એનાં મીઠા ઓવારણા લેજો.
 ઊચા સિમેન્ટના તુંગરની ધારે ને
 કાળી ડામરની તળેટીએ,
 જંગલની મંજરી આ આવી ચી છે અહીં
 પાણા તે ફોડવાને પેટિયે,
 ઉઘડતી આંખ એની બિડાતી જાય તો
 અમરતના છાંટણા દે જો ! ભમરાનો ઘેરો ગુંજાર નથી
 ઘેરતો ને
 કોયલની કૂક નથી ઘેલી,
 ભૂંગળાના ઘોંઘોમાં હરખાતો જાય અહીં ભોંઘતેલ
 વેચતો તેલી,
 ઝેરી ધુમાડામાં મંજરીના મુખ પરે
 જરણું બનીને કોઈ વ્હેજો ! કયા રે જનમનાં પાપ
 આજ પાંગર્યાં ને
 પથ્થર બનવાની આવી વેળા.

નગરજીવન, યંત્રવિજ્ઞાન, પ્રદૂષણ સર્જતી
 માનવસંસ્કૃતિ પોતાના મૂળ પ્રાકૃતિક અશરૂપને વિસરી
 ગઈ હોવાનો રંજ આ ગીત કવિતાનો ધ્વનિ છે.^૪

ભારતમાં આપત્તિઓનું વ્યવસ્થાપન બ્રિટીશ સમયથી
 થતું આવ્યું છે. ઈ.સ. ૧૭૮૬ માં પૂર હોનારતોની
 અસરો ઉપર કાબૂ મેળવવા માટે અંગ્રેજ સરકારે ભારતમાં
 સિંચાઈ સુવિધાઓનું આયોજન કર્યું હતું. ઈ.સ. ૧૮૨૭
 માં ભારતના દુષ્કાળોની સ્થિતિ હળવી કરવાના હેતુથી
 દુષ્કાળપંચ રચવામાં આવ્યું હતું. ભારતમાં ૧૮૫૪ માં
 રાષ્ટ્રીય પૂર નિયંત્રણ નીતિ જાહેર કરવામાં આવી હતી.
 ઈ.સ. ૨૦૦૦ સુધી એટેટે કે ૨૦મી સદીના અંત સુધી
 ભારતમાં વિભિન્ન પ્રકારની કુદરતી આપત્તિઓ સામે કોઈ
 વિરોધ પૂર્વ આયોજન નહોતું. ઘણે અંશે આપત્તિઓ પરીની
 અસરોને હળવી કરવી તથા આપત્તિશ્રસ્ત લોકો માટે બચાવ
 અને રાહત કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતમાં અવાર-નવાર પૂર અને દુષ્કાળ જેવી
 હોનારતો થતી જ રહે છે. આ સંદર્ભમાં ઘણે અંશે
 રાહત કાર્યોનું જ આયોજન જોવા મળે છે. વાવાડોડાં
 અને ધરતીકોણી હોનારતો પણ ભારતના જુદા-જુદા
 ભાગોમાં સર્જિય છે. આ અંગે વાવાડોડાની આગાહી અને
 દરિયા કિનારાના લોકોને તેમજ માછીમારોને ચેતવણી

આપવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
 ઉપરાંત પૂર અને અતિવૃષ્ટિની આગાહી તથા સંભવિત
 વિસ્તારોમાં ચેતવણીનું વ્યવસ્થાતત્ત્વ ગોડવવામાં આવ્યું
 છે, પરંતુ વિભિન્ન પ્રકારની હોનારતો માટે સુવ્યવસ્થિત
 કાળૂની આધાર અને વિશેષ વ્યવસ્થા તત્ત્વની જોગવાઈવાનું
 આયોજન ૨૦૦૧ ના ગુજરાતના ધરતીકુંપ પણી જ
 વિચારવામાં આવ્યું છે.^૫

ટૂંકમાં આફ્ટોનો ઉપાય છે પૂર્વ તૈયારી (Prevention is better than Cure) એ કહેવત અનુસાર આફ્ટોના ઉપાયો કરતાં આફ્ટોને રોકવાની તૈયારી એ વધુ સારો ઉપાય છે. પૂર્વ તૈયારીમાં જેટલો વધુ પરસેવો પાડીએ તેટલું ઓછું લોહી આફ્ટ વેળાએ વહે છે. વળી આફ્ટ પહેલા પૂર્વ તૈયારીમાં જેટલો વધુ ખર્ચ કરીએ તેટલું જ ઓછું નુકસાન આફ્ટ પણી થાય છે.

પાદટીએ

1. ભરૂચા એરચ, ‘પર્યાવરણ અધ્યયન’ (પર્યાવરણના અભ્યાસનું બહુવિદ્યા શાખાકીય સ્વરૂપ), ઓરિએન્ટ લોંગમન પ્રાયવહેટ લિમિટેડ, પ્રથમ આવૃત્તિ, મુંબઈ, ૨૦૦૮, પાન નં. ૧૮.
2. શુક્લ ડૉ. બિપિનયંક અમ., ‘પર્યાવરણિય કાયદો’, યુનિ.ગ્રંથ બોર્ડ, પ્રથમ આવૃત્તિ, અમદાવાદ, ૨૦૦૪, પાન નં. ૪૦૮.
3. ઉદાએ ડૉ. નિહારિકા ટી., ‘આપત્તિ વ્યવસ્થાપન અને ગ્રંથાલયમાં તેનું અમલીકરણ’, મીડિયા પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ, જુનાગઢ, ૨૦૧૨, પાન નં. ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૮.
4. જાની નૂતન, ‘પર્યાવરણ કેન્દ્રી વિવેચન વિચારણા’, પાર્શ્વ પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ, અમદાવાદ, ૨૦૧૨, પાન નં. ૬૬, ૬૭.
5. મોદી ડૉ. સી.ડી. અને અન્ય, ‘પર્યાવરણ અને આપત્તિનું વ્યવસ્થાપન’, સ્વામી પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, પાટણ, ૨૦૦૬, પાન નં. ૮૩.

૪૪, જૈન એલર્ટ નગર, મહાકાલી મંદીર પાસે, મહાવીરનગર,
 હિંમતનગર, કિ. સાબરકાંદા-૩૮૦૦૧,
 મો.: ૯૪૨૯૨૯૭૮૪૦૫

Cyber Crime: Types and Analysis

Rajiv Maheshbhai Patel

1. Introduction:

Today the world has become very small and has come to be called the global village. The means of communication have become very fast and any kind of information from any place in the world can be obtained within few minutes with the help of internet. In India internet is growing rapidly. There two sides of a coin. Internet also has its disadvantages. One of the major disadvantages is cyber crime. Cyber crime is not an old sort of crime. It is defined as any criminal activity which takes place on or over the medium of computer or internet or other technology recognised by the Information Technology Act. There are number of illegal activities which are committed over the internet by technically skilled criminals. Taking a wider interpretation it can be said that, Cyber Crime includes any illegal activity where computer or internet is either a tool or target or both.

2. What is Cyber Crime?

Cybercrime is defined as a crime in which a computer is the object of the crime (hacking, phishing, spamming) or is used as a tool to commit an offense (child pornography, hate crimes). Cybercriminals may use computer technology to access personal information, business trade secrets or use the internet for unfair or malicious purposes. Criminals can also use computers for communication and document or data storage. Cybercrime

may also be referred to as computer crime.

The Oxford Dictionary defined the term Cyber Crime as “Criminal activities carried out by means of computers or the Internet”.

3. Cyber Laws in India:

In today's world of cyberspace which is largely dependent upon the internet and use of technology, the incidents of cyber crime have increased. To protect one from the cyber crime, there was a need for cyber laws and so, the implementation cyber laws in India began in the year 2000, with the Information Technology Act as an introduction to Indian Cyber Law. The Information Technology Act, 2000 is an Act of the Indian Parliament (No. 21 of 2000) notified on 17th October, 2000. This act is based on the United Nations Model Law on Electronic Commerce 1996 (UNCITRAL Model).

The act essentially deals with the
 (a) Legal recognition of Electronic Documents
 (b) Legal Recognition of Digital Signatures
 (c) Offences and Contraventions and
 (d) Justice Dispensation Systems for Cyber Crimes.

4. Different types of Cyber Attacks:

Cyber attacks are categorized in three types:

A. Cyber Crime against Organisation:

Trojan horse: A program designed to breach the security of a computer system. It can duplicate them, steal information, or harm the computer system.

Hacking: It refers to unauthorized

access into a computer or a network. Hacking completely destroys the whole data as well as computer programs.

Mail bomb: An e-mail bomb is a form of Internet abuse consisting of sending huge volumes of email to a specific email address with the goal of overflowing the mailbox and crushing the mail server hosting the address.

Virus attack: A virus is a malicious program that self-replicates by copying itself to another program. The computer virus spreads by itself into other executable code or documents. The purpose of creating a computer virus is to infect the systems, gain admin control and steal user sensitive data.

B. Cyber Crime against Individual or person

Phishing: In this crime target or targets are contacted by email, telephone or text message by someone posing as a genuine institution to attract individuals into providing sensitive data such as personally identifiable information, banking and credit card details, and passwords. Then the information is used to access important accounts and can result in identity theft and financial loss.

E-Mail spoofing: Email spoofing is the forgery of an e-mail header so that the message appears to have originated from someone or somewhere other than the actual source. E-mail spoofing is a tactic used in phishing and spam campaigns because people are more likely to open an e-mail when they think it has been sent by a valid source.

Spamming: It is a use of electronic

messaging systems like e-mails and other digital delivery systems and broadcast media to send unwanted bulk messages unsystematically.

Cyber defamation: Cyber defamation is publishing of defamatory material against another person with the help of computers or internet. The intention of the person making the defamatory statement must be to lower the reputation of the person against whom the statement has been made in the eyes of the general public.

Cyber stalking and harassment: Cyber stalking is the use of the internet or other electronic means to stalk or harass an individual, group or organisation. It may include false accusations, defamation, slander and libel. It may also include monitoring, identity theft, threats, harm, solicitation for sex, or gathering information that may be used to threaten, embarrass or harass.

C. Cyber Crime against Property

Intellectual Property Crime: This crime is committed when someone manufactures, sells or distributes counterfeit or pirated goods, such as patents, trademarks, industrial designs or literary and artistic works, for commercial gain.

Cyber squatting: Cyber squatting refers to illegal domain name registration or use. Its primary purpose is to steal or misspell a domain name in order to profit from an increase in website visits, which otherwise would not be possible.

5. Steps to prevent cyber crime:

Prevention is always better than cure.

Anyone using the internet should exercise some basic precautions.

1. Never disclose your personal information publicly on websites. This is as good as disclosing your identity to strangers in public place.
2. Always avoid sending any photograph online particularly to strangers and chat friends as there have been incidents of misuse of the photographs.
3. Never enter your credit card number to any site that is not secured, to prevent its misuse.
4. Always keep a watch on the sites that your children are accessing to prevent any kind of harassment or depravation in children.
5. Always use latest and updated Antivirus software to guard against virus attacks.
6. To prevent loss of data due to virus attacks, always keep back up of your data.
7. It is advisable to use a security program that gives control over the cookies and send information back to the site, as leaving the cookies unguarded might prove fatal.
8. Use of firewalls proves beneficial.
9. Website owners should watch traffic and check any irregularity on the site. Putting host-based intrusion detection devices on servers will serve the purpose.

6. Cyber crime Statistics in India:

The latest NCRB (National Crime Record Bureau) publication of 2017 indicates an increasing incidence of cyber crime in India.

Table 1 A: Showing highest cyber crime cases registered during the year 2016.

States	Crime Incidence		
	2014	2015	2016
Uttar Pradesh	1737	2208	2639
Maharashtra	1879	2195	2380
Karnataka	1020	1447	1101
Rajasthan	697	949	941
Assam	379	483	696
Andhra Pradesh	282	536	616
Telangana	703	687	593
West Bengal	355	398	478
Haryana	151	224	401
Gujarat	227	242	362
Odisha	124	386	317
Bihar	114	242	309
Kerala	450	290	283
Jharkhand	93	180	259
Madhya Pradesh	289	231	258
Tamil Nadu	172	142	144
Punjab	226	149	102
Delhi	226	177	98

Maximum number of cases under cyber crimes were reported in Uttar Pradesh (2,639 cases) followed by Maharashtra (2,380 cases) and Karnataka (1,101 cases) during 2016.

Table 1 B: Showing lowest cyber crime cases registered during the year 2016.


States	Crime Incidence		
	2014	2015	2016
Chhattisgarh	123	103	90
Uttarakhand	42	48	62
Meghalaya	60	56	39
Goa	62	17	31
Himachal Pradesh	38	50	31
Jammu & Kashmir	37	34	28
Chandigarh	55	77	26
Manipur	13	6	11
Tripura	5	13	8
Arunachal Pradesh	18	6	4
A & N Islands	13	6	3
Nagaland	0	0	2
Puducherry	1	0	2
D&N Haveli	3	0	1
Mizoram	22	8	1
Sikkim	4	1	1
Daman & Diu	1	1	0
Lakshadweep	1	0	0
Total table A + B	9,622	11,592	12,317

Source: National Crime Record Bureau

Not a single case reported under cyber crimes in Lakshadweep, Daman

& Diu followed by Dadra & Nagar Haveli, Mizoram and Sikkim (1 case) while Nagaland and Puducherry reported 2 cases only during the year 2016.

Graph 1: Total no of cyber crime cases registered.



The aforesaid figures indicate an upsurge in rate of cyber crime over the years; however, the percentage variation in 2015-2016 is lower than the percentage variation in 2014-2015.

7. Conclusion:

Capacity of human mind is profound. It is not possible to eliminate cyber crime from the cyber space. It is quite possible to check them. History is the witness that no legislation has succeeded in totally eliminating crime from the globe. The only possible step is to make people aware of their rights and duties and to guard ourselves so that crime has no effect on us. (Note : Refer Reference section for case studies)

8. References:

1. Singh, Yatindra (2017). *Cyber Laws*. (16th Ed.). Gurgaon: Universal Law Publishing.
2. Chander, Harish. (2015). *Cyber Laws and IT Protection*. (3rd Ed.). Delhi: PHI Learning Pvt. Ltd.
3. Sharma, Vakul. (2015). *Information Technology: Law and Practice*. (4th

- Ed.). New Delhi: Universal Law Publishing Co. Pvt. Ltd.
4. Pandey, Tarun et. al. (2017). *How to report cyber crimes in Indian Territory*. International Journal of Science Technology and Management Vol. 6 (4), P. 166 – 180. Retrieved from https://www.meity.gov.in/writereaddata/files/How_Territory.pdf on 30th March, 2019.
 5. S.T. Viswanathan, The Indian Cyber Laws with Cyber Glossary, 2001, p. 81.
 6. Alpna. (2016). Cyber Crime: Its types, Analysis and Prevention Techniques. International Journal of Advanced Research in Computer Science and Software Engineering. Vol.6 (5), P. 145-150. Retrieved from http://ijarcsse.com/Before_August_2017/docs/papers/Volume_6/5_May2016/V6I5-0315.pdf on 30th March, 2019.
 7. Retrieved from <https://en.oxforddictionaries.com/definition/cybercrime> on 30th March, 2019.
 8. Retrieved from <https://www.techopedia.com/definition/2387/cybercrime> on 30th March, 2019.
 9. Retrieved from <https://www.myadvo.in/blog/what-is-the-cyber-law-in-india/> on 30th March, 2019.
 10. Retrieved from <http://www.phishing.org/what-is-phishing> on 1st April, 2019.
 11. Retrieved from <https://searchsecurity.techtarget.com/definition/email-spoofing> on 1st April, 2019.
 12. Retrieved from <http://www.helplinelaw.com/employment-criminal-and-labour/CDII/cyber-defamation-in-india.html> on 1st April, 2019.
 13. Retrieved from <https://en.wikipedia.org> on 1st April, 2019.
 14. Retrieved from <https://www.europol.europa.eu/crime-areas-and-trends/crime-areas> on 1st April, 2019.
 15. Retrieved from <http://www.waronidtheft.org> on 1st April, 2019.
 16. Retrieved from <https://www.firstpost.com/tech/news-analysis/maharashtra-government-website-hacked-3557563.html> on 2nd April, 2019.
 17. Retrieved from <https://timesofindia.indiatimes.com/city/mumbai/Maharashtra-govt-website-hacked/articleshow/2381397.cms> on 2nd April, 2019.
 18. Retrieved from <http://legalxpertxone.com/online-credit-card-scam> on 2nd April, 2019.
 19. Retrieved from <https://www.sfgate.com/bayarea/article/Murder-suspect-identified-through-gang-s-My-Space-3237741.php> on 2nd April, 2019.
 20. Retrieved from <http://cybertimes.in/?q=node/540> on 2nd April, 2019.
 21. Retrieved from <https://www.vakilno1.com/legal-news/cybercrime-in-india.html> on 2nd April, 2019.
 22. Retrieved from <http://ncrb.gov.in/StatPublications/CII/CII2016/pdfs/Crime%20Statistics%20-%202016.pdf> on 3rd April, 2019.

Library Professional
R N Patel Ipcowala School of Law and Justice,
Vallabh Vidyanagar, (M) 9824830564
E-Mail: rajiv_shreeji@yahoo.co.in

કવિશ્રી ભાવેશ ભહુની એક સુંદર ગજલ...

અલ્પેશ કળસરિયા

સદાય એક સમો થનગનાટ ના પણ હોય.

હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય.

ત્રણેય લોક ગજલમાં સમાવી લઉં છું હું,
અહીં બધાયનાં પગલાં વિરાટ ના પણ હોય.

ઇતાં ઉજાસનાં ધોરણને જાળવી રાખે,
અમુક-અમુકના દીવાઓમાં વાટ ના પણ હોય.

તૂટે-કટે તો હરખ-શોક બહુ નહીં કરવો,
દરેક જિંદગીઓ મૌંઘી-દાટ ના પણ હોય.

ખૂટી ગયા છે કિરણ, દબદબો ઇતાં પણ છે,
બધા સૂરજની ભીતર ઝણહણાટ ના પણ હોય

-ભાવેશ ભહુ

ગજલમાં પોતાની ચોટાર અભિવ્યક્તિના કારણે
ભાવેશ ભહુ જાણીતા છે, તેમની ગજલોમાં ભાવ અને
ઇંદ્રનું વૈવિધ્ય પણ એટલું જ હોય છે, તેમના શેરમાં સરળ
ભાષામાં વેધક વિચાર રજૂ કરવામાં આવે છે, વાસ્તવિકતા
તેમની ર્યાનાઓનું વળી એક જમાપાસું છે, તેમની પ્રસ્તુત
ગજલ સામાન્ય માણસનાં સામાન્ય જીવનનો જ જાણે
મહિમા કરે છે:

સદાય એક સમો થનગનાટ ના પણ હોય.

હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય.

જીવન સુખદુઃખ અને તડકી-છાંયીનું નામ છે, તેમાં
ક્યારેક આનંદ તો ક્યારેક ગમ છે સાથે દરેક માટે આવા
અનુભવો પણ સમાન નથી હોતા, કોઈના ઘરમાંકે જીવનમાં
ખૂશી હોય ત્યારે જ કોઈના નિવાસે દર્દીલી અવસ્થા પણ
હોય શકે છે, આથી જ દરેક પ્રસંગે માનવી એકસરખો
ઉત્સાહ ચાહે તો પણ દાખવી નથી શકતો, આખરે માણસ
કેવળ માણસ છે તે જીતે પણ છે હારે પણ છે, સફળ પણ
થાય છે અને તેને અનુકૂળ હવા ન હોય તો નિષ્ફળ પણ
જાય છે, માણસે આ બધી વાસ્તવિકતા સ્વીકારીકે જીવીને
આશાનો દીપક પ્રજ્વલિત રાખવો રહ્યો.

ત્રણેય લોક ગજલમાં સમાવી લઉં છું હું,
અહીં બધાયનાં પગલાં વિરાટ ના પણ હોય.

ગજલકાર અહીં ગજલસર્જનનો, ભગવાન વિષ્ણુના
પાંચમાં અવતાર વામન અવતારના અપ્રત્યક્ષ સંદર્ભના
પુરાકલ્પન વેડ મહિમા કરે છે, ભગવાને એ સમયે કેવળ બે
પગલાં દ્વારા પૃથ્વી અને આકાશ આવસી લીધું હતું જ્યારે
ગજલકવિ પણ આમ જ ત્રણેય લોક ગજલમાં વણી લે છે
પરંતુ તે તો સર્જનશક્તિનો જ ચમત્કાર, વળી બલિરાજા
પાસેથી પ્રભુએ તો ત્રણ ડગલાં વેદ તેમનું સાખાજ્ય દાનમાં
મેળવી લીધું હતું જ્યારે કવિને એ સાંત્વન છે કે તેના
સર્જન-ત્રિલોક પર તો બધાના પગલાં સમાન જ હોય છે
માટે પ્રભુ પણ તેમને આશીર્વાદ આપે છે.

ઇતાં ઉજાસનાં ધોરણને જાળવી રાખે,
અમુક-અમુકના દીવાઓમાં વાટ ના પણ હોય.

‘વહી!’ કહી ઉઠીએ તેવો આ શેર કવિની કાલ્યદશક્તિનો
પરિચય આપે છે! આ શેર આપણા સમાજના એ લોકોનું
પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ પણ પરિસ્થિતિ અને
વાતાવરણમાં પોતાના ઉમદા ગુણોનું જતન કરતાં રહીને
વિશ્વમાં નેકીની સુવાસનો પ્રકાશ સદા જગહળતો રાખે છે,
માનવજાતની એ જ ખાનદાની છે જે રીતે ચંદનના વૃક્ષ
પર સાપને પણ આશરો મળે ઇતાં ચંદનની સુવાસમાં વિષ
નથી પ્રસરતું તે પોતાની સુવાસનું ધોરણ જાળવી રાખે છે
એમ જ નેકટિલ ઈન્સાન ગરીબ હોય કે કસોટીની કોઈ પણ
અવસ્થામાં હોય પોતાના ધોરણથી ક્યારેય નીચે ઉત્તરતો
નથી, દીવો, વાટ અને ઉજાસનાં પ્રતીક વેદ ગજલકાર
કવિતાની કક્ષાએ આવો માર્મિક ભાવ રજૂ કરે છે.

તૂટે-કટે તો હરખ-શોક બહુ નહીં કરવો,
દરેક જિંદગીઓ મૌંઘી-દાટ ના પણ હોય.

શાયર વિરોધાભાસી શૈલી વેદ ખૂબીથી પોતાની વાત
મુકે છે, દરેક જીવનની કિંમત ખરેખર તો સમાન છે આમ
ઇતાં દુનિયામાં એક સામાન્ય માણસની જિંદગી બાબતે
ક્યારેક બેવાં વલણ જોવાં મળે છે, તેના પર કવિ આ શેર
વેદ ચિંતા વ્યક્ત કરી શરીરિઅત સાથે છે.

ખૂટી ગયા છે કિરણ, દબદબો ઇતાં પણ છે,
બધા સૂરજની ભીતર ઝણહણાટ ના પણ હોય.

ગજલના આ અંતિમ શેરમાં કવિ જણાવે છે કે કેટલીક
ખાસ શાખિસ્યત બાધ્ય ઠાક-ભલ્ખાથી નહીં પણ તેમની
ભીતરના જગહળાટથી રોશન હોય છે અને એથી જ
એમના વ્યક્તિત્વની સુવાસ કદી જંખવાતી નથી, કેટલાક

સમાજ-સેવક, કલાકાર, અભિનેતા, મહાનુભાવો કે સામાન્ય પ્રેમાળ માનવીઓ સદાભાર હોય છે અને તેમની ખુમારી આપણાને મહેસૂસ થયા વિના નથી રહેતી, સમયનો પટ આવા સૂર્યના દબદ્બાને ઘટાડી નથી શકતો તેમનો જળહળાટ સદા અકબંધ રહે છે, તો ક્યારેક 'મરીજ' ની નજીમ "સદીઓથી એવું જ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાત્માં" ના કાવ્ય-નાયકની જેમ બાધ્ય જળહળાટના અભાવે એવા કેક પ્રેમાળ માનવીઓ જે ખરા અર્થમાં સૂરજ છે અથવા બાહુરથી નહીં ભીતરથી સૂરજ જેવાં પ્રકાશિત હોય છે તેમને ઓળખવા-પામવા પણ બાધ્ય ભભકાયાં રાચતા આપણા સમાજ માટે ચુનૌતી છે કહો કે આપણી નૈતિક ફરજ છે, આવો એક સૂક્ષ્મ મર્મ પણ

॥ રમત-જગત ॥

ઓલિમ્પિકની અજાયબી મહિલા એથ્લેટ : વિલ્મા રૂડોલ્ફ

પી.ડી.શર્મા

આજે ઓલિમ્પિકના ઈતિહાસમાં અમુક ખેલાડીઓની સિદ્ધિઓ દંતકથા સમાન છે. દા.ત. જેસી ઓવેન્સ, પાવો નૂર્મી, માર્ક સ્ટિપ્પર્ટ, બોબ વિમાન, નાઈયા કોમેન્સી, કાર્લ લુઇસ, માઈકલ જોન્સન, માઈકલ ફેલ્પ્સ, યુસેન બોલ્ટ વગેરે. પરંતુ નાનપણથી ભયંકર ન્યુમોનિયાને કારણે એક પગથી અપંગ બનનાર અમેરિકાની વિલ્મા રૂડોલ્ફની સિદ્ધિ દંતકથાથી પણ મહાન છે. વિલ્મા રૂડોલ્ફ કેદી ૧૯૬૦ માં રોમ ઓલિમ્પિકસમાં ત સુવાર્ષયન્ડક મેળવીને ન કલ્પી શકાય તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓએ રોમ ઓલિમ્પિકસમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની દોડ જીતીને અશક્ય બાબત શક્ય કરી બતાવી હતી. એટલું જ નહિ પણ એમના અથાગ પ્રયાસોને કારણે અમેરિકાની ટીમે ૪ બાધ્ય ૧૦૦ મીટર રીલેમાં 'વિશ્વવિક્રમ' સાથે સુવાર્ષયન્ડક પણ મેળવ્યો હતો. આ જાતની સિદ્ધિ આજદિન સુધી કોઈ પણ મહિલા ખેલાડીએ ઓલિમ્પિકમાં આ સંશોગોમાં મેળવી નથી.

ભયંકર ન્યુમોનિયા

વિલ્મા જયારે ફક્ત ચાર વર્ષની હતી ત્યારે તેને ભયંકર ન્યુમોનિયા થયો હતો. આ ભયંકર બીમારીને કારણે તેના એક પગે કરવાનું છોડી દીધું એટલે કે તેનો એક પગ

આપણાને કવિ પાસેથી આ શેરમાં મળે છે.

આમ પોતાના અલગ મિજાજ વડે રચાયેલી આવી ગજલો, પ્રતીક, કટ્પન, અલંકાર જેવી ભાષાકીય સક્રિયા અને છંદવૈવિદ્ય સાથે સરળતાથી રજુ થતા ગઢન વિચારો ગજલકાર તરીકે કવિશ્રી ભાવેશ ભણ્ણે એક નોખી હરોળના ગજલસર્જક બનાવે છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

C-૧૫૭૪,
નીલંકંઠ સોસાયટી, કાળિયાબીડ,
ભાવનગ-૩૬૪૦૦૨.
મો. ૯૦૩૩૭ ૮૦૦૮૪

પોલીયોગ્રસ્ત થઈ ગયો. તેથી આ પગથી તે કોઈ કામ કરવા સક્ષમ રહી ન હતી. એટલું જ નહિ પણ સાથોસાથ 'સ્કારલેટ' તરીકે ઓળખાતો ગંભીર તાવ પણ આવ્યો હતો. આ રીતે ફક્ત ચાર વર્ષની ઉમરે તે અપંગ અને અશક્ત બનનાર વિલ્માની મમ્મીએ હતાશ થયા વગર સારવાર માટે લઈ જતા હતા. બે વર્ષની સતત સારવારને અંતે બૂટ પહેરીને તે સામાન્ય ચાલવા માંદી હતી, પરંતુ વિલ્મા અને મમ્મીના આત્મવિશ્વાસને લીધે તે ધીમે ધીમે લંગડી સાથે દોડવા લાગ્યો અને તે સમયની વિલ્માને જોઈને કોઈ સ્વાપ્ને પણ કલ્પના ન કરી શકે કે એક દિવસ તે 'વિશ્વની સર્વશ્રીએ ધાવક' બનશે. સતત અને સખત પ્રયાસથી વ્યક્તિ કર્યાં સુધી પહોંચી શકે તેની 'વિલ્મા રૂડોલ્ફ' કરતા શ્રેષ્ઠ દાખલો વિશ્વમાં ભાગ્યે જ મળે.

સામાન્ય કુટુંબમાં જન્મ

વિલ્માનો જન્મ ૨૩ જૂન, ૧૯૪૦ ના રોજ ખૂબ જ સામાન્ય નિશ્ચો પરિવારમાં થયો હતો. તેમના પિતા રેલ્વે સ્ટેશનો પર ઉત્તરાંધોના સમાન લોંગકતા હતા તથા તેમની માતા ઘરે ઘરે કચરાપોતા કરતી હતી. આ રીતે નાનપણથી જ ખૂબ જ મર્યાદિત સગવડો સાથે તે મોટી થઈ હતી. છતાં રમતગમત ક્ષેત્રે તેઓની સિદ્ધિઓ અકટ્પનીય છે.

બાસ્કેટબોલની શ્રેષ્ઠ ખોલારી

વિલ્માને શરૂઆતમાં બાસ્કેટબોલની રમતમાં વિશેષ રૂચિ હતી. જયારે તે અગિયાર વર્ષની હતી ત્યારથી બાસ્કેટ

બોલની રમત રમવા માંડી હતી. કોઈ કલ્પના પણ ન કરી શકે તે રીતે તે બાસ્કેટબોલની શ્રેષ્ઠ ખેલાડી બની હતી. ધીમે ધીમે એનો અશક્ત પગ શક્તિમાન થવા માંડ્યો અને ખૂબ જ ટૂંક ગાળામાં તે પોતાના રાજ્યની બાસ્કેટ બોલની “સર્વશ્રેષ્ઠ ખેલાડી” બની ગઈ. સતત પ્રયાસને કરાડે તેનામાં ગજબની શક્તિ, ચપળતા અને ઝડપ આવી ગઈ હતી. તેની બાસ્કેટ બોલની રમત જોવા માટે લોકો વિરોષ રૂપી આવતા હતા. આ રીતે અપંગ વિલ્મા રૂડોલ્ફ બાસ્કેટ બોલની અમેરિકાની એક શ્રેષ્ઠ ખેલાડી બની હતી.

અભ્યાસમાં આગળ

મેરુ પર્વત જેવું અડીભમ મનોબળ ધરાવતી ઐતિહાસિક દોડવીર વિલ્મા રૂડોલ્ફ અભ્યાસમાં પણ આગળ હતી. હાઈસ્ક્વલનો અભ્યાસ પૂર્ણ કરી જયારે તે કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે પોતાના ઘરની આર્થિક સ્થિતિથી વોકેફ હતી. તેથી કુટુંબના ખર્ચને પહોંચી વળવા તે અમુક કલાક એક ઓફિસમાં કામ પણ કરતી હતી. એટલે અભ્યાસની સાથે દોડની પ્રેક્ટિસ તેમજ નોકરી કરનાર વિલ્મા નાનપાણી જ સખત મહેનતુ હતી.

સતત દોડનો અભ્યાસ

દોડના ક્ષેત્રમાં વિલ્માને પ્રકાશમાં લાવવા માટેનું શ્રેય તેના રાહબર શ્રી એડવર્ડ ટેમ્પલને જાય છે. તેમના યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણાથી વિલ્મા સતત પ્રગતિના શિખરો પ્રાપ્ત કરવા માંડી. જયારે અને જેટલો ફી ટાઇમ મળે ત્યારે એ તરત જ દોડવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ રીતે તેઓ અકલ્પનીય રીતે દોડની પ્રેક્ટિસ કરતી હતી.

રોમ ઓલિમ્પિક્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ

ધીમે ધીમે વિલ્મા રૂડોલ્ફની નામના સમગ્ર અમેરિકામાં ફેલાઈ ગઈ અને જયારે ૧૮૬૦ માં રોમ મુકામે આયોજિત થનાર ઓલિમ્પિક્સ માટે અમેરિકાના મહિલા એથ્લેટ્સની પસંદગી કરવામાં આવી ત્યારે ૧૦૦ મીટર ૨૦૦ મીટર માટે વિલ્માની પસંદગી આપોઆપ થઈ ગઈ હતી. આ રીતે એક સમયની એક પગે પોલિયો ગ્રસ્ત વિલ્માને રોમ ઓલિમ્પિક્સમાં ભાગ લેવો તે કોઈ નાનીસૂની બાબત નથી. રોમ ઓલિમ્પિક્સમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ધાવકો વચ્ચે

વિલ્માને ન કલ્પી શકાય તેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડમાં જયારે તે પ્રથમ આવી ત્યારે તેને ઓલિમ્પિક્સના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો, કરાડાંકે આ બે ટૂંકી દોડમાં પ્રથમ આવનાર તે ‘વિશ્વની પ્રથમ મહિલા’ હતી. એટલું જ નહિં, પણ ૪ બાય ૧૦૦ મીટર રિલેમાં તેના અથાગ પ્રયાસથી અમેરિકાની ટીમે ‘નવા વિશ્વ વિક્રમ’ સાથે સુવાર્ષ ચંદ્રક મેળવ્યો હતો. આ રીતે એક જ ઓલિમ્પિક્સમાં દોડની અંદર ત્રણ સુવાર્ષચંદ્રક મેળવનાર તે ‘અમર ખેલાડી’ બની હતી. એટલા માટે જ ૧૮૬૦ના રોમ ઓલિમ્પિક્સની સિદ્ધિઓ જોઈને અખબારો અને ‘ધ બ્લેકપર્લ’ (શયામ મૌતી) અને ‘ધ બ્લેક ગેરેલ’ (પાણીદાર આંખોવાળું શયામ મૃગ) તરીકે વાર્ષિકતા થઈ ગયેલા.

એટલાન્ટા ઓલિમ્પિકમાં બહુમાન

૧૮૮૮ માં એટલાન્ટા મુકામે આયોજિત ‘શતાબ્દી ઓલિમ્પિક રમતોત્સવ’ ના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન ઓલિમ્પિક્સના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં જે ‘અમર ખેલાડીઓ’ થઈ ગયા છે તેઓને યાદ કરવામાં આવ્યા હતા. દરેક ઓલિમ્પિક્સમાંથી એક ‘અમર ખેલાડી’ ને પસંદ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારે ૧૮૬૦ ના રોમ ઓલિમ્પિક્સમાંથી ‘વિલ્મા રૂડોલ્ફ’ ની પસંદગી કરવામાં આવી હતી. કોઈ પણ ઓલિમ્પિક ખેલાડીને આના કરતા વધુ માન મળી શકે નહીં. એક વ્યક્તિ સમગ્ર ઓલિમ્પિક્સનું પ્રતિનિધિત્વ કરે અને તે પણ એક સામાન્ય કુટુંબમાં જન્મેલી અને નાનપણમાં અપંગ થયેલ મહિલાની પસંદગી થાય તે સમગ્ર ઓલિમ્પિક ઇતિહાસની એક યાદગાર ઘટના ગણાય.

કાંસાની પ્રતિમા

વિલ્માને અસંખ્ય એવોડર્સ, ચંદ્રકો, સર્ટિફિક્ટ્સ તથા ઈનામોથી નવાજવામાં આવી હતી. એટલું જ નહિં પણ વિલ્મા વિશે પુસ્તકો લખાયા, ટીવી સિરિયલો બની, ફિલ્મો પણ બની અને એના જન્મ સ્થળે તો તેની કાંસાની પ્રતિમા ગોઠવવામાં આવી છે.

B-1 Swiss Avenue, Patel Colony, Opp
Manekbaug Hall, Ambawadi, Ahmedabad-380
015. (R) 079 - 26564650 (M) 9898870840

॥ વિદ્યાવૃત્ત ॥

ગો. જો. શારદા મંદિર, વલ્લાભ વિદ્યાનગરનું ઘોરણાઃ - ૧૦ માર્ચ-૨૦૧૮ બોર્ડ પરીક્ષામાં ૮૦.૦૫% પરિણામ

વોરા મિશ્યા અનિલભાઈ	સુથાર શ્રેયા કદ્વેશભાઈ	પટેલ હેતવી અમિષકુમાર	જોશી ખેવના હસિતભાઈ.	વડોદરીયા માર્ગી ગોવિંદભાઈ
શાળામાં પ્રથમ	શાળામાં દ્વિતીય	શાળામાં તૃતીય	શાળામાં ચોંધો	શાળામાં પાંચમો
૫૬૮/૬૦૦ PR-૮૮.૮૮ ગ્રેડ A1	૫૪૮/૬૦૦ PR-૮૮.૫૮ ગ્રેડ A1	૫૪૮/૬૦૦ PR-૮૮.૫૭ ગ્રેડ-A1	૫૨૬/૬૦૦ PR-૮૮.૭૨ ગ્રેડ-A2	૫૨૬/૬૦૦ PR-૮૮.૭૨ ગ્રેડ-A2

ચારુતર વિદ્યામંડળ સંચાલિત ગો. જો. શારદા મંદિરનું એસ.એસ.સી બોર્ડ ૨૦૧૮માં લેવાયેલી પરીક્ષામાં ૮૦.૦૫% પરિણામ આવ્યું છે. શાળામાં એ-૧ ગ્રેડમાં ૩, એ-૨ ગ્રેડમાં ૮, બી-૧ ગ્રેડમાં ૩૮, બી-૨ ગ્રેડમાં ૩૫, સી-૧ ગ્રેડમાં ૬૬, સી-૨ ગ્રેડમાં ૪૮, ડી ગ્રેડમાં ૦૧ વિદ્યાર્થીઓ સાથે ૧૮૮ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ છે. ચારુતર વિદ્યામંડળના ચેરમેન ઈજનેરશ્રી. ભીમુભાઈ બી. પટેલ તથા માનદ મંત્રીશ્રી ડૉ. એસ. જી. પટેલ અને આચાર્ય રીતાબેન પટેલ, શાળાના સૌ શિક્ષણગાણ સૌએ ઉતીર્ણ થયેલી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠ્ય છે.

અનવીપાસ કોલેજનો વિદ્યાર્થી ઓરેક્લા અમદાવાદમાં નિમણૂક પાંચો

ચારુતર વિદ્યામંડળ સંચાલિત નટુભાઈ વિ. પટેલ કોલેજ ઓફ પ્લાઇઝ સાયન્સીજના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં બીએસસી (રીઓ એન્ડ આઈઈ)નો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થી જ્ય પટેલ ઓરેક્લા અમદાવાદમાં જુનિયર ક્વોલીટી એસ્સ્યોર્સ અનાલીસ્ટ તરફ નિમણૂક પાંચો છે, તેઓ કંપની તરફથી પ્રારંભિક રૂપિયા ૪.૩ લાખનું પેકેજ મેળવશે. કોલેજના આચાર્યશ્રી ડૉ. બાસુદેબ બક્ષી, કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા શ્રેયાબેન શાલ તથા સમગ્ર કોલેજ પરિવારે વિદ્યાર્થી જ્ય પટેલને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠ્ય છે.

અનવીપાસ કોલેજમાં પોઝાયેલ ફેકલ્ટી ઇન્ડક્ષન પ્રોગ્રામ

ચારુતર વિદ્યામંડળ સંચાલિત નટુભાઈ વિ. પટેલ કોલેજ ઓફ પ્લાઇઝ સાયન્સીજના આચાર્ય શ્રી ડૉ. બાસુદેબ બક્ષીના માર્ગદર્શન દેણ કોલેજના ઇન્ટરનલ ક્વોલીટી એસ્સ્યોરન્સ સેલ (આઈક્યુઅસી) દ્વારા તાજેતરમાં નવનિયુક્ત અધ્યાપકો માટે સત્રની શરૂઆતમાં ૪ બે દિવસીય ફેકલ્ટી ઇન્ડક્ષન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય આ અધ્યાપકોને કોલેજની કાર્યપ્રણાલી તથા વિવિધ શૈક્ષણિક તેમજ શિક્ષણોત્તર પ્રવૃત્તિઓથી માહિતગાર કરવાનો અને કોલેજના વિકાસમાં સહિત રીતે પોતાનું યોગદાન આપવાને સક્રમ બનાવવાનો હતો.

કાર્યક્રમ ના ઉદ્વાટન પ્રસંગે ઉપરિથિત ચારુતર વિદ્યામંડળના માનાઈ મંત્રી શ્રી ડૉ. એસ. જી. પટેલે સર્વે અધ્યાપકોને કોલેજના સર્વાંગી વિકાસ અને વિદ્યાર્થીઓની કાર્યક્રમીના ઘઢતરમાં પોતાનું યોગદાન આપવાની અપીલ કરી હતી. બે દિવસના આ પ્રાણીકાર્યક્રમમાં આચાર્યશ્રી ડૉ. બાસુદેબ બક્ષી, આઈક્યુઅસીના ડો-ઓફિનેટર ડૉ. રીતા કુમાર, કોલેજના વિવિધ વિભાગના વડાશ્રીઓ તેમજ વરિષ્ઠ પ્રાદ્યાપકોએ કોલેજની કાર્યપ્રણાલી, નવીનતમ અધ્યાપક પ્રવૃત્તિઓ તથા શૈક્ષણિક સિદ્ધિઓ જેવા વિષયોને આવરી લેતા વ્યાખ્યાન રજૂ કર્યા હતા. પ્રતિભાની અધ્યાપકોએ પણ તેમના પ્રતિભાવમાં કોલેજના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશરીલ રહેવા કાટિબદ્ધતા તેમજ આઈક્યુઅસી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

સેમકોમ કોલેજ દ્વારા વિશ્વ પર્યાવરણની ઉજવણી

વૈશ્વવિકસતરે જ્યારે દ્વિર્યાઈ પાણીનું વધું, દ્વિર્યાઈ ડિનારે પૂરપરિસ્થિતી, વાસ્તવાર અને ઘાતક બનતી હિટવેવ, જંગલમાં લગતી આગ વિગેરે સત્તમસ્યાઓ વ્યાપક બનતી જાય છે ત્યારે, ધરતીમાતાને બચાવવા વધું વૃક્ષો વાવવાની જરૂર છે. ચારુતર વિદ્યામંડળ સંચાલિત સેમકોમ અન.એસ. એસ. વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ સંપત્ત થયો હતો. વિદ્યાર્થીઓને આ વિશ્વવ્યાપક મુશ્કેલીઓ માટે વધું સર્વેનંશરીલ બનાવ્યાના આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સકળ સંચાલન ડૉ. રિના દ્વારા, મિસ. જે નિતા પટેલ તથા ડૉ. જેમીન નિવેદી દ્વારા તેમજ સંસ્થાના આચાર્ય ડૉ. વિલીલ થોમસના માર્ગદર્શનહેઠન કરવામાં આવ્યું હતું.

આઈસ્ટાર કોલેજમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવાએ

વિશ્વમાં દર વર્ષે ૫ જૂન પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. જેના ભાગએ તાજેતરમાં ચારુતર વિદ્યા મંડળ સંચાલિત આઈસ્ટાર કોલેજ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ હવાના પ્રદૂષણને રોકવાની છે. હવામાં ઘણાં પ્રકારના પ્રદૂષિત વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોસ ઓક્સાઇડ્સ, પરસીસ્ટન્ટ ઓર્ગનિક પોલ્યુન્ટ વર્ગે રહેલા છે, જે વનસ્પતિઓ દ્વારા શોખાય છે. એક અભ્યાસ મુજબ, પુષ્ટ વૃક્ષો નાના છોડની સરખામણીમાં વધુ પ્રમાણમાં પ્રદૂષિત વાયુઓનું શોખાણ કરવા માટે કાર્યક્રમ છે અને તેથી કાર્બન સિક્વેસ્ટ્રેશન તરીકે જાહીરાત છે. એક વૃક્ષ એક વર્ષને અંતે રૂર ડિલો કાર્બન ડાયોક્સાઇડને શોખી શકે છે અને ૧ ટન કાર્બન ડાયોક્સાઇડનું સિક્વેસ્ટ્રેશન કરી શકે છે. આ પ્રક્રિયા એક વૃક્ષ ૪૦ વર્ષ સુધી અવિરતપણે કરે છે. ઉજવાએ નિમિત્તે સીલીએમના વાઈસ પ્રોસૈડન્ટ શ્રી મનીપભાઈ પટેલ તથા અન્ય સભ્યોના હસ્ત પર્યાવરણને અનુકૂળ એવા વૃક્ષો જેવા કે લીમડો, ગુલમહોર, ડેસુડો, પીપળો, કાસિદ, કાંચનાર, સરેશ વિગેરેનું વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું. વધુમાં આઈસ્ટાર કોલેજના પ્રિન્સિપાલ ગ્રો. ડૉ. નિર્મલ કુમાર તેમજ શૈક્ષણિક અને જિન્સેન્સિઝિક કર્મચારીઓએ પણ પર્યાવરણલક્ષ્ય વૃક્ષો વાચ્યા હતા. તફુપરાંત પ્લાસ્ટિકનું વધતું જતું પ્રદૂષણ અટકાવવાના હેતુસર આઈસ્ટાર કોલેજ દ્વારા દુકો ફેન્ડલી બેગનું પણ વિતરણ મોટા ભજારમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સફળતા બદલ સીલીએમના ચેરમેન શ્રી ભીખુબાઈ પટેલ સાહેબ સંસ્થાને અને તેના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠ્ય હતા.

આઈસ્ટારના ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ના વિદ્યાર્થીની વિદેશ ટ્રેનિંગ

ચારુતર વિદ્યામંડળ સંચાલિત આઈસ્ટાર કોલેજના ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગમાં દર વર્ષ વિદ્યાર્થીઓ જુદી જુદી ઘ્યાતાનામ કંપનીઓ જેવી કે ડેરીલા, ઓનેનજસી, લુ. એસ. એફ. સી., અમૃલ, સર્વિલિક, પ્રોલિક્ષિક વરે રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માં ટ્રેઈનિંગ માટે પસંદગી પામે છે. આ અંતર્ગત આ વર્ષે બીજા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થી શાહનવાજ પદાર્થ ની પસંદગી કુવૈતની કંપની **Ai=Afraz engineering**માં થઈ. જેમાં એક મહિનો એનાલિટીકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ ના મેન્યુકેક્ચર્સીંગ, મેન્ટેનન્સનું જ્ઞાન આપવામાં આવેલ. વિદ્યાર્થીઓ આઈસ્ટાર તરફથી આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રેઈનિંગ મળવા બદલ હેડ, ડૉ. લિમાંશુ કાપસે, પ્રિ. નિર્મલકુમાર સર તથા ચારુતર વિદ્યામંડળનો આભાર માનેલ છે. આ કોર્સ ના દરેક વિદ્યાર્થીને જોબ પ્લેસમેન્ટ પણ સારુ મળી રહે છે. આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ટ્રેઈનિંગ વિદ્યાર્થીના કારકીર્દી ઘડતરમાં ખૂબ મદદ થાય છે.

ન્યુ વિદ્યાનગર ખાતે એરીબાસમાં સી.એસ.આઈ.આર. (લાઈફ સાઇન્સ) નેટ ટ્રેનિંગ કોર્સ ચોજાયો

ચારુતર વિદ્યામંડળ સંચાલિત ન્યુ વિદ્યાનગરમાં આવેલી અશોક એન્ડ રીટા પટેલ ઈન્સ્ટ્રીગ્રેટેડ સ્ટડીસ એન્ડ રિસર્ચ ઇન બાયોટેકનોલોજી એન્ડ એલાઇડ સાયન્સ (એરીબાસ) માં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગર દ્વારા અનુદાનીત વિના મૂલ્યે સી.એસ.આઈ.આર. (લાઈફ સાઇન્સ) નેટ ટ્રેનિંગ કોર્સની યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં સાયન્સની અનુસ્નાતક ડિગ્રી મેળવેલા તેમજ બીજા અને ચોચા સેમિસ્ટરમાં અભ્યાસ કરતાં એવા રૂ.૩૦ વિદ્યાર્થીઓ એ ઓન લાઇન અસરું કરી હતી જેમાથી ગુણવતાને આધારે પણ વિદ્યાર્થીઓ પસંદગી પામી આ તાલીમ લીધી હતી. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાંથી ૨૨ જેટલાં વિષય તજ્જ્ઞનો દ્વારા તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના માનદ સહમતી શ્રી ડૉ. એસ.જી. પટેલ ખાસ હાજર રહીને તાલીમાર્થિઓને પોતાના વ્યક્તવય થકી પ્રોત્સાહિક કર્યા હતાં. સી.જી.ભક્તા ઈન્સ્ટ્રીટ્યુટ ઓફ બાયોટેકનોલોજી કોલેજનાં વિષય તજ્જ્ઞ ડૉ. ગોપાલ જી ગોપાલે સી.એસ.આઈ.આર. (લાઈફ સાઇન્સ) નેટ પરીક્ષાનું મહત્વ, અભ્યાસકર્મની માહિતીની વિસ્તૃત જાણકારી આપીને તાલીમાર્થિઓને તે અંગે વાકેફ કર્યા હતાં. સંસ્થાના ઈન્સ્યાર્જ હેડ ડૉ. ભક્તિ બાજપાઈએ સર્વે વિદ્યાર્થીઓને આવકાર આપી શુભેચ્છાઓ આપી હતી. તાલીમનાં કન્વીનર ડૉ. દિવિજયસિંહ રાણાએ ઇ દિવસ ચાલનારી પ્રવૃત્તિઓની જાહીકારી આપી હતી. અત્યારે શ્રી સ્નેહલ ઈંગ્લેસાહેબ, સૌ. હાજર રહેલા મહેમાનશ્રીઓએ, વિષય તજ્જ્ઞનો અને તાલીમાર્થિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.



ચારુતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત અરીબાસ કોલેજ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા ઓરિએન્ટેશન પ્રોગ્રામ નિભિતે લેવાયેલ તસવીરમાં મંચરસ્થ સંસ્થાનાં કાર્યકારી વડા ડૉ. ભક્તિ બાજપાઈ, માઈકોબાયોલોજી વિભાગનાં અધ્યક્ષ ડૉ. શિદ્ધયા ગુપ્તે, જિનેટીક્સ વિભાગના અધ્યક્ષ ડૉ. જીનાભાઈ ચૌહાણ તથા પ્રાધ્યાપિકા ડૉ. રીતુ દીક્ષિત દ્રશ્યમાન થાય છે. અન્ય તસવીરોમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કાર્યકારી વડા તથા કાર્યક્રમનું સંચાલન કરતા ડૉ. આરીફભાન દ્રશ્યમાન થાય છે



ચારુતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત આઈ. બી. પટેલ ઇંગ્લિશ સ્કૂલ (મા. અને ઉ. મા) શાળાનું પરિણામ ૮૪ ટકા આવ્યું છે. શાળાના એ૧ શ્રેઢમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ સાથે શાળાના આચાર્ય ડૉ. મહેશભાઈ ખિસ્તી, સુપરવાઈઝર ભાસ્કરભાઈ પટેલ, દર્શનભાઈ સુથાર, રેખાબેન અને ભાવેશભાઈ ભંડુ તસવીરમાં નજરે પડે છે.

(ફોટો સૌજન્ય: પુષ્પેન્દ્ર આર. પટેલ, આણંદ)

July 2019

V-Vidyanagar 21 (7)

Published on 05.07.2019

No. of Pages 44 Including Cover

ISSN 0976 – 9609 V-Vidyanagar

Postal Regd. No. AND/318/2018-20

RNI Regd. No. Guj/2009-11/5433

Posted at Vallabh Vidyanagar on

5th of Every Month



ચારુતર વિદ્યામંડળ તથા રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત અને જ્ઞાન વહીવટી તંત્ર આણંદ દ્વારા સંચાલિત ૫ માં વિશ્વ યોગ દિન ૨૦૧૯ ઈની શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે ઉજવણી નિમિતે મંચસ્થ મુખ્ય મહેમાન શ્રી નરેશભાઈ સોલંકી (માનનીય અધ્યક્ષ ગુજરાત પદ્ધત વર્ગ વિકાસ નિગમ), અતિથી વિશેષ તરીકે ઉપરિસ્થિત જ્ઞાનાધારા સભ્યશ્રીઓ તથા પદાધીકારોશ્રીઓ, આણંદ જ્ઞાના કલેક્ટરશ્રી ડિલીપ રાણા, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી મો. શિરીષ કુલકર્ણી સી.વી.એમ ના માનદ મંત્રીશ્રી ડૉ. એસ.જી. પટેલ, આયોજક સંસ્થા ટી.વી.પટેલ હાઇસ્કુલ ના આચાર્યશ્રી વિજયભાઈ સુથાર તથા એસ.ડી.દેસાઈ હાઇસ્કુલ ના આચાર્યશ્રી દિપકભાઈ પટેલ, અન્ય મહાનુભાવો, યોગ શિક્ષકો દ્રશ્યમાન થાય છે. અન્ય તસવીરો માં યોગાભ્યાસ કરતા શિક્ષકગણ, વિદ્યાર્થીગણ તથા વિદ્યાનગરના નગર જનો દ્રશ્યમાન થાય છે.

Editor: Dr. Urvish Chhaya || Printed at Lajja Communications, Vidyanagar 388 120

Printed, Published and owned by Dr. S.G. Patel, Hon. Secretary, Charutar Vidya Mandal and
Published at Vallabh Vidyanagar 388120, Gujarat (INDIA)